

ઘેત્રદર્શિનો

૧૪૬

કલા:

સુનાલાલ દલપત્રામ કન્દ.

ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય

[ગુજરાતી કૌણ્સિલ વિભાગ]

અનુક્રમાંક

૧૨૫૭

વર્ષાંક

પુસ્તકલંબ નામ

ચિત્રા (શિલો)

વિષય ૮ - : ૩

પ્રેમલક્ષ્મિ - અન્થમાલા



- ૧, શ્રીમહ ભગવહગીતા
- ૨, મેધદૂત
- ૩, ધનુદુકુમાર, અંક ૧ લો
- ૪, જ્યા-જ્યાન્ત
- ૫, વસન્તોસવ
- ૬, ઉષા
- ૭, નદાના નદાના રાખ
- ૮, કાચ્ચાનિપુણિ
- ૯, કૃટલાંક કાચ્ચો
- ૧૦, ગીતસંગહ
- ૧૧, ચિત્રદર્શિની
- ૧૨, પ્રેમદંજ

પ્રકાશક:—

માતીલાલ શામળહાસ શાન્દી,

૧૦, સે-ડિસ્ટ્રીક્ટ રોડ, જમનાથાઘ મેન્થન-મુંખદ

प्रेमलक्ष्मि—अन्थमाला

चिंगारीनो।

कर्ता:—

नृणालाल दत्तपत्रराम कवि

अकाशक

मेतीलाल शामणदास शर्मा

वि. सं. १६७७ ध. स. १६२१

कींभत એ રૂપીઓ

ગુજરાત વિધાપીઠ અધ્યાત્મ
 આમદાવાદ
 ગુજરાતી કોપીરાઇટ-સંગ્રહ
 ૬૨૮૮

૮ - : ૯

કાયદા પ્રમાણે રજીસ્ટર્ડ

પ્રકાશક:- મોતીલાલ શામળાસ શર્મા,
 ૧૦, સેન્ડહસ્ટ^० રોડ, જમનાબાદ મેન્શન-મુંબાદ.

સુદક:- એમ. એન. કુળકર્ણી, કન્ટાઈક મેસ,
 ૪૩૪, ઠાકુરદાર, મુંબાદ.

જગતનાં સજજનો અને સજજનીઓને સમર્પણ

અલની અલવાડી શી જુદી અલાંડની ધરા:
મંધી ગુજરી કુંભેની છવાઈ છબિલી છટા.
એ કુંભે પુષ્પના છોડ, પુષ્પની વેલીએ રડી,
ઉગે, ને પાંગરે, મહોરે, પ્રષુદ્ધે રસપાંખડી.
લતા હિન્ડેલ ડોલની, ગભીરા પુષ્પમાંડવા,
સુગંધે ફેરતાં, પુષ્પે-યરાગે યે જૂનાનવા.
મેંદ્વા જીવનસન્દેશા મહોરેલાં ઉક્ષવેલના,
વધાવે વિશ્વને આને, આધું-દેરં મહેકતા.
એ પરાગ નથી અન્ય, ન અન્યે એ સુવાસના,
અલાડી અલવાતી એ અલની અલભાવના.
અહો ! એ જગતા જેણી ! તપસ્વી ! સાધુસાધ્વિએ !
અલપરાગ રહેકન્તાં મહાઆતમન્ મહારાયે !
અમારાં અલપુષ્પોમાં અલગંધ હશે ઉછોઃ
જોરવી ગુજરીના આ સતકારો તહો ય સદ્ગુણો.

પ્રસ્તાવના

→ ३०८ ←

વિવિધ પ્રસંગોએ હોરાયેલાં શખ્ષાચિત્રોનો આ લેખ-
સંઅહ છે. આજથી લગભગ ચાળાશેક વર્ષોં ઉપર ડૉ. હરિ-
લખદેં કુવનું ચિત્રદર્શન કાચ્ય છપાયું હતું, અને
સ્ન. નવલરામભાઈએ તુને વધાન્યું હતું. આ સંઅહમાં
કેટલાંક ઐતિહાસિક ચિત્રો છે, ને કેટલાંક કાચ્યનિક છે;
કેટલાંક મનુષ્યરત્નોનાં છે, કેટલાંક પ્રસંગોનાં છે, ને કેટલાંક
કુદરત કે કલાની વિશેષતાનાં છે. રાજ્યામણી ગુજરાત અને
ગુણવન્નાં ગુજરાતીઓને સદાનાં જારવશાળી કરનારં યે આ
સંઅહમાં થાડું નથી.

આ લેખભાલામાં કેટલુંક નથી તુને માટે હું દિલગીર
છું. સ્ન. જમના અહેન સફકાત તથા પ્રો. ગજાજર એ
રનેણીએ ને ગુજરાત્રત્નોનાં દર્શન આ દર્શનાવલિમાં નથી.
ગુજરાતમુખ્યધના ઉદ્યોગનાંનારના વડિલ ને અમદાવાહના
પિતામહ રણુંડોડાલ ‘રૂહેંટ્રિયાવાળા’ અને પ્રેમસાયની
લાડલ વગાડનાર વીરયુરૂણ નર્મનાં યે ચિત્રો આમાં નથી.
એ નથી તે આ સંઅહની રહને તો ઉણ્ણો બાગે છે.

આવાં શખ્ષાચિત્રોના આલેખકાએ એક સાવચેતી
રાખવાની હોય છે, ને આમાં એ કેટલી સચ્ચવાઈ છે તે

ચિત્રદર્શના

મહારે પારખી ફ્રેંચાનું નથી. રંગચિત્રની ચેઠે શાખદચિત્રે સાચ્ચું જ હોવું જોઈએ; સ્નેહને લીધે સલહર્ષનમાં દાખિલિકાર ન જ થવો જોઈએ: ન હોય તે નિરખાવું ન જોઈએ, કે હોય તે પરણુણપરમાળુનો પર્વત ન થવો જોઈએ. નયનની સ્વર્ણાંત્રતા ને વિવેકનાં માપ સાચવનાં યે ડેટલાક વેળા ઘતિહાસનાં તેજકિરણો એવાં વરસતાં હોય છે કે ચોક્કી ને સાવચેતીવાળી આંખને યે ઝાંઝવાનાં દર્શન થાય છે.

ડેટલાક સાહિલ્યરસિડો તો કવિતાની દુંડુંડી વ્યાખ્યા જ શાખદચિત્રને કઢે છે. એ વ્યાખ્યા એકદેશી છે, સર્વદેશી કે સત્ત્વદર્શી નથી. ડેટલાકનો વળી એવો યે અલિપ્રાય હોય છે કે સાહિલ્યકારે માનવકથા ન ગાવી જોઈએ. આ અલિપ્રાયે ઉપરછલ્યો છે, તત્ત્વપારખુ કે મનનશીલ નથી. મનુષ્યની કુદરતની કલાની પ્રસંગની વિશેપત્તાનાં, જગતાથ પંડિતના શબ્દોમાં ‘લેડોાતર રમણીયતા’ નાં, ગુણુકીર્તન ડેખ સાહિલ્ય ઉપાસક જેટલે અંશે ગાય તેટલે અંશે પ્રભુની જ પ્રગટ પ્રભુતાનાં તે ગુણુકીર્તન ગાય છે. એ સહુ પ્રભુની જ વિધવિધ વિભૂતિએ છે એનું ગીતાળનું વચન છે:

યद્વાચિભૂતિમત્તસત્ત્વં શ્રીમદ્રજિતમેવ વા
તત્ત્વદેવાવગઢ્છ ત્વં મમ તેજોઽશસંભવમ् ।

નૃાનાલાલ દલપતરામ કવિ


અનુક્રમણીકા



અંક	નામ	પાઠું
૧	ગુજરાત	૧ ✓
૨	શરદ પુનમ	૬
૩	કુલયોગિની	૧૦
૪	સૈભાગ્યવતી	૧૭ ✓
૫	નવર્યોવના	૨૨
૬	કાહિયાણીનું ગીત	૨૭
૭	રાજવીર	૩૦ ✓
૮	શ્રીમન્ત મહારાજ સયાજીરાવંગાયકવાડ	૩૬
૯	તાજમહેલ	૪૦
૧૦	ચારુ વાટિકા	૪૪
૧૧	આવણી અમાસ	૪૦
૧૨	અહંકારીકા	૪૩ ✓
૧૩	ગુરુહેવ	૪૬ ✓
✓૧૪	સૈંચાંદનો સાધુ	૪૭
✓૧૫	પિતૃતર્પણુ	૧૦૨ ✓
૧૬	મહારિં દ્વાનંદ સરસ્વતી	૧૧૪
✓૧૭	ગુજરાતનો તપસ્વી	૧૨૩ ✓
૧૮	ગુજરી કુંજો	૧૩૬

(૧)

ગુજરાત



એક ઐતિહાસિક કાવ્ય

૧. ધન્ય હો ! ધન્યજ પુર્યપ્રહેદા !
 અમારો ગુણ્યલ ગુજરાત દેશ;
 કૃષ્ણચન્દ્રની ડેમદીજજળો,
 કીધ પ્રલુચે ય સ્વહેદા :
 અમારો ગુણ્યલ ગુજરાત દેશ. ધન્ય હો !
૨. આર્યનું સાગરતીર્થ પુરાણ,
 તપોવન ભૃગુવસિષ્ઠના ભાણ;
 ગીતાના ગાનારા મહારાજ
 પાર્થના સારથીનાં જરૂરાં રાજયઃ
 શ્રીસરોમથી ય જૂનાં,
 કુરૂપાંડવથી યે માચીન,
 સોમનાથ, ગિરિનગર, દ્વારિકા :
 યુગ્યુગ ધ્યાનવિલીન

ઉભીને કાલસિન્ધુને તીર
અળવે બંસરી લબ્ધ સુધીર. ધન્ય હો !

૩. રથનેરથળ નવપત્લવના પુંજ,
નહી ને તળાવ કેરી કુંજ;
કેમળી કવિતા સમ સુરસાળ
સિન્ધુ જર્ખાં હે મોતીના થાણ :
જગન્નાના નિજ ગીત ગજીતો
ફરતો સાગર આજ ;
કેસર ઉછળી ધૂધવે ગશવે।
વનમાં જર્ખાં વનરાજ :
ગિરિગિરિ શિખરશિખર સોહનત
મન્દિરે ધ્વજ ને સન્ત મહન્ત. ધન્ય હો !

૪. પૂર્વથી પશ્ચિમ વહે પ્રકાશ,
ન્હાણુ ભરી ઠેતી તેમ નિકાસ ;
મોઢી આંગણુ ઉત્થેરો જ યૂરોપ,
વીણુવા વાડીના ફૂલરોપ ;
વીણુના ન વણુસે પુણ્યપાંગરી
અમ રસભૂમિની છાય ;
જગમોહન મુંબદ નગરી જૂવો !
શું પાથરો કિનખાય :
નિત્ય નવફૂલે ખીદે અભિરામ
લક્ષ્મીમહોર્યાં લક્ષ્મીનાં ધામ. ધન્ય હો !

ચિત્રફક્તિનો।

૫. ચોળા, ચખુયો, પાઠલીનો ધેર,
સેંથલે સાળુની સોનલ સેર;
છેડલે આચ્છાદી ઉરભાવ,
લલિત લજ્જાનો વદન જમાવ;
અંગ આપે યે નિજ અલઘેલ
સાળુભાં ટાંકતી રૂપની વેલ;
રાણુકતનયા, લાવરોલાના,
સુંહરતાનો શું છોડ !
આર્ય સુંદરી ! નથી અવનીમાં
તુજ રૂપગુણુની જોડ ;
ભાલ કુંકુમ, કર કંકણુ સાર,
કંચનાં સંજયાં તેજશબુગાર. ધન્ય હો !

૬. એતરો ન્હાનાં, ન્હાની શા પોળ,
નાતજાતે ન્હાનડિયા ધોળ ;
ક્ષત્રીજયાનાં ન્હાનલ રાજ્ય,
ધર્મના ન્હાનકડા જ સમાજ ;
વૃદ્ધ ચાણ્યાદ્યે વર્ષયાં પૂર્વે
ન્હાનાં મ્રજનાં તન્ત્ર,
એહ પુરાતનના પડણાયા
આ અમ જીવનજન્ત્ર :
એક ફૂલવેલે ફૂલતાં ફૂલ,
અમારા એક સુગંધ અમૂલ. ધન્ય હો !

૭. દેશ નિજ તળ ધર્મને કાજ
આગરે ઝુકાવ્યું સહરી જહાજ;
ધર્મવીર પારસીનો સત્કાર
જગતધર્તિહાસે અનુપ ઉદાર;
ઘરલાભી યાત્રાળું આ
મદ્દકાનું મુખબાર;
હિન્દુ મુસલમિન પારસીઓને
અહિયાં તીરથદાર:
પ્રભુ છે એક, ભૂમિ છે એક,—
પિતા છે એક, માત છે એક,—
આપણે એકની પ્રણ અનેક. ધન્ય હો !
૮. નથી રભી સમરોરોના દાવ,
નથી લમ ધણ્ણા જીલ્યા યે ધાવ;
શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રની મહાંય
લીધાં પ્રત, જણે હજુ ય પળાય :
એક ધડરના વનકેસરીએ,
અડવીર બાપોપારાવ,
વિશ્વવન્દ સુરજકુળ સ્થાપી
ચિતોડ કીધ યશછાંવ :
જ-મભૂમિ દ્યાનનદનાં ધામ,
ગાંધીનાં ગીતાળવન નિષ્કામ. ધન્ય હો !
૯. સરતના રસિક રંગીલા રાજ,
ઝુદ્ધિધન ભર્યો શ્રીનગરસમાજ ;

થરવીર સ્નારાષ્ટ્રી યથવાન,
કુંજના સાહસિક સન્તાન ;
ખંડખંડ વિસ્તરતો હિન્દી
મહાસાગર મહારેલ,
તીરતીર જધ સ્થાપી ગુજર્રી
સંસ્થાનોની વેલ ;
મહાસાગરના પૃથ્વિવિશ્વાળ
સરોવર ક્રીધાં ગુજર્રી બાળ. ખન્ય હો !

૧૦. વનેવન લીલો ધટાસોહાગ,
જગતનો દીપે શું અમુલભ બાગ !
સન્નાયા નૈને રસશાયુગાર,
લતામંડપ સમ ધર્મગાર ;
ભારતીએ કંધ ફૂલફૂવારો
અંજલિમાં શું લીધ !
દિશાહિસમાં ફૂલધાર ઉંડાવી
દિલનાં પરિમળ દીધ !
હિન્દ માતની લાડિસી બાળ !
ગુજર્રી ! જય ! જય ! તવ ચિરકાળ ! ખન્ય હો !

(२)

શરદ પુનર્મ



પડ્યો હતો તે તટ વિશ્વનો વડો,
 અગાધ એકાન્ત હતો ઊડો ઊડો;
 મશાન્ત ઝૂકી હતી આલની ઘટા,
 માઆવતી સાગરની હતી છટા.

આનિત આનિત હતી ગાઢ હૈયામાં અન્તરિક્ષમાં;
 રહાં સંભાના મહાઆરે દીઠી ઉગન્તી પૂર્ણિમા.

લંજળનમેલું નિજ મન્દ પોપચું,
 કેં મુગધ બાલા શરમાતી આવરે;
 ને શોભી રહે નિર્મલ નેનની લીલા,
 એવી ઊગી અન્દ્રકલા ધીરે ધીરે.

અન્તરે ઉધડ્યાં, સિનંદુ સળક્યો, જાગી ચેતના,
 અને ગુંજ રહી મીઠી ગોછિની મન્દ મૂર્ખના.

ચિત્રદશાનો

અલી મિયાનયનાં શર, ને વીધાધ,
પોઢ્યો હતાથ પ્રિય મૂર્છિત ઇપદર્શો;
તે બ્હાલી સ્પર્શથી સચેતન થાય, તેમ
નાગ્યો નૃલોક નવચેતન ચન્દ્રસ્પર્શો.

મીડા ખેલામણે કંઈકાંક વાદળી કોંક વર્ષશો,
અને ડો છીપમાં આજે મેધનાં મોતીડાં થશે.

વદન પુનમચન્દ શું વિહાસે,
જલધરતું ધરી ઓદળણું વિલાસે;
પરિમલ પ્રગટાવતી ઉમંગે,
શરદ સુહાય રસીલી અંગઅંગે.

હૈયાના ઘેલમાં જેવી કવિતા ચમકી રહે,
એવી જેણી પ્રલાવન્તી ચન્દ્રની ચન્દ્રિકા વહે.

મહે ભરેલી અણી ઠીલડી કરી,
સોણાગી દેહે રસપામરી ધરી;
શોભે ઉભી સુદર્દી જેમ ઘુરીએ:
ચન્દ્રા રહુડે છે નભની અટારીએ.

હે છે સ્નેહની હેરે જેવું હું, એ સુધાસુભિ!
હે છે એવું અત્થારે ચાર ચન્દ્રકલા, સભિ!

સરવરજલ જેવું વ્યોમનીર
અતલ પડ્યું પથરાઈ નીલધેરં :

પરિમલ પમરી સુધામલાના
કમલ ખીટું મંદી એક ચન્દ્રી કેઢે.

નમી આ ચાંખડી હુઠારી બાળી એ હેવથાલિકા;
નમ્યાં સ્ત્રી જગનાં લોડો, નમી સ્ત્રી જાંખી તારિકા.

જેવું જૂલો સાગરઊર નાવડું,
કે મેધને અંક કપેતિની રૂં;
એવી સભિ ! ચન્દ્રકલા સુજૂલતી,
જયોતસ્નાસરે એકલ લીજતી જતી.

આજે છે મધ્ય રાત્રી, ને ગાજે છે તેજનિર્જરી;
ગાજે છે ખોખરા શખ્દે દૂર સાગરખંજરી.

ક્રાન્નેહી કેરા સ્નેહના કુંજારે
અખંડજયોતસ્ના સ્નેહરાણી પધારે,
ને એકલી એ સ્નેહકુંને ઝજૂમે :
મધ્યાકારો ત્યમ સુતનુ તે ચન્દ્રી એકાડી ધૂમે.

એકલાં ઉગવું, સહેવું, એકલાં આથમી જવું :
સ્નેહથી છલકાતા આ સંસારે એમ શે થવું ?

હૈનિ ! અમારા ઉરમાં પધારને !
દારે દીપો એમ હિલે સદા હજો !
આત્મા વિશે રંક, ગરીબ બારણે
આ પાટ માંડ્યા સહુ આપ કારણે.

ચિત્રદર્શનો

૬

સાગરે ભરતી જમી, ને જમી ભરતી છરે:
ધેરા ધેરા અનેરા તહાં જગ્યા સંગીતના સુરે.

કરી સ્તુતિ તે વિધુકન્યકા તણી,
ઉન્ઘારી ક્ષીતિં પ્રકૃતિની ધણી ધણી;
ને સ્નેહમન્ત્રો ય અનેક ભાખ્યાઃ
એ સ્તોત્રના સૈા ધ્વનિ વ્યોમ વ્યાપિયા.

અમીથી આંખડી આંજી, મન્ત્ર સૌલાગ્યના લખી,
વિશ્વના ચોકમાં રાસ એલે અન્દકલા, સખી !

રનેઢી હતાં દૂર, સમક્ષ તે થયાં,
આધે હતાં, તે ઉરમાં રમી રથાં;
ને મૃત્યુશાયી પણુ ગ્રાણુમાં ઉલાંઃ
એવી બધે સાત્ત્વિક વિસ્તરી પ્રલા.

તપે છે સૂદિને માધે પુષ્યન્યોત મહા પ્રલુઃ
તપી તહેવી ધરી તો તે પુષ્યની પૂર્ણિમા વિશ્વ.



(૩)

કુલયોગિની



૧

બરેલા સરમાં નીર ખાતાં'તાં મન્દ હેલિયાં;
ને હૈયું યે રહડયું હેલે, દશ્યાં રહાં હેવીનાં થયાં.

૨

છે એક ઉજ્જવળ પુરાણુપ્રસિદ્ધ દેશ,
ઉભામતાપભર સ્થાં તપે હુમેશ;
આતિથ્યની નગરીએ જયંહિ નહાની નહાની;
રહાં છે અમારી કુલની લધુ રાજ્યધાની.

૩

તોઢાની બાળુડાંને રહાં જોતી નેન ડંડા ભરી,
એકા'તી દામણી દ્વી, દેહે સૈા દીનતા ધરી.

૪

સખિ ! રહાં સુકુમાર વાંકડી
નમતી એક હતી બદામડી;

યુચના હુમ ધીમું ડાલતા,
ધવળ જેવા ગગને વિરાજતા.

૫.

ખારથ્યામાં કરે રક્ષા સદા યે હતુવો જતી;
લીમડાની શીળા છાયા આંગણે પાથરી હતી.

૬

જાંખો મ્રકાશ તરુણળણી મંહીથી આવે,
ને ઓશારી મંહી સુનનામ તે બિછાવે;
તર્હાં લીલી એકસર ભાલતી વેલ દીપે,
ને એક ડેલર હતો તુલસી સમીપે.

૭

માંડલો માંડવો આછો ચોકમાં છાંયડી કરે;
એક-એ જૂધની વેલો સુકાતી હતી તે પરે.

૮

તે તેજલીંખી શીળા ઓશારીમાં
પ્રારઘની પોથી ઉધાડી ધીમાં
દેવી જૂવે તે મંહી ભાગ્યલેખ,
મુખે હતી હુઃખિણી કેરી રેખ.

૯

અન્તરિક્ષે હતી દણિટ, સૂતી ને કાંછ શોધતો,
છું તે પેખતી -હોતી, -હોછું તહેને નિહાળતી.

૧૦

હણે ન શોધ, તુજને જડશે નહીં તે,
તારો નઢોાર નથી નાથ અંધી ક્ષયંધી ચે;
આઘે ભરે શરીર, ભૂલ્યું મને ભમન્ત,
એકાંકિની મૂકી હણે અતિ એ દમન્ત.

૧૧

આંખડી શત્યતાની એ પછી પાછી વળા નમે
કાદવે કમળો જેવાં બાળ જર્દાં ધૂળમાં રમે.

૧૨

કદીક સ્નેહે તુજ કંદ ગેલતાં,
કદીક હેતે મુજ નામ બોલતાં;
કદીક મીઠી નિજ મસ્તીમાં મચે:
હમેશ ન્હાનાં કંધ નાટકો રચે.

૧૩

ઉતાર્યાં દિલથી એવાં દિલે સમૃદ્ધ બાલહો;
વિસાર્યાં ન્હાલસહોયાં રહેં આત્મશાલર અર્લેડો.

૧૪

લગ્નગળુ લોચન મનોહર કેરં ચાહ,
તેજસ્વી આનન અનુપમનું સુચ્યારં;
સોહાગશાલિત વિલાસ વિનોહિનીના,
આનનનાં ગહન હાસ્ય : કરી કમીના ?

૧૫

અન્તરે કોઈ યે, બાપુ! ઓષ્ઠું મા આણુશો રજે;
આપણા બાળની, દેવિ! તું માતા-તું પિતા થજે.

૧૬

તનિયાં બાળ, તજ મનોરમા;
કરણુણ! કરણે બધું ક્ષમા;
પ્રિય! ડાઢાં થઈ માનું માનજે,
કુલને છાજતી રીત ચાલજે.

૧૭

આવશે અતિથિઝે દેવી કે કોઈ દેવતા,
કે સ્નેહી ડા, સગાં ડા, કે હરિનાં જન ભાવતાં.

૧૮

આતિથ્ય ચોખ્ય સહૃતું સખિ! તું કરીશ,
ચિન્તા નથી લગીર, અધ્ય પહે ધરીશ;
સૌ પૂછશે કુશળ, તું સુજ સાંઘ ફેલેને,
ગ્રહારી વતીય સખિ! અંજલિ અધ્યદેને.

૧૯

દેવિ! તું કુલની રાણી, હું યે ગ્રહમાન તાહરે;
માંડયું લેં કુલતું રાજ્ય, રાજ્યોગ ખરો કરો.

૨૦

કંદારેક તો તું કુલ માટ રાંધતી,
કંદારેક તું મેલ રહુડ્યા ઉતારતી;

કુલારેક પૂજુ પ્રભુ આશિષે। લહે :
નિત્યે ય ચિન્તા કુલક્ષેમની વહે.

૨૧

જિપાડે કુલનો ભાર, ભાર્યા તે સતીને ભથ્થી:
સંબાળે ગુહની શોભા, તે દેવી ગૃહિણી ગણી.

૨૨.

દેવી ! સતિ ! પરમ પાવનકારી ભાર્યા !
કલ્યાણિનિ ! ગૃહિણી ! એઓ પ્રભુગ્રેમી આર્યા !
ઢોળે શિરે નહિકરો પતિ સૈં ચુમાને,
'સર્વરવ સેંઘું મુજને જ' તું એમ માને.

૨૩

ન ખૂચે ભાવ એ તહારો, કે લેશો રહમતે નહીં,
તહો એ તું શાન્તિથી સેવા સદા સૈાની કરી રહી.

૨૪

ભમે-ભમે દેહ ભલે વિદેશો,
ભલે ભમે આ મનહું વિશેષે;
નથી-નથી એક ધડી ય ન્યારં
કલ્યાણું ! આકર્ષણું હૈવી તહારં.

૨૫

માદરી અંદરી કેરં સુહાગી મધ્યબિન્હ તું :
અન્ધારી રાત્રિમાં મહારી અમાનો પૂર્ણ ધન્હ તું :

૨૬

મારી જ વેદી ગૃહની, લીંપી પંચગવ્ય,
તેણ આદર્યો ગુણવત્તિ ! કુલયજી ભવ્ય;
પંચામિ પંચસ્થિત્ય પંચ દિશો જલે છે,
હેમાધને હવિ ઇપે મંદી તું બળે છે.

૨૭

સદાની ચે તહે લાધી સમાધિ કુલયોગની:
આત્મામાં જ્યોતિ એ ધારી સોહે તું યોગિની બની.

૨૮

વિચરે તું નહિ કદ્યના વિશે,
વિસરે ના કંઈ ભાન્તિને મિશે;
તુજને લાધી સમાધિ કર્મની,
કવિતા અવ છ તું સ્વર્ધમની.

૨૯

કરીને સેવના મહારી ક્રીધા તહે નિત્યનો જડણી:
નમેરો—નગુણો છું ફું, તું તો સાધ્વી મહાગુણી.

૩૦

એ રહાર્દં જડણ સખિ ! હેમ શીટ્યું શીટારો ?
એ જડણના જડણી તણું સજનિ ! શું થારો ?
એ શાન્તમર્તી ! વરદાયિની કુલદેવિ ;
રહારી શુલાસ્થિપથી રહાર્દં અશુલ જરો.

૩૧

કો નથી અધુરું વિશ્વે ? હું નથી ? કે શું હું નથી ?
કે તહારા ગુણું ગાને દેવિ ! આ અધુરું નથી ?

૩૨

અહો ! મહાભાગ તળાવતીર !
અહો ! મહાભાગ હું યે લગીર :
જેવી તહમારાં જલમાં વનશ્રી,
તેવી જ મહારા જિરમાં કુલશ્રી.

૩૩

માહરા કુલમાં, ધીને, જરૂરાં હો રહાં, એ તપસ્વિનિ !
નમો—નમો, મહાદેવિ ! એ નમો, કુલયોગિનિ !

(૪)

સૌભાગ્યવતી



મોગરાનો મંડપ હતો,
ને મંડપ નીચે તે ઉભી હતીઃ
જણે ફૂલની લટકતી સેર.

આસપાસ અજવાળાં ઉગતાં,
ને દિશાદિશાર્મા વસન્ત ઢોળાતી.
ક્યારેક્યારે કળાએ ઉધડતી,
પત્રેપત્રે પુષ્પ પ્રગટતાં હતાં.
ફૂલના સરોવર સરિખડી વાડીમાં
તે વાડી જેવી વિરાજતી.

વદને તહેને વસન્ત હસતી,
હૃદ્યે તહેને વસન્ત લહરતી,
બારણે તહેને વસન્ત ઘોલતી,
ઓારડે તહેને વસન્ત વિહરતી, :

કુલમાં તહેના વસન્તના વાસ હતા.
વસન્તનો વર પામેલી વસન્તપૂજારણ
આંગળું ભરી ઉલ્લી હતી.

સૌભાગ્યના આભૂષણે શાખુગરાયેલી,
સંસારના મહાશાખુગાર રૂપ,
તે એક સૌભાગ્યવતી હતી.

પગલાંમાં તહેનાં પુણ્ય હતાં,
ચરણે ધરા નહોતી ચંપાતી.
કુલાશમનો માથે ગોખ ધારી
મારણ્યપુત્રી તે સ્વિમત કરતી સોહાતી.

સૌન્દર્યના ચન્દ્ર સસું સુખદું હતું,
ને સુખડે સુદૃતા પમરતી.
લબ્નમણીના છોડ જેવાં
અકુટિનાં ચાપ નમેલાં હતાં.
નીચે કલ્યાણુકારી કોકીઓમાં
આદર ને આતિથ્ય ઉધડતાં.
આંખલડી આનન્દભીની હતી,
કેશાવલી સધન વિરાજતી.
અંધોડલે કૂલવેષ્ણી વિલસતી,
મંધીથી સૌભાગ્યની ફેરમ ફેરતી.
હૈયામાં નાથની વરમાળ કૂલતી,
ઉરખંડે અનેરી ધરા ગોરંભતી.

અન્તરમાં મોળાં ઉછળતાં,
 ઉરખન્ધ તૂડુ તૂડુ થતાં.
 રોમરોમમાં ભાવિ વિશ્વ રમતાં.
 વિલાસની દોલવિલોલ લીલા શી,
 સૌભાગ્યના સુધાકર સરિખી,
 સુન્દરતાની વસ્તુની જેવી,
 સ્વાગીરસેહની પ્રતિમા સમી
 ગૃહલક્ષ્મી ગૃહદારે ડાલતી;
 વાત્સલ્યની વેલી સમોવડી
 કુલાગારે ઝુકેલી હતી.
 કલાપીની સંકેલેલી કલા સમી
 દેહદેશે નવરંગ સાડી સરતી,
 મંદી લજણની લહરીએ લહરતી.
 પવિત્રતાની પાંદડીએ જેવા
 ગાલ ઉપર, ભાલપત્રે,
 નાથના સ્નેહલેખ હતાં.
 ઉરમાંથી અમૃતના છુવારા ફૂટતા,
 સન્તાન તે જીવન પી અમર થતાં.
 ભરથારની દેવી સંપત્તિ સમી
 દેહાકારો ઉષા ઉધડતી:
 કાન્તિમાં કન્થના કોડ ઝાહળતા.
 શીલનો મલાદ, પ્રભુતા શો,
 અખંડ પ્રભાએ પ્રકાશતો.
 અંગેઅંગને વિશે

अक्षा, सरलता, शुश्रुषा हतां :
जगतनी जगतनी नेवी
सुन्दरी लरी लरी भासती.
दण्डिभां सन्तोष ने शान्ति हतां,
आंखडीभां अनेक संसार भटमटतां.
उदारलोचन, प्रसन्नवद्धन, शीलशीतल,
चन्द्रिका विस्तरती पूर्णिमा नेवी
उरद्देहनी वसन्त विस्तरती,
स्वाभीवत शी अविचल
उभमरनी स्फटिकशिलाने पाटे
सौभाग्यवती उल्ली हती :
જाणु जगतनी जगदीश्वरी.

पडोशभां आंबावाडियां हतां.
मंहीथी क्लायलोानी कल्लोलवाण्डी
माधुर्यना अलिषेक करती.

सन्मुख माधवीनां झूल खरेलां हतां :
जाणु त्हेनां मुखनां वेरायेलां वेणु.

कुलाशभने आंगणे वसन्त पधारी हती,
चोकभां न-हननां च-हन वर्षतां.
आन-हवदने भगवती
वन्दन वन्दी वसन्त पूजती :
कुंकुम ने अक्षत छुडावी

અક્ષત કુંકુમના અધિકાર ભાગતી.
અવેલવ, માણુયાત્રાના તીથે તીથે,
એ વલ્લભનો સહચાર વાંઝતી.

નવવર્ષની વાદળ જેવી
તે આશા લરી હતી:
કુંકુમના આધાર જેવી
તે ધીર ધરિત્રી હતી:
રનેહની પરમ લાગીરથી જેવી
હેવી પતિતપાવની હતી.

સૌભાગ્યના હેવ સરિખડો
કાડામણો કન્થ પધાર્યો:
સીતાની વાડીએ જાણે રામ.
જીવનનાં જલથી વધાયો,
પ્રાણુને પદ્માસન પધરાયો.
આશા છણ્ણી રહોડમાં ઉભી:
સુસુક્ષુ સુક્રિતને ઉમ્મર ઉભો.
આરતીની શિખાએ સમોવડી
નયનોમાં જ્યોતિર્મણ પ્રગટી.
ખારણે અદ્ભુત ઉનસ ઉધડ્યો.
અન્તરિક્ષથી અનિલ આવ્યા,
રનેહના સંહેશાએ લર્યા તેજવાદળ
તે દિશાદિશામાં લઘ પરવર્યા.

(૫)

નવયૌવના



કોઈ કુહેરો।

તે શા વિચાર કરતી હતી ?

મધ્યાહ્ન હતો,
 સૂછિને સેંથે સૂર્ય વિરાજતો.
 આશપાશનું ઉંડું આકાશ
 નીલધેરં ને નિર્મળું હતું.
 ક્ષિતિજ ઉપર જલભર પયોદ,
 વિચનાટકના પડા જેવાં,
 અષ્ટર સરતાં, પડતાં,
 ને ધીમેશથી ઉપડતાં.
 મધ્યાહ્ન ખાલેલો ને નિર્જન હતો.

સન્મુખ સાગર લહરતો:
 જાણે આકાશ જ ડિતારી પાથરું !

જલ ઉપર કિરણુ રમતાં,
હૃપાની રેખાઓ દોરતાં,
હસ્તી હસી મીઠ મટમટાવતાં,
ને ઉડી ઉડી જતાં રહેતાં.
સાગરનો વિશાળ પલવટ
મધ્યાહ્નમાં પલપલતો હતો.

જડુ વર્ષી હતી,
ને વર્ષાની તે શરદમંજરી હતી.
કિનારા લીલા ને પ્રસન્ન હતા.
ધરા આંખ હારતી.
વિધિનું ચીતરેલ ચિત્ર હોય,
સુષ્ઠિ તેવી કદી સ્થિર ભાસતી.
કાલે મેઘ વરસી ગયો હતો :
આજ પદ્માર્થો ઉપર જલનો રંગ અમકતો.
ભીની તેજસ્વિની લીલાશ
દિશાદિશમાં પ્રસન્નતાથી પ્રકાશતી.
આજાં તેજ અને અન્ધકાર
પાંડાંમાં સન્તારૂકડી રમતાં.

આધા સાગર ઉપરથી
શીતલ અનિલ આવતા.
સુજનને સૂર્ય ઉભા દેતો,
અમિને અનિલ આવરી દેતા.

સકલ સુજનઅવકાશ ભરી
ઉઠમા ને શીતળતાની ઉભિંચ્યો ઉછળતી.

ગડુડના માળા જેવી
અન્તરિક્ષે એક આરસની અટારી લટકતી.
મહી આરસના પાટ માંડેલા હતા.
અકુટિકાતરેલ કમાન નીચે
નમેલી રસલર વેલી સમી
એક યૈવના ઝુકેલી હતી.
તુલસીના છોડ સરિખડાં આશપાશ
સખ્યાં શા પડણાયા રમતા.
ઉપર દ્રાક્ષનો ઝુભયો અજૂમતો.
સુનદરીનાં સુનદર નયનો
સાગરના ઓધ ઓળંગતાં.
ચુલાખની પાંદડીએ જેવાં ચરણ
આરસમાં ચુલાખ પાડતા.
જમણ્ણા કરમાં મોગરાની માળા હતી.
સુકુમાર પ્રભાતરંગી સાળુમાંથી
અમૃતના સરોવર સરખો દેખ
અને તેજરષી કરનો કમલદંડ
હાથેળાનું પુષ્પ મ્રદુલી આપવા આવતા.
અંગે અનંગની લરમ ચોળી હતી.
મુખ્યે કવિએની કવિતા મ્રકાશતી.
કીકીમાં સ્વમ રષુરતાં.

પાંદડી જેવાં પોપચાં ફરકતાં,
હૈયું ભરેલું ને વિશાળ હતું.
વિધિધીઘેલ રત્ન સમેં
લાલદેશે ચન્દ્રક રાજતો.
અંગઅંગ ફૂલ ફોરતાં.
કૃાદિલ ડાળ એસે ને દીપે,
તેમ રમણી નિજ કુંજે શોભતી.
અલૈાકિક રંગી ધન્દ્રચોપ જેવી
જગત ઉપર તે નમેલી હતી.
તે યાવના શા વિચાર કરતી?

ચાંદનીના દગલા જેવું
શૈવેત નહાનકડું હરણુંનું બચ્ચું
નીચે રખાની સાંકળે બાંધેલું હતું.

યાવના શું વિચારતી?
માણુની ભરતી લેચનમાં ડોલતી.
મધ્યાહનાં તેજ વિલોકતી?
જલના રંગ આલોચતી?
સાગરના તલ નિહાળતી?
અસીમ જલરેખાઓ વીંધી વીંધી
રહામી પારનો સંગમ શોધતી?
ગુલાબની અંજલી જેવું મુખું,
મહીં આકાશના બાણું જેવાં નયન:

આધી ઉપાના ઓંજતું અંગ હતું.
યોવના શાં ધન્દળળ જેતી?

એક વાદળી આવી:
મહાનૈકાના મહિમાવતી
દૂરથી એક વાદળી આવી.
સૃષ્ટિ ઉપર પાલવ પાથરતી—સંકેલતી
તેજભાયાની રમત રમતી રમતી
યોવનાને વદન અડકી ગઈ.

કોઠ—કોઠ ઝણેશો।
તે નવ્યોવના શું વીચારતી હતી?

(૬)

કાઠિયાણીનું ગીત



મહારા સાવજશરા નાથ હો ! તહારે દેશ-કશા પરદેશ !
 કેસરધોળી કંકાવટી, ને કુંકુમધોળ્યો થાળ;
 સુરજ ! તુજને પૂજશું મહારે સુરજદેવળ પાળ:

મહારા સાવજશરા.

આલ દળ્યાં ધરતી ઉરે, ર્ખાં ગોરંભે કાંધ ગીર;
 કુંભે એલે મોરલો, મહારે હૈયે નથુદલવીર:

મહારા સાવજશરા.

રાતે ઉધં પોથણ્યાં, ને દિવસે કમળની વેલ;
 ભાદર લરજેયન ભરી, એવી મુજ હૈયાની હેલઃ

મહારા સાવજશરા.

કુંચો ગઢ અલખેલડો, પડખે ચારણુના નેહ;
 જીણી અઝૂકે વીજળી, મહારે જીણું વરસે મેહઃ

મહારા સાવજશરા..

સાતમે માળ અટારીએ કંઈ આછા વાય સમીર;
જુમી મહારી હેલે રહડી, મહારાં જૂદે આછાં મલીર:
મહારા સાવજશરા.

આડાં ન આવે ઝાડવાં, એવા લાંબા લાંબા પન્થ;
માણુકીએ રહડી આવશે મહારો સૂરજમુખો કન્થઃ
મહારા સાવજશરા.

નેણુથી લાલા છોડતો, કંઈ આંકડિયાળા ડેશ;
ધણુ વાળાને વળશે મહારો કન્થડ જેખનવેશઃ
મહારા સાવજશરા.

આલ ઝીલીને રેવત ઉભો, ઇરતો ગિરિનો સાથ;
વનમાં ગાજે કેસરી, કંઈ ધીંગાણે મુજ નાથઃ
મહારા સાવજશરા.

કસુંઅલરાતી આંખડી, રામેરામ ઢીગલનાં દૂધ;
અળખાહુમાં અરધી ઉછળે, દાલે ટળકે જુદ્ધઃ
મહારા સાવજશરા.

સાગર સમ સોરહ તથ્યો રે હિલોળા લેતી બોામ,
અરતીને પૂર પધારશે મહારો છેલડ જળને જોમઃ
મહારા સાવજશરા.

ભાલે ટમકે ગીલડી, મહારે હાથે હેમત્રિશળ;
સિન્હુરે છાંદી ચુંદડી, મહારાં સોહે સૂરજકુણઃ
મહારા સાવજશરા.

આશલરી અલખેલડી રે હીંચે હિન્ડાળાખાટ;
પિયુના પન્થ નિહાળતી કાંધ ઠાલમની જૂવે વાટ:

મહારા સાવજથરા.

આધા ગીરના કુંગરા, એથી આધેરો ગુજરાત:
રંગભીના! હવે આવજો, મહારી સૂતી માઝમ રાત:

મહારા સાવજથરા..

(૭)

રાજવીર



રાજ્યના સિંહાસન સમું
ઉંચું એક શિખર હતું.
એ સિંહાસને છન્દ શો તે ઓપતો.
પૃથ્વીને પાટલે દેવપતિનું જેવો
દ્વારા પ્રમાણ તે દીસતો.

શિખરે વનના વાધા સંજ્યા હતા,
ને રૂક્ષ-ધે મ્રાદુલ્લ સાગ ઝોડતો.
સાગમંજરીના ચુભર નીચે
માનવ સુગટ શો મનમોહન,
શિખર સમોવડ અડગ ને અડોલ,
અલમૂર્તિં તે વિરાજતો.

શિખરના છત સરિખડો
ટાચે શિવમન્દિરનો ધુભર ધેરતો.

સૂર્યંતેજમાં બાલ સૂર્યું શો।
 ધુર્મટે સુવખુંકલશ ઝાહળતોઃ
 અખુભૂલાં જવાદીરની એવી એને શિર
 કલગીની જ્યોત ઝગઝગતી.

તે એક રાજવીર હતો.
 લાંખી સમરોરને અઠીંગી
 આજનથાડુ તે ક્રતિંકેઠુ
 રાજ્યવિસ્તારને વિલોકતો ઉભો હતો.

દૂરતી કુંજેમાં ધેતુનાં ધણુ ચરતાં,
 ને ગોપવંદ વેષુ વાતા.
 શિખરનું મન્દિર ભરી
 આદ્ધારો વેદોચ્ચાર ગજવતા.
 નીચે નગરનગરના ચોકમાં
 રહેમના લોકપાવન ધ્વનિ પડતા,
 ને એમ વાતાવરણુ પવિત્ર થતો.
 વેદવર્ચસુના વૈલવવન્તો તે
 મુઢ્યની પ્રતિમા નેવો મ્રદાસતો.

તહેને મહિમાવાન દેહદેશો
 રાજ્યશ્રીની મલા પ્રગટતી.
 શેષની દુષ્ટુઓ સમોવડા
 વિષદંશી ને મધુદાનેશ્વરી

કરદંડ તહેના ગુલતા.
 પદ્મ સમું હૃદય પથરાતું.
 વિશાલ અને સનાયુખ્ય
 વજવાળેલ દેહદુર્ગ હતો.
 તહેના ઊરવવન્તાં નથનોમાં
 સ્થ્યં ને ચન્દ એક હતા.
 પ્રજાએ ધરાવેલા મુગટમાંથી
 તારકાવલિ સમું રતનમંડલ તગતગતું,
 ને મંધીથી મકાશની ધારાએ વર્ષતી.
 ગાંડીવ અને પિનાક જેવી
 નમણી ભર્મરો નમેલી હતી.
 ચહડાવેલાં શર સરિખડાં
 દણ્ણિંદાં કિરણો ઝાંકતાં.
 અભિનની શિખા જેવો અધર હતો,
 વિધાત્રીની પાઠી જેવું લલાટ હતું.
 પ્રગટતા પ્રભાતરંગી કપોલે
 તપની ઉઘતાં, દાનની ઉદારતા,
 સામન્તનું શરાતન, નાયકની રસિકતા,
 સરલતા, દક્ષતા ને સાદાધની
 જન્મપુરાણ રેખાએ લંબાતી.
 તડકાછાયાની પેઠે વદ્ધનમાં
 પ્રતાપ ને શીતળતા રમતાં.
 રામરામમાંથી સત્યનું તેજ ભબૂકતું.

કાળી કાચણુ જેવા ભ્યાનમાં
 વીરત્વભીની સમશોર વિરામતી.
 કંધ વારી રાખેલા જેવી,
 મહાસાગરની માઝાવતી
 તે માનવસાગરની મુદ્રા હતી.
 તેણું ખૂબ :નીકળતું
 તેણારે વીજળીએ ચમકી રહેતી :
 તેણી હાકલ વાગતી તેણારે
 અસુરલેાકની મ્રલયગળ્યના ગળ્યતી.
 આરસપાટ જેવો ઉજજવલ
 ધર્મનો જણે સ્થંભ હોય,
 વડભાયા જેવો શીતલ
 રક્ષાનો જણે મંડપ હોય :
 તેવો તે ધેરગમ્ભીર દીસતો;
 આબના આધાર જેવો
 ભવ્ય ને વિરાટાંશ લાસતો.
 પુષ્પશ્લેષ તેણું નામ હતું.
 સંઘામના વિન્યાધવજ સરિખડો,
 મહારાજયની મ્રગઠ કલા સમોવડો
 રાજરાજ્યી તે વિશ્વખોળ વિલસતો.
 જગતનું મારખ ધરનાર,
 અવિષ્યના • ધતિહાસ રચનાર,
 પ્રજના લાડકોડ પૂરનાર,

લાલન પાલન ને વાતસલ્યભર
પુષ્યશાળી પાવનકરી પિતામહને
નિરખી નિરખી પૃથ્વી નમન નમતી.

૫૬ આગળથી તેણા ગંગા કુટી :
આભાલવંદ સકળ રાજ્યલોક
બારે માસ તેણું પાણી પીતાં.

મેઘ જેવી ભૂમિ બીની હતો.
દેવી અન્નપૂર્ણાના અભૂત પાત્ર સમી
ભૂમિ ધનધાન્યથી ભરછક ઉભરાતી,
ને લોડા વિધવિધની લખુણી લખુતા.
પૃથ્વી પ્રસન્નવદ્ધની હતી,
ને તેણા સ્વિમત સરિખડી
દિશાદિશમાં હરિયાલી હસતી.

અરણુની નાળના ધાસમાં
દીપડો લખાતો હતો.:
કાંડે વાધ ધવાધ પડ્યો હતો.

પાછળ સુધ્ય મ્રગઠતો,
કોટી કોટી કિરણુમાળે વધાવતો.
મળહિતના અલિલાષ શી છાયા
આગળ દેશ વીધી પડતી.
ધર્મ, સમજાવ, સહકર્મદીલતાના

તાણાવાણા વણી વણી
નાગરિકો તે છાયામાં નગર ગૂંથતા.

આકાશમાંથી વાદળ ઉત્તરે
ને જગત ભરી પડછાયો પડે,
તહો ય ઉત્તર શિખર તેજસ્વી રહે :
એવો જગત્થાયાથી પર મહેનસ
તે રાજસીર વિરાજતો હતો.

(૮)

શ્રીમન્ત મહારાજ સયાજુરાવ ગાયકવાડઃ

તેજછાયાનું એક ચિત્ર



શ્રી યા વિનાનું તેજ કોઈએ દીકું છે? જગતનો મધ્યાહ્ન તપતો હોય છે ત્થારે ચે જગતમાં પડછાયાઓ પડેલા નથી હોતા? સૂર્યમાં સૂર્યખાબાં છે, અને પૃથ્વીનો ગોલાધ્ય નિરન્તર અન્ધકારમાંજ હોય છે. વિશ્વમાં દિવસ અને રાત્રિ ઉભય છે. પરાજ્ય નજ દીકા હોય ત્હેવો અજીત વિજયનોબત જ સુણુનારો સેનાપતિ માનવ ધતિહાસે દીકો નથી. આવા કુદરતી નિયમને લીધે કોઈ પણ મનુષ્યની તુલના જમેદિધારના સરવૈયાથીજ થઈ શકે. ઉડી જતાં ધૂમમસથી છલાછલ બરેલી રહવારની વનમાલામાંથી તેજછાયાના મનોહર વાધા સળને ઉપર તરી આવતા કોઈ શિખર સમોવડ મહારાજ સયાજુરાવ ગુજરાતનાં વન ઉપર આજે તરી આવે છે.

મારખ અને પુરુષાર્થ ઉભયના મકાશ અને પડછાયા એ માનવશિખર ઉપર પડી પોતપોતાનાં વિધવિધ રંગોની રંધોળાની જીવનભાત પાડી ગયેલ છે. એલેક્ટ્રાન્ડર કિન્લોાક ફાબ્સ સમા થોડાક મહાન વિહેશી ગુજરાતીઓ. સમા શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડ એક મહાન ગુજરાતી છે. થોવનકાલમાં સુંખ નગરીના સિંહ સર હિરોઝશાહ મહેતા અને ગુજરાતભક્ત પ્રેમશૈખનો ડકો વગાડનાર કનિ નર્મદા નેવા કેટલાક ગુજરાતી વીર પુરુષોના નામોચ્ચારણુથી ગુજરાતીઓના કદ્યનાતરંગ હિન્ડાલે રહુડે છે તેવા થોડાક કદ્યનામકાશક ગુજરાતીઓમાંના એક મહારાજ સયાજીરાવ છે. માચીન યુગમાંથી નવયુગમાં થયેલી અને થતી ગુજરાતની યુગસન્કાન્તિના આદિનાયક કવિ દલપતરામથી માંડીને આજ સ્વર્ધીના એ સન્કાન્તિકાલના સર્વ ગુજરવિચારકો અને કાર્યધૂરધરોમાં વડોદરાના વર્તમાન નરેશનું સ્થાન પ્રથમ સિંહાસને છે. ગુજરાતના સર્વાંત્રેષ્ટ અને સર્વવિશાળ હેઠીરાન્યના છેલ્સાં પાંત્રીશ વર્ષથી કમાન ઝીલનાર ને સુગટ ધરનાર ગુજર મંડલી-કૃષ્ણરનું જીવનચરિત્ર મેરક, ઉલ્લાસક અને આનન્દાશ્રયનનક છે. ધ. સ. ૧૮૬૩ માં મરાહાઓના કવલાણુના ગામડામાં જન્મેલા ગોપાલ બાલકનું ગુજરાતને રમરણુભિય ખરેરાવ મહારાજનાં સદગત મહારાણી જમનાબાઈ સાહેબને ખોળે દ્વારા લેવાઈ ધ. સ. ૧૮૭૫ માં ગુજરાધીશ બનવું: ધ. સ. ૧૮૭૫ થી ૧૮૮૧ સૂધી છ વર્ષના સતત પરિશ્રમથી એ નિરક્ષર આભ્ય ગોપાલના આરસપહાણુને ખડી ખડી સયાજીરાવ

ગમ્યકવાડની સાક્ષરવન્દનીએ નગરશોભાસપદ રાજમુર્તી રવાવીઃ તે પછી પાંત્રીવા વર્ષથી ચાલતો એકચક બશરની ખુગસન્કાન્તિ સમે રાજકારલારઃ મહારાણી લક્ષ્મીભાઈ જાહેબ કાને ચોનેલા લક્ષ્મીવિલાસ મહેલમાં મહારાણી ચીમનાભાઈ સાહેબનો રાજવૈલવ : સિનિધ્યા મહારાજને દીધેલાં રાજકુમારીનો કુચબિહાર મહારાજ સાથે લમ્બપ્રસંગઃ સ્વર્ગસ્થ ધર્મપત્નીના સ્મરણુંથી તરીકે ઉછેરેલા યુવરાજનું નવરૈવનમાં યમરાજની 'પાંખમાં ઝડપાવું' : જાહેબલાલી અને કીર્તિની જાજવલ્યમાન કલગી રાજમુગટમાં વિરાળ ખડીક ફરકતી થઈ રહ્યાં તે યશકલગીનો તેજકલાપ અંભવાવોઃ શ્રીમન્ત સયાળુરાવ મહારાજના જીવનમાંનાં આવા મહાપ્રસંગોમાં પ્રારખ અને પુરુષાર્થની અટાપણી પરમેશ્વરી ભાત વિરાળ રહેલી છે. પ્રારખવાદીઓએ તેમજ પુરુષાર્થવાદીઓએ પોતપોતાનાં સત્ત અને સીમાઓ એ જીવનઅન્યમાંથી શોધી શીખવાનાં છે.

મુગલ શાહાનશાહતની સહાંઝ પડી રહ્યારે મહારાઝું કુલતિલક શિવાળ મહારાજનો તારો હિન્દની ક્ષિતિજ ઉપર ઉંઘેા, પણ એ સાંખ્યતારકનો અકાશ દીર્ઘકાલ તરેણે નહીં. નિવીયાં ક્ષત્રિયોની રાજ્ય-લગામ ને રાજસિંહાસન આલણુમન્ત્રીઓએ લઈ લીધાં, અને એ પેશવાને જ પગલે માલી કાલાવધ્યે તહેમના જ ચાર સેનાપતિઓએ સ્વતંત્ર જેવા થઈ મહારાઝ બહાર પાઠનગરો કીધાં. નાહિરશાહું પરાની મુગલાઈની છેલ્લી જાહેબલાલી દુંટીને લઈ ગયો

તે પહેલાં ગુજરાત ગ્રાન્ટ પિલાળરાવ માયકવાડે સર કર્મો હતો. ધ. સ. ૧૭૦૭ પછી અને ૧૮૫૭ સૂધીના ચક્રવર્તી એકત્રનાં વિલોલાણા દ્વારા શતકમાં હિન્દુસ્તાનના ચોખૂટમાં ગ્રાન્ટવાસીઓના સમૂદ્રાયો, ભટકતા નેસ જેવા, પરમાન્તોમાં જતા, જીતતા, અને વસતા, એમ ગુજરાતમાં ચે એ કાલમાં દક્ષિણીઓનાં થાણું, સદરહેશમુખી ને ચોથ ઉદ્ધરાવવાને કારણે, હામ હામ સ્થપાયાં. એ સેનાઓ દાવાનળ જેવી ગુજરાતની કુંનેમાં ધૂમતી, ને લીલાં વનવેલ ને પાડને આળા ભરમ કરતી. ધ. સ. ૧૮૦૮ માં કંપની સરકાર સાથે જાયકવાડ મહારાજને તહીનામાં ચચાં, ને એ અસિમદક્ષિણાઓ અસ્ત થઈ. મહારાજ ખંડેરાવને તો હજ ચે ગુજરાત ભાવથી સંભારે છે. ધ. સ. ૧૮૭૦ માં મહારાજ ખંડેરાવ દેવ થતાં ત્લેમના બાધ મહારાજ મહારારાવ વડોદરાની ગાદીએ આવ્યા, ને ત્લેમની ખાંચ વર્ષની કર્મકથની તો તાજ હોધ સર્વવિદ્ધિ છે. તે પછી મહારાજ સથાળરાવ ગુજરાત સિંહાસને પખાર્યા, અને સદ્ગુરુને સદ્ગવિધાનાં જલ સીંચી પૂર્વજોએ પાથરેલી ભરમને ચે નવચેતનથી હરિયાલી કોધી છે, ને સૂકાતી જરી ગૂર્જરકુંને નવપલ્લવે પાંગરાવી છે.

કસાખી આંગલી ને તરખૂણિયા મંજિલધારી નીરક્ષર જોપાલ છ વર્ષના અરસામાં અનુભવી ને નિપુણ રાજ સર તંનેર માધવરાવથી ચે મહાતેજસ્વી મહારાજ સથાળરાવ થઈ નીષડ્યા એ છ વર્ષના શિક્ષણ શિક્ષક ને સમસ્ત

ઉછેરનો વિચાર કરતાં આશર્વાનનું નથી થતો? વર્તમાન હકીકાત નહીં પણ ધતિહાસમાંની એ કથા હોય એમ ડાઇ વણું તો તે અદ્ભૂત ન લાગે? ધ. સ. ૧૮૫૦ ની આસપાસમાં ગુજરાતીપ્રિય ફાર્મસ સાહેબે સાદરામાં તાલુકારી સ્કુલ કાઢી અને એ અરસામાં કવિ દલપતરામે રાજવિદ્યાભ્યાસનું કાંચ લખ્યું, અને એમ એ મિત્રદૂદી રાજકુમારોના શિક્ષણનો પાયો રોધ્યો, ત્હારથી આજ સૂધીમાં એ આંબે અનેક સદ્ગુરી આવ્યાં છે, પણ તેમાં એ મહારાજ સયાળરાવ અદ્વિતીય છે. મહારાજનાં શિક્ષણું મનમાં ધતિહાસ અને અર્થશાસ્ત્ર મુખ્ય હતાં, તથા મિં ધલિયટ જેવા સુદ્રદ લગામધારી શિક્ષાગુરુ હતા. પ્રભ્યાત ધતિહાસનવેશ ગિબનકૃત રોમના મહારાજયનો અસ્ત અને વિનાશ-The Decline and Fall of the Roman Empire by Gibbon એ મહાશ્રય એ કાલમાં મહારાજનું ત્રિય પુરતક હતું. એ શિક્ષણું મને પરિણામે ઝુદ્ધિવિકાસ કેટલી અવધે પહેંચી શકે તે આપણે અનુભવીએ છીએ: સૂક્ષ્મમદર્શાંક ને દૂરદર્શાંક જીણુવટ ને સર્વત્રાંહીત્વ કેટલું ઓલે હેતું દ્રષ્ટાન્ત પ્રત્યક્ષ જ છે.

ગાદીનશીન થયા પછી દેશદેશાન્તરના વિધવિધના લોકસમાજ અને લોકસંસ્થાઓ નિરખવા ને પારખવા કાને મહારાજે વારંવાર સસુદ્રોલંઘન કર્યું છે, અને પ્રથમ સસુદ્રોલંઘન પછી દેખશુદ્ધિને અથેં માયશ્રિતે લીધું હતું. પૃથ્વીપરક્રમાની મહાયાત્રા યે મહારાજે અને મહારાણીઓ

કરેલી છે, અને એમ બુદ્ધિઓરના એકદેશીય શિક્ષણુકમનું
અધૂરાપણું કાંઈક પૂરાયું છે.

પણ ઇંગ્રેજ રાજક્રિયાનિસન કહે છે તેમ Let
knowledge grow from more to more, But
more of reverence in us dwell : બુદ્ધિવિકાસની
પાંખને સમતોલનમાં રાખનારી પૂજન્યભાવનાની પાંખ
ધર્મશાસ્કાધ્યયન વિના મહારાજમાં પ્રગટી નહીં, ને એ
અધૂરાપણું અધૂરંજ રહ્યું. મહારાજ સ્વાજીરાવ પોતાને
પૂજન્ય માને છે, પોતે ડાઈહેવ કે મહાત્માના પૂજારી હોય
તો લોકસમુદ્દાયને હજ જાણું નથી: પોતાના બક્તાને વાંછે
છે પણ પોતે ડાઈ પ્રિયજીન કે ગુરુજીનના બક્ત હોય તો
કુનિયાને હજુ તે હકીકત અજાણી છે.

મહારાજની તરણ્યાવરસ્થામાં એ બનાવ બન્યા, અને
મહારાજના પ્રત્યેક કાનમાં અફ્કેક જીવનમન્ત્ર તે સંભળાવી
ગયા છે.

પહેલો મસંગ પોતાની જ જીવનકથામાં હતો, ને તે
ઉપર સૂચવેલો છે. એસરાએ જણે ડાઈને જડપી જય ને
ક્ષુદ્રમાનવથાલને દેવશાણુગારે શાણુગારી દેવસિંહાસને સ્થાપે
એવો ચયતકાર ગાયકવાડ મહારાજની જાંદગીમાં બન્યો.
બારમે વખે કવલાણુના ખેતરમાંથી વિધિએ તેમને જડપી
લઈ ગુજરાતમહારાજનો જિલ્લાચાત પહેરાવી ગુજરાતસિંહાસને
સ્થાપ્યા, એ દાક કિયા અને એ તપ્તનશીન કિયાએનો
પ્રસંગોએ. સ્વાજીરાવ ગાયકવાડમાં જીવનના પાયાડ્ય એક

સુદ્દે માનીનતા અગટાવી કે 'હુ' મહારાજ.' વડોદરાના મહેલમાં યાં પીતાં કે રાજકુદમાર ભરતાં, સહવારે ફરવા જતાં કે બપોરે રાજકાર્યના હુકમો આપતાં, વડોદરામાં કે વડોદરા રાજ્યમાં, હિંદુસ્થાનમાં કે પૃથ્વીની પરિક્રમણી કરતાં; રાજકુદુંથ વચ્ચે વિરાજતાં કે ગ્રની મહાસલાયોના ગ્રનુખ્સથાનમાં: મહારાજનો એ રાજભિલઘત ઉતારાતો નથી, ને 'હુ' મહારાજ'ની માનીનતા વિસારાતી નથી. 'હુ' બીજાથી નિરાળો છું, 'હુ' અદ્વિતીય છું' એ બાવનામાં વીર પુરુષોનાં પરાહુમની પ્રેરણું રહેલી છે, તેમ જ એમાંથી અન્ય સક્લમાં અનાદર અને અશ્રદ્ધા જન્મે છે. મહારાજ સયાજીરાવને એ બાવનાના લાલાલાલ ઉલ્લય મળ્યા છે.

મહારાજના બીજ કાનમાં જીવનમન્ત્ર સંલગ્નાવ્યો તે બીજે ગ્રસંગ હિંદુસ્થાનના ધતિહાસમાંનો હતો. મહારાજ તખ્તનશીન થયા તેવામાં સિમલામાં સર્વ વાધસરોયના ભૂષણુરૂપ ને જેની કસોટીએ હિન્દી ગ્રન સર્વ-ભૂત વર્તમાન ને ભાવિ-વાધસરોયોને ચૂઢાવી પારખરો તે ઉદ્ઘારચરિત મહારાય માકિન્સ ટ્રપનોં લોકહિતેષી અમલ હતો. સ્થાનિક સ્વરાજ્ય-Local Self-Government-નો કાયદો ધરી તે મહાનુભાવ બ્ધિદ્ય રાજનીતિવેતાએ બ્ધિદ્ય ધતિહાસમાંનું ને બ્ધિદ્ય ગ્રનજીવનમાંનું એક ખરમ રાજસૂધ હિન્દી ગ્રનને શીખન્યું કે રાજસંસ્થા એટલે અમલદાર વર્ગ નહી પણ ગ્રનના મતિનિધિએ. તે

જમયે ભારતવર્ષમાં ડામહામે ઉત્સવો થયા, ઉદારવાદ—Liberalism—ની હિન્દના રાજ્યઅમલમાં ઇતેહ થઈ, અને ભારતી પ્રગતિ ચિઠનને અને ચિઠનના વિશાળહક્કાએ રાજ્યધુરંધરોને આશીર્વાદ આપ્યા. માર્કિંસ રિપને હિમાલયના શિખરથી ઉચ્ચારેલા પ્રગતિનિધિત્વના એ રાજ્ય-મન્ત્રની મહાધોરણા સારા હિન્દુસ્તાનમાં ગાળ ઉડી—અને હળુ યે ગાંજે છે—, અને મહારાજ સયાજીરાવના કણુંદારે એ પ્રગતાવનાનો ધ્વનિ પહેંચ્યા વિના રહ્યો નહીં જ હોય. ચિઠિશ સલતનતના પ્રમુખ મતિનિધિને એ મહા-મન્ત્ર ઉચ્ચારતા, તે ભારત સમુદ્ધાયને એ રાજ્યસૂત્ર હું-ગર્જનાથી વધાવતા મહારાજે સાંભળ્યા હોવા જ જોઈએ. તે પછીની આજ સુધીની વિધવિધની પોતાની પ્રજા-જિક્ષારની સકલ પ્રકૃતિઓનો એ નીતિમન્ત્રને માણું અને પેરણુંદ્રિપ મહારાજે કીધો છે.

મહારાજ સયાજીરાવ ગાયકવાડના જીવનનો નિકટથી અભ્યાસ કરનાર સન્ત નિહાલસિંહ મહારાજને વડોદરાના Autocrat-એકચક સત્તાધારી-અને Dictator-સર્વ-સત્તાધીશ કહે છે, અને સાથે એમ પણ વર્ણિતે છે કે ‘Preparing his people for autonomous government.’ પોતાની પ્રજાને પ્રગતિનિધિના રાજ્યતન્ત્રને કાને કેળવનાર મહારાજ છે. એ બને ભાવનાએ ઉપરના એ મહાપ્રસંગોએ મહારાજમાં જન્માવી હોય એમ જણ્ણાય છે, તે એમ મહારાજના જાહેર જીવનમાં

એ આદશે બન્ધાયા લાગે છે. એ એ પ્રસંગોમાં મહારાજના રાજજીવનની કુંચીઓ છે, અને મહારાણી લક્ષ્મીબાઈ સાહેભનું દેવ થતું ને મહારાણી ચીમનાખાઠ સાહેખ સાથે લખ થવાં એ પ્રસંગમાં મહારાજના કુંચીજીવનની ચાવી છે. એ ત્રણું પ્રસંગોમાંથી મહારાજના જીવન-મહાકથના લગભગ સકળ એારડાઓની ત્રિગુણ સમી ત્રણું ચાવીઓ જરૂર છે, અને એ ત્રણું પ્રસંગો મહારાજની પહેલી પરચીશીમાં જ બની ગયેલા છે.

મહારાજે શું શું કયું છે એ પ્રશ્નનો થોડામાં ઉત્તર આપવો સહેલો નથી, કારણુંકે મહારાજે થોડું કયું નથી. છતાં એક બાદબાકી આવડે તો કરોઃ હાલનાં વડોદરા અને વડોદરા રાજ્યમાંથી દ્ય૦ સ૦. ૧૮૮૧ નાં વડોદરા અને વડોદરા રાજ્ય બાદ કરો, અને જે જવાબ આવે તહેમાં ઉપરના પ્રશ્નનો ઉત્તર ત્હમને મળશે. લગભગ એકદે એક અને મૂળાક્ષરથી જ મહારાજને પ્રણાલીદારનું પરિયાણું કરવાનું હતું, અને તહેમાં શારદાપીઠના પદ્ધતીધર જેટલો પ્રગતિવિજ્ય મેળવ્યો છે. હવે તો પદ્ધતીધરની ને પ્રણાલીવનની હૃતેહની પરીક્ષાઓ બાકી છે. રાજનીતિના ભૂમિતિ-સિદ્ધાન્તો અનુસાર બારમા સ્કન્ધ પ્રમાણેના પ્રણાલીદારના મહાઅટપટાં રેખાચિત્રો મહારાજે દેશપટ લરી હોરેલાં છે, પણ ચિત્રકારનું જીવનચિત્ર, જણે પ્રણાલીની રોગરગમાં જીવન ધર્મકે છે અને સુખસુદ્રામાં ચેતન ઝખ્કે છે એવું જીવન્ત પ્રણચિત્ર, હજ એ રાજચિતારાથી ચીતરાયું નથી.

૪૦ સ૦ ૧૮૮૧ માં વડોદરા રાજ્યમાં ગ્રાથમિક શાળાઓ ને હાઇસકુલો કેટલી હતી, અને આજે કેટલી છે ? તે વખતે ભાણુલા નરનારના ટિકા ગ્રન્ઝમાં કેટલા હતા, ને આજે કેટલા છે ? મહારાજે ગ્રન્ઝકણવણીનાં ત્રણે સ્વહેલોની ખીલવણીથી ગ્રન્ઝિકારનો સુયોગ પાયો માંડ્યો, અને શારદાપીઠની અનેક વિદ્યાશાળાઓના અભ્યાસકુમ ગ્રન્ઝને સુલબ કર્યા. ભાણુલા પણી યે જગતનાં સર્વોત્તમ અતુ-ભવલંડારનાં પુસ્તકો ભાણુલાઓ વાંચતા નથી એ નેંઘ મહારાજે પુસ્તકલંડાર નગરેનગરે અને ગામેગામે સ્થાપ્યાં. ધ. સ. ૧૮૬૮ માં વડોદરામાં એક પુસ્તકશાળા સ્થાપવાની વિનંતિ મહારા પિતાએ મહારાજ સયાજુરાવના રાજપિતાને કરી હતી, ને એ એ વૃધ્ઘોના મેળાપની કથા દલપતકાબ્યના ગુજરીવાણીવિલાપમાં વણ્ણવેલી છે. ખંડેરાવ મહારાજે કવિ દલપતરામને એ પ્રસંગે વચન પણ આપ્યું હતું કે પુસ્તકશાળા સ્થાપિશું અને નિશાળ માંડીશું, પણ એ વચન સિદ્ધ થાય તે ખેલાં વરસેકમાં મહારાજ દેવ થયા. એ ગુજરાતી મહારાજે ૪૭ વર્ષો ઉપર મહારા પિતાને આપેલ રાજકોલ એ રાજપિતાના રાજપુત્રે આવી અણુકલ્પી સરસ રીતે પાળેલો નિહાળી મહારા પિતાના પુત્રને આશ્રમનાં વિના ખીણું શું થાય ?

સંસ્કૃત વિદ્યાનો ભિલાવે મહારાજ વિસર્યો ન હતા, ને આજે પણ વડોદરાની પરીક્ષામાં પાસ થયેલો શાસ્ત્રીવર્ગ ગુજરાતમાં કે ગુજરાત બહાર ચોડો નથી. પણ

સયાજુરાવ મહારાજના રાજ્યઅમલનો એ એક ઉત્તમ વિધામચારનો પ્રયત્ન તે તો કલાભવન. ગુજરાતીઓ સાહસિક વ્યાપારીઓ છે ને ગુજરાત વ્યાપારસુલક છે એ જેણે કવિ હલપતરામે હુભરખાનની ચઢાઈ લખી, ને અમદાવાદના પિતા-મહા તુલ્ય પરમ નાગરિક દીર્ઘદર્શી રણુછોડભાઈએ વણુવા-કાંતવાની મિલ કાઢી, ને પરિણામે મુંબાંધઅમદાવાદ હિન્દનાં લિવરપુલ માન્યેસ્ટર જેવાં થઈ રહ્યાં. ગુજરાતને પણ પ્રભાજુવનની એ દિશા જેણે, અને મહારાજ સન્મુખ હુભરકલાની વિકાસયોજના ધરીને મૂકી. એકાર મહારાજે એ યોજના મંજૂર કરી, વિશ્વકર્માની એ શાળામાં વિશ્વકર્માના પુત્ર પ્રેા. ગજરાને આચાર્ય નીઝ્યા, ને કલાભવન ઉધડ્યું. એ મિનિસ્પાલ સાથે સાક્ષરરત્ન મણુઃષાંકર વાધસ-મિનિસ્પાલ તરીકે જોડાતાં હુભરઉદ્ઘોષેમાં અને સત્તાર લુવાર રંગારી જેવા કારીગરોમાં એ સાક્ષરતા નાગી, શાનમંજૂર્યાની માલા રાઝ થઈ, રસરંગરહસ્ય નામનું સચિત્ર સુકલાવન્તુ માસિક નીકળવા માંડ્યું, હુભરવિદ્ધા-કલાની પરિભાષા ધડાવા માંડી, ને હિન્દી ગુજરાતી સંરકૃત ધર્મેજ એમ છ બાપાઓનો અનેકભાષાકોષ રચાયો. મિલોને વર્તમાન રંગાટ કામના રંગારા મળ્યા, સુતારોને વર્તમાન કલાશિક્ષિત કામ કરનારા મળ્યા, ને ગુજરાતના કારીગરોમાં થયું કે કારીગિરીનો ને દેશનાં હુભરકલાના પુનર્સ્ક્રારનો યુગ આવી પહેંચ્યો. છે. કલાભવનનાં પહેલાં દશ વર્ષની કથા મહારાજ સયાજુસવના રાજ્યધતિહાસમાંતું અને પ્રો. ગજરાનાં જીવનધતિહાસમાંતું સોનેરી પ્રકરણ છે.

હરિધન્દા જૂદી હસે. એ એ મહાપુરુષોની સહિયારી ચેઢીના એ ભાગીદારોએ જુવાડ કરી જૂદી જૂદી ચેઢીએ માંડી, પણ અન્નેને અણુપૂરાયેલી ખોટ ગાંઠ છે. પ્રો. ગજબર મોતી ને હીરા ધોવામાં, મહાન કલ્પનાએ કલ્પવામાં, અને જવેરીએના ડોર્ટકલહોમાં પડ્યા. મહારાજ સયાજુરાવ આજે પણ કલાભવન ચલાવે છે, રાનમંજૂપા અને રસરંગરહસ્ય બંધ થયા, અને કલાપકોષ વણુછપાયેલો સડે છે, ને ગુજરાતનાં ફુજરકલાકારીઓના ઉદ્ઘારનો પ્રશ્ન જેવો ને તહેવો અનુશર હજ ઉભો છે. મહારાજે એ-ક કદાવી, વાપારનું ખાતું કાઢી મન્ત્રી નીમ્યા, ઉદ્ઘોગોના જિલ્લાવનું કમિશન નીમ્યું, ને તહેને લાભોની રકમ સોંપી : પણ ફરી એ રંગ જામ્યો નહીં : પ્રો. ગજબર જેવા સેનાપતિ વિના મહારાજ સયાજુરાવ ગાયકવાડ ફુજરાખાનની ચઢાઈ જીતી શક્યા નહીં.

મહારાજ સયાજુરાવના બાંધકામ ખાતાએ મહેલ હુવેલીએ. વિદ્યામન્દિરો ન્યાયમન્દિર બાગખગીયાથી વડોદરા એવું શાખુગાર્યું છે કે પશ્ચિમ હિં-દમાં તો મહારાજ ગાયકવાડનું પાટનગર એક અલાયેલી મુંબદ્ધ નગરીથી જ બીજે નંબરે છે. અમરેલી નવસારી પાટણું મહેસાણું પેટલાદ સિદ્ધપુર, એ માનતપુરોમાં પણ પાટનગરની ફેટલીક પ્રણ-પ્રબૃત્તિએ મસરેલી છે ને પ્રસરતી જાય છે. વેરાયલાં ગામોને રેખેની જળાથી ગૂંથવામાં આવે છે, ને એમ વાપારના નવા ધોરી માર્ગ મંડાય છે. બાલલમ્બમતિંધક અને

કન્યાવિકિયનિષેધના કાયદા, પુરોહિતનો ખરડો, સર્વ જલિયોમાં પરસપર લમની છૂટ, એ અને એવા સંસાર-સુધારાને પ્રસરાવનારા કાયદાઓ ઘરી પ્રણાને અનિષ્ટ રૂઢી-બન્ધનોમાંથી મહારાજે કાંઈક સુકૃત કરેલ છે. ન્યાયખાતું, પોલિસખાતું અને રાજ્યનાં અન્ય આતાંયોની નિયમખંડ ને પક્ષતિપુરસ્કર ભીલવણી મહારાજના અમલ દરમિયાન જ થયેલી છે. એ સૌંદર્યતાની વર્તમાનતા મહારાજ સયાજરાવના રાજસિંહાસને પધાર્યા પછીની જ છે.

મહારાજનો આ મત્યેક મહામયાસ છે, પણ સયાજરાવ ગાયકવાડનો પ્રજાઉદ્ધારનો પરમ મયાસ આમાનો ક્રાંતિકાની, એ તો નિરાગાજ છે. એ મયાસ સાથે મહારાજના મંત્રીવર અને અમાત્યશ્રેષ્ઠ ભારતરત્ન રમેશચન્દ્ર દાતાનું કૃતિવન્ત નામ સદાનું જોડાયણું રહેશે. પ્રજાપતિ-નિધિત્વનો જે મહામન્ત ભારતપ્રિય નામવર માકિવિસ રીપનને મુખેથી સાંભળ્યો હતો, અને પોતાની પૃથ્વીયાત્રામાં દેશદેશાન્તરમાં જેનાં મૂર્તિમન્ત પુણ્યદર્શાન મહારાજે કીધાં હતાં, એ મન્ત્રપ્રેરણ્યા પચ્ચીસ વર્ષો પોતાની પ્રજાના જીવનમાં રથાપવાનો સયાજરાવ ગાયકવાડે પ્રસંગ લીધે, ને રાજનીતિનિપુણ અમાત્યે મહારાજના એ સંદર્ભિયારને છીલી લાદ સિદ્ધ કીધે. બ્યિટનમાં જેમ પેરિશ ને કાઉન્ટી કાઉન્સિલો છે તેમ હિન્દમાં યે ગ્રામીન અને મધ્યકાલમાં ગામડાંમાં આભ્યરંચાયતો હતી. નગરોમાં લોડ મેયરો સમાનગરશેડો હતા. લોકલ બોડ અને મ્યુનિસિપાલિટિની નવી

સંસ્થાઓ સ્થપાતાં એ જૂની લોકસંસ્થાઓનો લોપ થયો. ચતુર ગાયકવાડે અને નિપુણ મન્ત્રીવરે જેથું કે એ જૂની લોકસંસ્થાના સંજીવનમાં પ્રજાનું સંજીવન છે, એ માચીન મણ્ણાલિકાનો અર્વાચીન નવઅવતાર જન્માવવામાં પ્રજા-પ્રતિનિધિત્વના રાન્યમન્ત્રની પરમ સિદ્ધિ છે. એ પ્રજા-કલ્યાણની શુલ્ષ માનીનતા બલવત્તર થતાં વડોદરા રાન્યમે આમેગામ આભ્યપંચાયત ને માન્ત્રેમાન્ત માન્તપંચાયત સ્થપાઠ. પ્રજાપ્રતિનિધિઓની રાજસલા યે વડોદરા રાન્યમાં અણતી હતી. એમ પ્રજાપ્રતિનિધિત્વનું રાજસ્થાન વડોદરા રાન્યમાં પચાર ખાંખું. એ પ્રજાપ્રતિનિધિઓની નાનીઝેઠી સલાઓને કેટલીક સત્તાઓ સોંપવામાં આવી છે. પણ પ્રજાપ્રતિનિધિત્વનું અંજન મહારાજની એક આંખમાં અંનાયેલું છે, એટલે યોડાં ધણાં પ્રજાપ્રતિનિધિત્વનાં કિરણ પ્રગટ્યાં પછી હજ યે સર્વસત્તામૂળ ને સર્વસત્તાધીશ તો વડોદરા રાન્યમાં શીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડ જ છે. પણ મહારાજને હજ લોલ છે કે પદ્ધિમની સુધરેલી મહાપ્રજાઓ જેવી કાંઈક પોતાની પ્રજાને બનાવવી. એ લોકભદ્ર લોભમાં પ્રજાકલ્યાણની પ્રજાને આશા છે કે પ્રજાપ્રતિનિધિત્વનો મહામંત્ર હજ વધારે રાજકારલારમાં સત્કારશે. મહારાજે અને રમેશચન્દ્ર દસો પ્રજાપ્રતિનિધિત્વના વાચેલાં બીજને જલ સીંચવાં ને: ઉછેરવાં એ વડોદરાના વર્ત્માન તેમ જ લાવિ અમલદાર વર્ગ તેમ જ મન્ત્રીમંડલનો પ્રજાકલ્યાણનો પરમ કર્ત્વધર્મ છે, ને તે તેઓ પાણશે એવી મહારાજ અને ગુજરાત પ્રજા આશા રાખે છે.

મહારાજ સયાળરાવના પાંત્રીશ વર્ષના અખંડ પરિશ્રમને ધણું ફળકૂલ આવ્યાં છે, જ્તાં એ ખરં છે કે વડોદરાની વાડીઓમાંની ડેટલીક હજી કોળી નથી. ‘ભાગ્યું—ભાગ્યું’ તેઓ એ લર્દ્યે એવું વડોદરા રહ્યું છે. અને અમદાવાદ કે મુંબદ્ધ જેવું થયું નથી. વડોદરાના સુન્દર રાજમહેલો, વડોદરાનાં વિશાળ ડાલેજ, કોડી, ન્યાયમન્દિર, પુસ્તકશાળા, સંગ્રહસ્થાન એ સર્વો રાજમનિદરો, સ્થૂલ ને સ્ફુર્મ ઉલ્લભ રીતે, મહારાજે ધરાવેલા પાઠનગરના ઉપરોગી શાખાગાર છે. પણ વડોદરાનાં મનમનિદરો કષ્ટાં? મુંબદ્ધમાં રાજમનિદરની પડોશમાં જ ચારદામનિદર છે, અને સેકેરેરિયેટ, હાઇકોટ્સ ને તારઓફિસની માલા સમેવડો જ એટીઅન્દર ને મનમનિદરના મહેલાંના ચોક છે. અમદાવાદના પ્રાચીન કિલ્લાના વિશાળ ચોકમાં જ કારંજ, ગુજરાત વર્નાકૃયુલર સોસાયટી ને નાગરિકોની પુસ્તકશાળા છે. મન્જૂર વર્ગના હૃદયમાંથી ઉડતા હોય તહેવા મિલચીમનીએના ધમાડા મુંબદ્ધ અમદાવાદમાં જણે પરમેશ્વર પાસે ફરિયાહે જતા આકાશમાં હામ હામ ઉડતા હેખાય છે. મોટર, ધોડાગાડી, ત્રામની ધમાલ, જણે હેડતા જતા હોય તેવી લોકોની ગિરદી, છલકાતી ભરેલી ફુકાનો, ઉદ્ઘાગી ને ખંતીલા ફુકાનદારો, સંધ્યાએ સંધ્યાએ નગરનો મેળા હોય તહેવી ધોરી માર્ગની ભીડ; લોકસમુદ્દાયની જાગૃતિ અને પ્રવૃત્તિનાં એવાં ચિન્હેં વડોદરામાં આવ્યાં નથી. અમલદાર વર્ગ પાસે સત્તા જૂજ છે, એટલે સત્તાનો આડંબર વિશેષ રાખવો પડે છે. મહારાજને કરવાના અલિલાષો છે, કરવાવાના નથી. દેશા

રાજયોમાં પ્રજનાયડોને કાંજે રાજમવૃત્તિથી નિરાળું અસ્તિત્વ કે સ્થાન હજુ રચાયું બાકી છે. આ સંભેગોમાં મહારાજના આદર્શને આકંક્ષા છતાં સાધનના અભાવે પ્રજાવિકાસનું લક્ષ્ય હજુ વડોદરામાં સધાયું નથી. ગાયકવાડના વેરાયેલા માન્તો સમી ગાયકવાડની પ્રજા યે હજુ વિભૂતિ ને વેરાયલી જ છે. મહારાજના વિશ્વાસુ દાક્તર ખડુકરામના પુત્રરત્ન ડૉ. સુમન્ત મહેતા અને તેમનાં સદ્ભાવનાવન્તાં ધર્મપત્ની અ. સૌ. શારદાજારીને પોતાની પ્રજાસેવાની અભિલાષાઓ પરિતર્પ્રવા સૂરત ને અમદાવાદને આશ્રયે જવું થયું. ગમે તો ધરતીમાં કસ નથી, ગમે તો પૂરતાં ખાતરપણી નથી, ગમે તો એટલો ચતુર ને કાર્યદક્ષ બાગવાન નથી: ગમે તો કારણ હો પણ અમિહોત્રના અખંડ અમિ સમી મહારાજના અન્તરની અભિલાષાજવાલા નિત્યપ્રઞ્ચવલિત છતાં પ્રજાજીવનમાં હજુ વસન્તની ઉષમા આવી નથી.

મહારાજનું વિશાળ વાંચન, વિપુલ બુદ્ધિભંડાર, પૃથ્વીયાત્રાનો સદ્ભેધસંગ્રહ અને વડોદરાના સિંહાસન ઉપરના દીર્ઘકાલના અનુભવમાંથી રાજ્યને તથા પ્રજાને અનેક લાલ તેમ અનેક અનિષ્ટો પરિણામેલ છે. મહારાજના રાનડહાપણુના ભંડાર એટલા વિસ્તારી છે કે એ સાગરને અન્ય જનોનાં સરોવરોમાં અંક્ષા રહી નથી. આજવાના સરોવરમાંથી વડા નળમાં પાણી પડે તે સહુ નહાનીમોટી નળનલિકાએઓ દૂર નજીકનાં ગૃહદેશમાં લઈ જવું એટલો જ અમલદાર ધર્મ ગણ્યાયો જણ્યાય છે. એથી જ કરીને

ગુજરાત્ભૂષણ મણિબાઈ જશાદ્ધ ને હિન્દભૂષણ રમેશચન્દ્ર દસ એ એ જ મહારાજ સયાજીરાવના દીર્ઘ અમલ હરમિયાન વડોદરાની દિવાનગિરિએ દિવાન થયા છે. અમલદાર વર્ગમાં ચે અન્ય મહાચાશયને અભાવે દક્ષિણી ને ગુજરાતી, ત્થેમાં ચે ખાલ્સણું ને મરાઠા ને નાગર, એવા ક્ષેત્ર જેવું થયું છે. વડોદરાનો જીવાન અમલદાર વર્ગ નિરખી આંખ ઠરે ને આશા જન્મે એવું છે. ઈંગ્લાંડ અમેરિકા સમા જુદ્ધિવૈલની દૂર દેશાવરમાં જઈ જુદ્ધિવૈલન ને પ્રણક્ત્યાણુંની કર્તવ્યભાવના બ્લોરી આવેલા ગાયકવાડ મહારાજના એ મહલર મલપતા આશાબિલાપકર્તવ્યપ્રેરણાવન્તા નવચેતન વછેરા શરતના વચ્ચેરના પહેલા જ દુરલોંગમાં ડેમ થાકી લથડે છે? એમનાં તંગ ને લગામ અતિ ઢીલાં છે કે અતિ સખ્ત? અસ્વારની ચાખુકનો ભય એમને વિશેષ છે કે પ્રેરણું? પ્રણજિદ્ધારના કર્તવ્યએલ ખેલવાને બદલે આજે તો એ યોવનમંડલ અમલદારોની ઝલખમાં ખેલ ખેલે છે, ને એ હારળતને જીવનની હારળત માનવા જેવું કરે છે. મહારાજને દ્વારસી કહેવત માહિત હશે જ કે તેજુને ટકારો બસ છે.

સયાજીરાવ ગાયકવાડની ભૂલો યે ગંભીર થઈ છે, ને એ ભૂલો માટે મહારાજને ખમલું યે ગંભીરપણે પડેલું છે. ન મળે મિત્ર કે ન મળે અન્ત્રી, ન મળે અદ્ધા કે ન મળે સ્નેહ: નિરન્તર રાજ્યહિતનું ચિન્તન કરવાની ટેવને લીધે બારે માસ ને અત્રિસે ધડી રાજ્યભિલાચત પહેરી રાખવાની મહારાજને ટેવ પડી ગઈ જણ્ણાય છે. રાજકુદુંબમંડલમાં

એ મહારાજભાવના ડુપર પતિ કે પિનાની ભાવના વિરલ ખસ્ગે જ વિજ્યવતી થતી હશે. યશ્શસ્વી ને સદ્ગારી મહારાણી વિકટોરિયાનો ઉત્તરાવસ્થામાં ખિટનના રાજ્યચક્રમાં દીધ્ય ને વિવિધ અનુભવને લીધે જેવો અપ્રતિમ બ્યક્ટિભભાવ પડતો હતો તેવું મહારાજનું આજ થયેલું છે. મહારાજ સયાજીરાવ નરેશ ન હોત ને મન્ત્રી હોત તહે પણ ઉપ વર્ષના જૂતા મન્ત્રીશર મન્ત્રીમંડલમાં નરેશ જેવા જ થઈ પડત. મહારાજ સયાજીરાવ દેવમન્દ્રમાંના દેવના વૈભવ ને જહોજલાલી માણે છે, પણ દેવમૂર્તિથી ઉલદું કોઈ પૂણરીનાથી એ વિશેષ પરિઅમ વેઠે છે. નિદ્રાલોપ-Insomnia-નો રોગ પણ એ ભાવનાની સંજ તરીકે મહારાજને મળ્યો ચૂક્યો છે. મહારાજ થવામાં માત્ર સુખ ને વૈભવ છે એવું તો અત્યાની ને બાલક માત્ર આજ માનતા હોવા જોઈએ.

મહારાજ સયાજીરાવની મુદ્રાના પૌરુષને લીધે કાઈ કહે કે મહારાજમાં રસિકતા કે રસિક કલાઓ ભણી આદર નથી તો તે વસ્તુસ્થિતિથી વિરુદ્ધ છે. વડોદરાના તાનસેન પ્રે. માલાયક્ષના આશ્રયદાતા મહારાજ સાહિત્યસંગીતકલા-વિહીન નથી જ. અનેક સુસુન્દર રાજમન્દ્રરોથી વડોદરાને શાણુગારનાર ગાયકવાડ શાણુગારની સૈન્ધ્યકલાના રસીલા સંજગ્ઞન નથી એમ નથી. નૃત્ય અને ગાયન ઉભયના શાખીન મહારાજના રાજકીયારમાં તાંનેરી તેમ જ અન્ય વિધિવન્તી નૃત્યનિપુણ કંચનીએ પોતપોતાની રસિક

કળાઓનું સુરમ્ય પ્રદર્શન દાખવે છે. નહાનામોટા બગીચા ને બાગ ને પાક્ષથી રાજ્યનગરને શોભાવનાર રાજ્યવીમાં સૌનાન્દર્યાલાવના ઓછી તો નથી જ. દરબારોની લલક, અસ્વારીઓના ઢાક્કમાઠ, શિષ્ટાચાર અને પ્રસંગપોશાકના નિયમપુછા ઘડનારને જીવનની સમગ્રમાણુતા ને સ્વરૂપતાનું ગાન સાર જ હોવું જોઈએ. સંબ્રહસ્થાનમાંના ને રાજ્ય-મહેલમાંના વિશાળ ચિત્રપ્રદર્શનમાં મહારાજનો ચિત્રકલા પ્રત્યેનો રસીલો સદ્ભાવ સ્પષ્ટતાથી પ્રકાશે છે. એવી ડેટલીક આખતોમાં એક પચ્ચિમ લંડનનિવાસી સુજનના જેવી સુજનતા ને સંરક્ષારિતા મહારાજમાં ખીલેકી છે. ખીજ, બિલિયડ, ધોડેસ્વારી, શિકાર, દાથીઓની સાહમારી એ મહારાજની પ્રિય રમતો છે. ખીજ ઉત્સવો સાથે વસન્તોત્સવ મહારાજને મનગમતો ઉત્સવ છે. મહારાણું સાહેખના મહિલાદરબારોમાં યે વૈલાવ કે રસ્દર્શન ઓછાં નથી હોતાં. 'જે જે શ્રીમત ને ઉજ્જીવને તે તે મહારી વિભૂતિવન્ત છે' એમ વિભૂતિયોગમાં શ્રી કૃષ્ણાયન્દે ભાખ્યું છે. એવું શ્રીમત ને ઉજ્જીવન શ્રીમન્ત મહારાજ સયાળરાવ ગાયકવાડના રાજ્યવનમાં શ્રેડું નથી. અનેક રાજ્યગુણોથી શોભતા એ રાજ્યવીમાં એક રાજ્યગુણુંનું અધુરાપણું ખાસ તરી આવે છે. મહારાજના ખાનગી ખાતાનું રાજ્યખર્ચ પ્રમાણુમાં વિશેષ હોવા છતાં બદ્ધીસોનો રાજ્યખર્ચ કે દાનની ઉદારતા વડોદરાના મહારાજને શોભે એટલાં નથી. પણ એ વિષયમાં મહારાજની ભૂલ-હું ભૂલતો ન હોઉં તો-મહોટે ભાગે વર્તમાન નવશિક્ષિત સન્જ્ઞનવર્ગની યે ભૂલ જ છે.

મહારાજ સયાજુરાવ જેમ મહારાજા છે ને વડોદરાની પ્રજના પિતા—આપું નથી, તેમ મહારાણી સાહેબ પણ વડોદરાનાં મહારાણી છે ને વડોદરાના પ્રજનાં માતુશ્રી નથી. પ્રજનાં નરનાર પોતાનાં વ્યક્તિગત સુઅધુઃખો રહવા તૈછાં જતાં હોય કે તૈછાંથી સુઅધુઃખના દિવાસા કે દિવારામ મેળવી આવતાં હોય તો જાણુંમાં નથી. છતાં યે મહારાજ સમાં મહારાણીજી પણ વડોદરાની પ્રજ સન્મુખ રાજભાઈએ ઇપ ને નેતા સમાન છે. મહારાજના પ્રતાપ ને જનજવલ્ય મહારાણીજીમાં પણ ઓછાં નથી. વડોદરાના રાજભાઈએમાં મહારાજ તેમ સ્વીમંડલના રાજભાઈએમાં મહારાણીજી પ્રમુખ સિંહાસન રોભાવે છે. વડોદરાના સ્વીસમાજમાં જ એક પ્રકારની છટા ને ભલક છે, સૌન્દર્ય તો નહીં પણ અસૂક પ્રકારની રસિકતા ને એ રસના આખી યે દેહમૂર્તિમાં ઓઝસ ને દિનંગોલ હોય છે. વડોદરાના મહિલામંડલની એ બહાર મહારાણીજીમાં પણ, વસન્તની બદાર સમી, ખીલી નીકલેવી છે. લગ્નસમયનાં નિરક્ષર મહારાણીજી અન્યકર્ત્રી તર્કિ સરસ્વતીજીવાનમાં યે પધારેલાં છે, અને સ્વીશિક્ષણના સદ્ગુલબને પરિણામે સ્વીશિક્ષણના ઉત્સેજન કાને—Scholarsips-વિદ્યાર્થીવૃત્તિએ સ્થાપેલ છે. પડદાના રીતરિવાજમાં ઉછરેલાં મહારાણીજી વડોદરામાં ડોાં ડોાં વાર ને સુંબદ્ધમાં વારંવાર જનાનખાનાંનો પડહોઃખ્સેડે છે, અને પરમુલકમાં પડહો રાખતાં નથી. મહારાજના સમાં શિકારી, મહારાજના જેવાં લોકદ્વિતચિન્તક, મહારાજના સરિખડાં પૃથ્વીપરકભૂમાવાસી, મહારાજને પગલે પગલે

પ્રજાકલ્યાણુના રાજમાગાંના યથાશક્તિ યાત્રાણુ, મહારાણીજ ચીમનાખાઈ સાહેબમાં મહારાજના ગુણો ધણો છે.—ને આવાં ભાતપિતાની સંતાનમંજરી પણ મતાપી ને તેજસ્વી છે. રાજકુમારો અને રાજકુમારીમાં પોતપોતાના વક્તિ-ભાવનાના ઝૂવારા ઉડે છે. રાજકુમાર જ્યસિંહરાવ બોળા દ્વિલના છે; રાજકુમાર શિવાળ્યરાવ ઠરેલ ને ડહાપણુશીલ દેખાય છે; રાજકુમાર ધૈર્યશીલરાવમાં હજ નવયૈવનનાં સાહસ ને ઉત્સાહ છે: પણ તે ભાતુમંડલમાં એક સમાનતા એ છે કે મહારાજ ને મહારાણી સમાં તે સહુ જાજવલ્ય માન છે. કુચ-બિહારનાં મહારાણીજ—રાજકુમારી ઘનિદ્રા રાજનાં જાજવલ્ય કોઈ લાધથી કે માતાપિતાથી ઓછાં ઉત્તરે હેવાં નથી. જાજવલ્ય એ વડોદરાના મહારાજના સંરક્ષારી રાજકુદુંઘનો તરી આવતો રાજગુણ હોય એમ જણાય છે. પોતાને કિશોરાવરસ્થામાં મિ. ધલિયટ ને સર ટી. માધવરાવ જેવા ગુરુજન મળ્યા હતા એ પ્રસંગેઓધથી ચેતી મહારાજે કોઈ મતાપી ને પ્રભાવરાલી ગુરુજન બાલસંતાનોને આયો હોત, તો રાજસંતાનોની આત્મવાડીએ કરમાત નહીં, પણ હજ વધારે સુગન્ધવન્તી પ્રફુલ્લત.—ને એ જહોજલાલી ભરેલા રાજકુદુંઘમાં ચે મૃત્યુનો: ઓળો નિરન્તરનો પડેલો છે, ને વૈધવ્યનોં શોકરંગી પડછાયો પથરાયેલો છે. ગં. ૨૪. યુવરાણી પદ્માવતી સાહેબની કરમાયેલી વલ્લી મહારાજ સયાળુરાવના ભીલતા રાજઉધાનને લતામંડપે વસે છે, અને આલ મહારાજ કુમાર મતાપસિંહરાવ ગાયકવાડ તથા હેમની નહાનકડી રાજભગનીએનાં કુમળાં ઝૂલ હજ ઉછેરવાનાં

ચિત્રદશનો

આકો છે. મધ્યાહ્નઅસ્તશાળી યુવરાજ કૃતેહસિંહરાવના સમરણુઅંશ એ રાજભાલકના ઉછેર ઉપર મહારાજ સબાળરાવનાં આદર્યો અખૂરાં રહેલાં પૂરાં થવાનો અને ગુજરાતના અવિષ્યનો આધાર છે.

ગાયકવાડ મહારાજ એક મહાન હિન્દી છે, અને હિન્દમાં ધૂમાધૂમ કરતી સર્વ વિચારવાદીઓની રમણા ધ્યાનથી નિહાળે છે ને તહેમની જલવર્ષા યે અલે છે. ના. આગાખાન જેવા તો નહીં, પણ કંઈક દરજને સર્વ સુશિક્ષિત પ્રજાઓના પ્રજાજન જેવા છે, ગુજરાતમાં પ્રકાશતી વિચારશક્તિઓનાં જન-મ વિકાસ ને પ્રેરણનાં ઉત્ત્રતિ ફરનો અભ્યાસ સદા રાખે છે. છતાં મહારાજ ગાયકવાડ કે ગાયકવાડનું રાજકુદુંખ હજુ ગુજરાતી નથી. જાપાનમાં જાપાની પોશાકમાં શોભતી મહારાજની છબિ નિરખ્યી છે, પણ ગુજરાતમાં ગુજરાતી પોશાકધારી ગુજર્રનરેશની છબિ હોય તો નિરખ્યી નથી. મહારાણુઝ જમનાબાઈ સાહેબના દટાક પુત્રરતન હજુ ગુજર્ર દેશના યે દટાક પુત્ર જ છે. ગુજર્ર ભાષાની સર્વોત્તમ નવલકથા છપાયે લગભગ પા સદી વીતી ગઈ છે, પણ ત્રણ ચાર વર્ષ ઉપર સુધી તો મહારાજે તે વાંચી ન હતી. ગાયકવાડનું રાજકુદુંખ ગુજરાતમાં આવી વસ્યે લગભગ એ સૈકા થયા, પણ પારસીઓની પેઠે તહેમની કુદુંખભાષા ગુજરાતી થઈ નથી. મહારાજનું કે રાજકુદુંખનું ગુજર્ર સાહિલનું વાંચન વિશાળ નહીં હોય. એવો યે સમય હતો જર્ખારે મણિલાલ, બાલાશંકર, મણિશંકર, ગજર જેવા ગુજર્ર સાક્ષરો વડોદરાને શાલાવતા. હાલ વડોદરાને


વડે માત્ર લલિતજી વિરાજમાન છે. એ હકીકત તો મહારાજ સાહેબને અર્થાત નડીં હોય કે ગુજરાત પ્રભાને મન પ્રસુખપૂર્વ વડોદરા પ્રેમાનન્દનું અને પછી ગાયકવાડનું છે. રમેશચન્દ્ર દાટ જેવા ધર્તિહાસસંશોધક પ્રેમાનન્દને વિસારેલ છે, અને મહારાજે પણ પાંત્રીસ વર્ષમાં એ સાહિલ્યદેવતું દેવાલય રચાવેલ નથી. પ્રાચીન કાવ્યમાલા, પાઠથુના લંડારમાંથી દ્વાચ્ય સમાં પુરુષોનો ઉદ્ઘાર, જ્ઞાનમંજૂષાની માલાઃ સાહિત્યવિલાસી મળિલાઈ અને સાક્ષરરત્ન પ્રે. ગજરાજરનાં એ ભૂતકાલનાં સમરણો છે, ને વર્ત્માનની વહૃતી તે ગંગા નથી. હાલ ચાલે છે તે ગંગા નહીં, પણ ગંગાનો આભાસ છે. ગુજરાત નરનારના ચિત્તનો ચોર રસિદો ધ્યારામ અને ગુજરાત કવિયક્યુડામણું પ્રેમાનન્દ: ગુજરાત કાવ્યદેવીના એ દેવપુત્રોની જેવી અને જેટલી પૂજાવન્દના મહારાજ ગાયકવાડ ને તહેમનું સાહિત્ય-રસિક રાજકુદુંખ કરશે તહેના પ્રમાણુમાં ગુજરાત મળ તહેમને ગુજરાતી ગણુશે. વિશાળ વડોદરાના દેશરાજવી શ્રીમન્ત સયાજીરાવ છે, પણ વડોદરાના હૃદયરાજવી તો બદ્ધ પ્રેમાનન્દ જ છે.

વડોદરાથી ધ્રથાનમાં અદારેક ગાઉ ઉપર પાવાગઢ-પવનગઢનો ગિરિદુર્ગ છે. આકાશના વાદળિયા ચંદ્રવા નીચે ઉલેખા એ એકાકી ખડકને દિશદિશમાંથી આવીને પવનની ઉર્મિમાલા અથડાય છે: ગિરિશુંગ તહેમને સર્વને સતકારતું નિજસમાધિનિમળ તે ઉછળતી તરંગમાલાએ વચ્ચે અડગ

ને અડોલ વિરાને છે. જેવો એ પવનગઢ દૂરથી વડોદરા ઉપર નિહાળતો, એકાકી ને ભિત્રમંડળ વિહોણો, પોતાના ગરવા ચિન્તનધ્યાનમાં જાણે વિકીન, ઉલેલો છે, એવા મહારાજ સયાજુરાવ ચિન્તનવિલીન એકાકી ગરવા ગાયકવાડ, લક્ષ્મીવિલાસ મહાલયના મિનાર સરિખડા, દૂરથી એક દષ્ટ વડોદરાના—ને ગુજરાત માન્તના—ભવિષ્યને ઉગતું નિહાળો રહેલા લાગે છે. મહાર્પિં દાદાલાદ્ધ અને કર્મસંયાસ મોહનદાસ ગાંધી હિન્દને ખિટિશ સલતનતના રાજ્યમંડલમાં પ્રવેશ કરાવવાને જીવનભર પ્રયત્નરીલ હતા ને છે. મહારાજ સયાજુરાવે પણ, એ એ મહાન ગુજરાતીઓની પેઠે, હિન્દ ભણી જગત્તી મમતાલરી દષ્ટિ દોરવી છે. મહોદ્ય પવર્તોમાં મહોદ્ય ઝીણો, તેમ મહાન પુરુષોમાં પણ ધણી વેળા હોય છે. એ તેજાધાયાતું સરવૈધું કાઢતાં એમ જ કહેવું પડશે કે પિતામહ વૃદ્ધવીર દાદાલાદ્ધ અને નિત્યઘૈવનભર મોહનદાસ ગાંધી પછી ગુજરાધિપતિ શ્રીમન્ત મહારાજ સયાજુરાવ ગાયકવાડ સર્વાશ્રેષ્ઠ વર્તમાન ગુજરાતી છે. ખિટિશ સલતનતના મન્ત્રમંડલમાં કે જગતના ભાવિ ધતિહાસમાં મહારાજ સયાજુરાવથી એળજાતાં ગુજરાત શરમાણે નહીં.

(૬)

તાજ મહેલ



૧

આ એજ શું મંડપ નિત્યલગ્નનો ?
 કે અસમરાશિ પિયુ પ્રેમલગ્નનો ?
 આ તાજ શું એ સુમતાજનો ? સખે ?
 કે રનેહના પંખીની વાસયાણિ એ ?

૨

પ્રેમનાં રમરણો બોલે માનવીમાનવીજિરે;
 તે સ્નાનો પડધો શીલી સુણો ! શાહે જહાં જૂરે.

૩

શ્રી કૃષ્ણની બંસી શું નાચ નાચતી
 વૃન્દાવનેથી યમુના પધારતી;
 રસેન્દ્રના એ રસવારિને તટે
 સૈનદ્યનું પુષ્પ ભીલ્યું શું આ ? સખે !

૪

રસીલાં રસયમુનામાં વહનતાં કંઈ આવતાં;
એમને દાખતો પન્થ ઉલો છે એ સુહાગમાં.

૫

અન્ધારાં થાયે નલ માંહિ પાતળું,
ઝીણું ઝીણું પૂર પ્રલા તણું બજ્યું;
જગતુ તણી જીવનછોળ શું છલીઃ
ને! પ્રેમની ઉગી પ્રલાતતારલી.

૬

રાધિકાનાં ગીત ગાતી ઉલીને નહીને તટ
ભણે છે એહ પાષાણો પ્રેમમન્ત્રો સનાતન.

૭

અહો! મહાકાલની વાસુકીઝણ્ણા! .
હા! સર્વાલક્ષી યમ કેરી યન્ત્રણ્ણા!
તથાપિ મૃત્યુ રસનાં નથી-નથી:
સૈનધ્ય ને સ્નેહ અજીત મૃત્યુથી.

૮

સુધા ને વિષ ધોળેલા સખે! સંસારસાગરે
પ્રેમ ને મૃત્યુના ઝેલ-તાજ સૈને વસે ઉરે.

૯

મધ્યાહ્નની આળ ભરી જગતુ ઉલી,
દાડો-દાડી હુનિયાં સદા દૂબી;
શું પાદશાલી ય હિલે ચિતા? અરે!
જવાલાસુખી ને! સળગે સુધાકરે.

૧૦

ધૂળની આંધી જાની, કે મેઘાડંખર રહોયલો?
એવા આ અસ્તિથે વિશ્વે ઉગ્યો શું પ્રેમતારલો!

૧૧

અનેક વેળા ઉગી આથમે રવિ,
અનેક ઉમ્ભી યમુનાની યે જરી;
શીળો, મીઠો, અમૃતજ્યોત તાજ શો,
અખંડ સૈને ઉર પ્રેમદીવડો.

૧૨

શું છે, કહો, વિશ્વના ગૃહેલે? પ્રેમનો ચન્દ કે ચિતા?
એજ આ યમુનાતીરે પ્રેમીના પ્રેમની ગીતા.

૧૩

અહો! મહાલાવ ગયા અકષયર,
નથી રથા બાયર એ કલનદર;
નૂરે જહાં આથમિયાં દિગન્તમાં:
ઉલા છ આ કીરતથંલ પ્રેમના.

૧૪

પ્રેમની કવિતા કરો? કે એ જહોજલાલીનો?
સૈન્ધર્યનો? કલાનો? કે તાજ આ સુગલાધનો?

૧૫

અંગાંગમાં માર્દવ છે કુમારીનો,
સોહાગ પાનેતરની પ્રલા તણ્ણો;
શૃંગારલીલા મુમતાજ શું હસે!
કેવી ય વો નરજહાં, કહો, હશો?

१६

प्रेमनी भस्म धारी, ने हिंगन्ते मांडी आंधी,
प्रेमनी जोगणु के आ जूवे व्हालानी वाटडी।

१७

उंचा भिनारा सम उध्वं^१ हस्तथी
यन्द्राननी धुमरथीष्वं^२ टेकती,
दाणी छूटा पालव वाडीचोक शा,
रसीली के नाचती नित्यरास आ।

१८

‘वाणुमाण्या रसो वाधी प्रेमराशी अने, सभि !’
ऐ महासरयनी नंते ! आ प्रतीति प्रेमीचे लभी।

१९

काळे विछोडी चकवानी जोडी शा
अन्ते तटे ऐलड ग्हेल मांडी, तङ्हां
अद्वैत ए दैतनुं स्थापतुं हतुः
अद्वैतनाथे नहि दैत सांभियुः।

२०

पूर्णिमा केरी ज्येऽत्सनामां ज्येऽत्सनाना पुंज शी, सभे !
दंपती प्रेमनी नित्ये पूर्णिमा तपजे ज ते।

(૧૦)

ચાર વાટિકા



૧. રતનાકર રતનગૂલે,
 જીલી જલદલમાં, હિન્દ દેવી ઝુલાવે,
 વાળી સુદૂર ત્રિરત્ને
 જડી, કટિ ધરી શું, રહોય સૈચાણ એવો;
 લીલી નાધેર છે ત્રદાં
 સુલગ ઢાકતી સાડીની ડેર શી, ને
 એ કારે ખુદીના કો
 લીલમ સરિખું લીલું છે ચોરવાડ.
૨. ત્રદાં દઘિમાન્ત ધેરે
 વનવન ગીરનાં કેસરીથી ભરેલાં,
 આધે ગિરનાર એડો!
 કંચ યુગયુગના યોગા શો પૃથ્વીવદ્ધ;
 ત્રદાં તો અંગ્રેઝિ ઉછળે
 બીજણુ ગરજતો કાળનાં ધોર ગીતો,

ને માથે મેધ ડાલેઃ
અતિ ગગનમાં ઉડતો પાંખ ખોલી.

૩. દીવાદાંડી સરીખા

જગઉદ્ભિતટે દક્ષિણે સોમનાથ,
સહજનનહે પધારી
પમરતું કીધ તે ઉત્તરે લોજ લીલું;
ગોરબો ધાલી ઝેલ્યાં
ગીરવન ગરવાં પૂર્વમાં પાણીબરિયાં,
ઝેઝંજ ગાતો,
રતન ઉછળતો, પદ્ધિમે લક્ષ્મીતાત.

૪. દેવાને અસ્થિ આપી

દીધિચિ ઝડપિ ત્યઙ્ઠાં વિરાયા વિષણુવેલે,
પોષેલી સોમહેવે
વનની વિલુતિ ત્યઙ્ઠાં ધામ ધન્વનતરીનાં;
ચોરા ત્યઙ્ઠાં રૂક્મિણીની
હજુ હૃવદિશના પાઠે લગતધૂપઃ
દક્ષિણ વાયુ વહે છે
હજુ ય ગરજતા ધોર ત્યઙ્ઠાં યાદવીના.

૫. ઉંચાં જણે છુડીને

ગઠની ઉપરથી યાત્રી આમનતતા, ને
ઉજ્જીવન જણે જનોનાં
હદ્યધન તણી પુર્યજયોતે રસલાં,

માથે ધરી અંજલિ શી
 અમૃત ગગનનાં જીવની જરૂરાં અગાસી,
 એવાં નભને અટારી
 ઉદ્ઘિ નિરખતાં ધામ આતિથ્યશોભ્યાં.

૬. ઇપેરી ઝૂલ ધારી
 ઝૂલત કરિણી શી આઅની માળ રહોડે,
 ડાલની વખ ઉંચે
 કનકપગ ખૂલી નર્તકી જેવી ઢેણો,
 પોતૈયાં ચોળીફાતા
 સ્તન સમ, દગની કીકી શાં શ્યામ જાંખુઃ
 ટેણે જાણે માંન શું
 સહિયર રમતા, વાડીની એના કુંનો.

૭. અલાએ સ્થંભ રોષા
 અજ્ઞય લીલમના, ચારી થંબો સમા, તર્હાં
 લીલા કિનખાય કેરી
 હરિત લવિત કંધ સાડીએ રહેરી-ઓઢી,
 ડાલે છેડા સુનેરી,
 કુંપગ ફુરકી અંગ અંગે રસીલી,
 ઉત્કંઠી ઉન્મુખી તર્હાં
 મનહર મહુરી તની શી પાનવેલો.

૮. ધાધરના ધેર જેવા
 ઉજળી ઉછળતી પ્રીણુની જાલરો, ને

હે પાલવ પડેલી!
 કરચકી સરિખી ડાલતી હમ્મિમાલા,
 ઝુદી રહેલી શું લાંખી
 મણિમય અલડા કાલિકા વોર નાચે,
 માયાની મૂર્તિ શી, ત્હાં
 જલનટડી રમે વ્યોમની છાંખડીમા.

૬ મદધેલી મેગળે રહાં,
 અધીરી ધીરી પડી, રહેડી સ્વામીની રહેડે
 નહાલાની વાટ જોતી
 વિરહિણી સખી શી દ્હેરીએ દૂર ઉભી;
 અહાદુરો જરૂંથી જતા
 જલવન ધૂમવા, વ્યાઘ્ર થા, તેહ ઝુંડે
 આજે કુદુર્યમેળા.
 ભરી ભવવનના માર્ગ શાધે વિષુધે.

૧૦. લજનનમતી છટાથી

અપળ નજર ને વીજળી શી ઉડન્તી,
 ઉંચા અહંયે છખીલા
 મણિમય કરની દાખતી તેજવેલો,
 ભીને વાને, ભરેલે
 અવયવ, ઉજળી વાદળો શી રસાર્દ,
 સિન્હુની લક્ષ્મી જેવી
 દ્વિતીભર, વિલસે રહાંની અલખેલડીએ.

૧૧. ચારે ધામે પધારી,
 વિવિધ સુરલિંગો જાંઅહી, મુખ્ય આણી,
 વતને સતકમ્ભ વાણી,
 ધરધર ઉગતો ફાલ સતકમ્ભ કેરા,
 સંસારે સ્વર્ગ રચતો,
 અજાય ઉછ્પલો માનતની પ્રેરણા શો,
 નામે-ગુણે નિધિના
 અમૃત સરિખડો દૈવી પઠિયાર છે તેણાં.

૧૨. સૌંકારી ધન્દિયો સૈંસા,
 શરદનું સર શો, ગુણુગળીરો ખુશાલ,
 પન્થે ભૂત્યા પ્રવાસી
 સમ ભવ લમતો, સિંહ શો, પૂર્વ દેશી,
 વેદાન્તી, કર્મયોગી,
 કંધક અજનિકો, ભૂમિનો મુત્ર હેવા;
 એવા અહયંગ ઉદે
 જગજગલ ધૂમતા તેણાં, મહામચ્છ જેવા.

૧૩. વેર્ણ જણાં ધામહામે
 કનક નગરીનાં વૃદ્ધ અડેર ફરતાં,
 વૃદ્ધે વેલે ઝૂલે જણાં
 પ્રકૃતિ ઉરખર ડાંકિલા મોર ઝૂલે,
 જહોરે જણાં ધામ ધામે
 જનની સુજનતા, સુનદરીના મુહાગોઃ

ધતિહાસે ખીજ વાવ્યા,
કુદરત ઉછવ્યા, ઝાલ લેડે લખ્યા તે.

૧૪. પુષ્યો પુષ્યાળુનાં શી
પૃથિવિ ભરી ભરી ભીલતી જરૂરાં વનશી,
રસિંહાનાં ઉર નેવી,
સલિલ ઉલરતી, રસભરી જરૂરાં રસાળા,
રસની ને પુસ્યની જરૂરાં
ભૂમિ ગણ્યી ઉતરી આવી તે, ચાર વાડી !
ખાળે લેજે પ્રીતે આ
રસ અમરની મહેં ધૂમરોળી શી ગંગા.

૧૫. ઝીલીને ભાનુનાં અખ
આપે અન્દ થ અન્દિકા;
અન્દ કરૂં? અથ્ય હું કરૂં? ને
ભાનુ શા કાલિદાસ કરૂં?

(૧૧)

શ્રાવણી અમાસ



એક વેળા રાત્રિ પડતી હતી,
અને મહારાં નથનોમાં નિદ્રા ઘેરાતી.
અન્તે નથન ફરદું, ને પ્રવૃત્તિ પ્રજગત્વણીઃ
હું ઉઠ્યો, અને રાત્રિના તટ ઉપર ઉભો.

સધગે નીરવ શમશ્વમાકાર હતું;
પણ મહારે અન્તર અનામી એાધ કંઈક ગર્વતા.

હું ઉભો હતો:

રાત્રિનાં જલ જેતો—ન જેતો,
અચેત શા સચેત હું
જડતાને કાંઠે ચેતન જડવત્ત ઉભો હતો.

મધ્યરાત્રિ હુદ્ધના બેદ ખોલતી:
શ્વન્યમુખ ચિદાકાશ, મહાકાળની ગુદ્ધા સમું,
નિરવધિ, વિલુ, વિરાટ શું, વિસ્તરહું.
કાલરાત્રિના કિનારા ઉપર
સહોદર સંગે હું ઉભો હતો.
આકાશમાંથી તારા વાળી લીધા હતા,

મહારે એ મલુનેજનાં દર્શાન ન થતાં;
બહાર તેમ જ અનન્તમાં નિરસેજ હતું;
અનધકાર શ્વામળ જયધ્વજ ફરકાવતો.
ધનદળ તેણા ધરાટોપમાં નત્રતું.
પૃથ્વીના માણુમાં જડેના તેમની છાયાઓ શી
કાજળાકાળી ડોવની પર્વતાવલિ
દષ્ટિ વાંધી "ડી હતી.
કશું ય કાંધ મૂઝનું નહીં.
તમરાજની સંશયભૂમિકા જેવી
શેકરાત્રિની સીમ ઉપર હું ઉભો હતો.

શન્યતાના તરંગ જગત લરી તરવરતા,
મહો રસમોાં લીજવતા,
શન્યાત્મ કરતા.

આંખ ઉંઘાડી હતી, પણ દર્શાન નહોતાં થતાં:
કોકી દિશાલુંનોમાં દોડતી,
પણ મલુનો જ્યોતિ કુદાંધ જ નહોતો નિર્ભત્તા.

અનધકાર અલેટિક હતો:
યમેદંડના કિરણાલુથ સમાન,
વિષુધીના આત્મામાં વયે છે એવો,
ભૂત્યુની વિશાલ પાંખ સમો,
જોડા અમાતુષ બેદના પ્રકાશ શો,
પાર્વિષથી પર, પરમ અભેદ,

અન્ધકાર પણ અલોકિક હતો.
ખલાડ જીલતા એ તમસાગરને આરે
સહોદર સંગે હું ઉબો હતો.

સાગરના મહામોજ

નયન	આગળી	રમતા,
અમને	શાફર	જાંટતા,
પણ અમે	એ જાણુતા	નહીં.

વિમાન આવ્યું; સૌ બેઠાં;
અન્ધારાત્રિના હૃદયમાં અમે રહેવા માંડ્યું.

પછી? — પછી પગ લપશ્યો કે શું?
અન્ધુ! તું કેઢાં ગયો?
તમસાગર માનવ દિષ્ટને અગાધ છે:
રહેનું યે વળતલ હેડી પાર ગયો?
તેણાં તો પ્રભુમહેશ છે.

શાખ થયો? પડયો? પડયો?
આધે આધે તે કિલા શું ઓલી?
અનિલલહરીની શું પાંખ ફરજી?
ધીમી ધીમી ઝૂલડાં વાતો કરે છે?
કે વીર! તદારા બોલ શા,
પ્રભુભૂમિનાં ગીતનો મોડલો તે કલરવ?
મબો! એ કેદાનો મધુરો સિતકાર?

(૧૨)

અહંકારિકા



એ જ માર્ગ, બન્ધુ ! એ જ માર્ગ :
 નેત્રકમળ મીચી વિચરો : છો,
 પણ એ જ પ્રભુનો રાજમાર્ગ.

ગંભીર ડોલાહલ ભયું યે બળર
 અત્યારે શસ્ત્ર-સ્તબ્ધ-મૂર્ખિત જેવું છે,
 શ્રીપુરના નાગરિકો નિદ્રામાં છે:
 તહે પણ અખંડ નિદ્રા લીધી, બન્ધુ !
 સદ્ધનરની રહેડ વાળી સૂતા.
 પ્રવૃત્તિસંસારને વીધી જતો
 એ જ માર્ગ, બન્ધુ ! એ જ માર્ગ.

આગળ ઈસ્પિતાલ છે, ખરં ?
 કાળનાં અવિરત મહાપૂર વહે છે,
 માનવી હેઠે ખાળવા શે મથતા હશે ?
 વિધિના હાથ ટેલ્યા ટેલાથ એમ છે ?

પણ બન્ધુ ! માર્ગ તો એ જ.
 મન્દવાડ ન હોય તો, વીરજ !
 સ્નેહ અણુમૂલવ્યા રહે.
 એ તો અવ્ય પરમાર્થનાં લુવનો,
 બન્ધુસેવાયે રચેલાં માનવીનાં મનિદરો,
 સ્નેહીઓના સ્નેહની યુનિન્હસ્રિઃ
 સ્નેહનાં દુઃખ ધૈર્ય શક્તિમલાવ
 પ્રગટવાં, પ્રકુલ્લવાં,—અને રડવવાં,
 સઉ આ ભૂતદ્વાના ઉધાનોમાં થાય છે.
 સુખની નહીં, પણ સ્નેહની આ વેદી.
 તહમારા જીવનયરામાં પણ
 સ્નેહે અહીંજ સુખનો બલિ દીધે.
 સ્નેહીત તપતાં અનેક તપસી
 આ માસહોમાં પ્રવર્તે છે.
 આતુભાવનો આ બાગ છે, વીરા!
 —તહે તો તે જાળો છો જ.
 એ જ—એ જ શ્રેયસ્કર માર્ગ:
 બન્ધુતામાં થઈ પ્રભુતામાં.

નગરના દરવાજામાં થઈ—
 હા ! વિશ્વનગરીનો દરવાજે પણ
 તહે નિરન્તરનો એળાંગે.
 પણ ભાઈ ! એ જ માર્ગ:
 અવની મૂકી આત્મભૂમિમાં,

અહાં એણંગી અહમાં.

પિતા એ જ માર્ગ ગયા છે,

સંસાર તજ સર્વમાં.

પૂર્વકાશની પાછળ સૂર્ય હતો,

અને પશ્ચિમાકાશની પાછળ

વસન્ત પાલવ સંડારતી:

પૃથ્વી ઉતારી માણુષદેશમાં,

પરાગવતી સુમનસેજમાંથી

નિર્મણા સાન્ત્વિક સૈન્દ્ર્યમાં.

પિતા મુને માર્ગનો પરિચિત કરતા,

વંજુશયા આગા મુને ચલવતા.

જગત ન જોતી તહેમની આંખડલી

આ પન્થ નિરન્તર નિહાળતી.

પ્રપંચમાં આપણે એમને હોરતા,

પણ મલુપન્થે આપણા એ નિયન્તા હતા:

સદ્ગાવ પાડતાં એમનાં તો પગલાં

આ માર્ગ જ વળેલાં હતાં.

વીરા ! મહારં સમરણ સતેજ છે—

હજ તો ત્રણેક વર્ષ માંડ થયાં છે—

એ જ માર્ગ, એ જ સલ્ય માર્ગ,

તહે ડગલાં લરો છો એ જ મહામાર્ગ.

નગર છોડી વનઅંગણે,

વિશ્વ ત્યાગી વિશાળા વ્યોમમાં :

પિતાને જ ડગલે ડગલે, અનુધુ !

આમલીઓની ધરામાં થઈને જ
વીર ! પાણી સરિતાના તઠમાં.
ભૂત પ્રેત જ્વેવી, માયા સમી,
શંકા શી ડોલતી છાયાઓમાં થઈ,
કુમારા રાન સમાન અખંડ પ્રકાશમાં:
અન્ધકારનાં વન વટાવી
પ્રભાતનાં જ્યોતિર્જલમાં.
એ જ પરમ માર્ગ, બન્ધુ !

વિદ્યાય દેશા, વીર !
હુનિયાનો અન્ત વિદ્યાય જ છે,
આદિ લલે અન્યથા હો.
પણ એક વેળા તો આંખ ઉધાડો,
એક છેલ્લી મીઠથી તો જગતને જોઈ દ્યો.
શું જગત અહુ જોયું ?
બલે, તહમને ગમ્યું તે અમને ગમશે જ.
ક્ષર મૂડી અક્ષરધામમાં,
મૃત મૂડી અમૃતત્વમાં,
મનુકુલ મૂડી ચિરંભવ દેવોમાં :
એ જ કલ્યાણુપથ, લાધળ !


છલ્લાવેલ્લું રનાન કરી દ્યો,
સંસારના મળ ધોધ નાંખા,
અશુદ્ધ વળ વિશુદ્ધ ઓઢો.

કુન્દનને અગિનની જવાલા તાવે છે,
 પુષ્યપ્રાલ્લ પુરાણુ સમયથી
 આત્મકુન્દન પણુ અગિનદેવ પરીક્ષે છે :
 વીરા ! વિરાનો અગિનરાજના ઉછે.
 તહમારી કુન્દન સમી કાયાની
 થવા હો બળાને ખાખ :
 તહમારા આત્મતત્ત્વનાં કુન્દન મકાશવા હો.
 માટીમાંથી મળ્ણુ મળશે,
 અને અસમાંથી કુન્દન જરૂરો.
 એ જ માર્ગ, એ જ માર્ગ :
 શુદ્ધિભિત્તિનાં પ્રત સ્વીકારો.
 શતશિખ અગિનદેવની પાંખ્ય ઉપર
 વિહરો અનન્તતાની કુંજેમાં.
 તેજ તહમે તેજભૂમિમાં પખારો,
 કિરણુની અમોલખ કળિંગ તહમે
 સૂર્યોના સૂર્યરાજમાં વિરામો.
 વહિરાજ વાદળમાં લખૂડે છે,
 લખૂડો ગ્રલુવિહારી તહમે પણ
 વાદળ ઝાડી વિલુ વિરાટપદમાં.
 એ જ પુનિત શ્રેયસ્યપન્થ, વીર !
 રહ્યાં જ મળશે વિશ્વરાજ મહારાજ :
 અસમમાં રમથાનની ભૂતપતિ,
 અને ચયતા પાછળ સર્વિયદાનાં.

જ્ય જગન્નાથનો, બન્ધુ !
 ધન લેદી પ્રભારાશિ અગટયો છે,
 જગત્સુખ્ડે પ્રકાશ પ્રષુદ્ધ્યો છે :
 પૃથ્વી અને પ્રભુને
 તેજની મણિસાંકળે સાંકળતો
 સૂર્યરાજ આંખડીમાં આવી ઉભો છે :
 વીરરાજ ! અમારાં અશ્રુ એ સુકવશે.
 દેવનાં હુન્દુલી ગાને છે—
 તહે પાણું વાળી મા જોશો—
 અમારો સંસાર અને તહેનાં સુખદુઃખ,
 તહેના વિલાસ તથા તહેના વિલાપો,
 હવે તહેમને બાધા કરતા નથી:
 અમારે વાસ્તે જ તે રહેવા ધો.
 દેવો તહમારાં પગલાં વધાવે છે,
 દેવાંગનાએ એવારણું લે છે :
 સ્વીકારો તે દેવાનું આતિથ્ય,
 વીરરાજ ! રમો તે દેવભાવમાં.
 એ જ મંગલકારી માર્ગ, લાઈ !
 જ્ય, જગન્નાથનો જ્ય !
 ધરો લડકાનો લેખ,
 અને લઈ લ્યો અલદીક્ષા, બન્ધુ !

(૧૩)

ગુરુહેવ



ગુરુહેવ ! નમોનમઃ

ગુરુ ! ત્યાં સુણાશો આ શબ્દ ?
 જ્યેષ્ઠાં વિચરો છો જ્યોતિરિપે,
 ત્યાં મૃત્યુદેાકના એલ પહોંચે છે ?
 શીખઘ્રયું છે આપે જી, નેસ્મરં છું,
 કે માનવ વાણીનો પડ્યો
 અવજ્ઞાનદ્રિયમાં પરિસમાપ્તતો નથી.
 મનવચનકર્મના મહાધ્વનિ
 જગતમાં ને જગતની પાર ધોરે છે.
 એટલે શક્તા છે ગુરુએધમાં
 કે શબ્દ નહીં તો શબ્દાર્થ,
 ને શબ્દાર્થ નહીં તો શબ્દભાવ,
 સદા યે સંભળાય છે ત્યાં.

‘ત્યાં’ એટલે કંઈએ ?
 સ્વર્ગ ? વૈકુંઠ ? જોલોક ? અક્ષર ? કંઈએ ?

જગજજનો જાણવા ધર્છે છે,
મૃત્યુના પડા પાછળ જેવા વાંछે છે.
મહેં તો વચ્ચનામૃત પીધું છે કે
ન હિ કલ્યાણકૃત કથિત
દુર્ગતિં તાત ! ગચ્છતિ.
કંધ કંધનાં કલ્યાણુ કોખાં છે,
માણુધન ખરચી પ્રાણુ ઉદ્ધાર્યાં છે,
તે કલ્યાણુ જ પાંચા છો.
જરૂરાં વિદરો છો રહાં,
સંસારમુક્ત તે સદ્ગતિમાં;
પુષ્યધામે આનન્દમૂર્તિં છો.

ગુરુરાજ ! મોહન એ અભ્યુનો કાંઠો,
ને હેતાળ એ મોરભીની વસ્તી !
કાળમીટના વજતટની એ વેરાન અભ્યતા
ને લોકસંધના સદ્ભાવની એ કુમાશ !
દૈવ ને મનુહેવ જરૂરાં લીલા કરે
તે તીર્થ, ને અન્ય અતીર્થ.
શુરુહેવ ! પુષ્યપગલાંથી આપે,
ને સાધુકવિ વેદમૂર્તિં મહિં
અલસભાન ! અલરતન શંકરલાલજીએ,
એ અતીર્થન તીર્થ કોખાં અમ માટે.
ગંગા અને ગંગાના તદ્વાસી જેવાં
સમરણુમાં રમે છે એ સહુ.

થેરે નહે સુખની મોરલી ઓલતી,
 -હાને ઉગલે પૃથ્વી ઉપર પગલાં પાડતા,
 પુષ્યના પરિમલે જીવનનું પુષ્પ વિકસતું.
 મ્રાદુલ બૃહર્ષતિની જોડલી સમોવડી
 નયનભેલડી તહમારી ગ્રોજાજવલ પ્રકાશતી.
 વિશ્વાલ તેજરસ્વી ભાલદેશો
 અનેકરેખ નિપુંડ સમી
 તત્ત્વચિન્તનની રેખાઓ લંબાતી.
 જ્ઞાનભારે ભર્મભરે નમતી,
 અનુભવના અંબારથી અંભેલાં
 પોપચાં ધીમેશથી પડતાં-ઉપડતાં.
 ફ્રિલસુદ્રની તત્ત્વલીનતા ને ચિન્તનસમાધિના
 વદ્ધને ઊડા પડ્છાયા પથરાતા.
 યૈવનનો ઉધાડ છતાં વિકારધીન,
 બુદ્ધિવૈલબ છતાં અડગ શ્રદ્ધાવાન,
 પ્રારખખવાદી છતાં નિરન્તર પુરુષાથી,
 અદ્વિતીય ગુરુ છતાં સદાના શિષ્ય,
 મહાતત્ત્વજ્ઞાની છતાં યે
 એકાન્તિક લક્ષત તહે હતા.
 અભ્યાસના ખાલી કુંભમાં
 દુંકા જીવનનો ઉભરાતો અનુભવ
 નીતારી નીતારી ભર્યો હતો.
 જડદેહ બદુકળ જણ્ણાતા,
 પણ ચેતનદેહ વિરાટરૂપ વિલસતા.

સાધાઈ અને સરલતાની સૌભ્યમૂર્તિ,
ઉન્માદ ને અલ્યાચારના અરિ હતા.
વસન્તના વાયુ વાય,
હુણે, ને સહકાર નમે:
સંસારનાં સદ્ગુળ ફળતાં
તેમ તેમ રહમારી ડાળે નમતી:
સન્માનથી સર્વદા રહમે બિનયી થતા.
અમારી નિત્યે કલ્યાણુકામનાવાળા,
શિષ્યોના નિરન્તર હેતના લાભી,
વિદ્યાર્થીઓની વાતના વિસામા હતા.
અહિયારીને અહિયય્ય એધતા,
ગૃહસ્થાશ્રમીને ગાહ્યર્થ્ય ધર્મ શિખવતા:
પ્રેરણ્યાર્થી મકાશતી એ વાણી હતી.
હેવમન્દિરમાં યે હેવકથા કરતા,
પુરાણ વાર્તાં નવજિતસાહે લલકારતા,
સાધુસન્તો યે સુણી સતકારતા તમ વેણુ.
પંચનિદ્રયો અખંડ પંચ વર્તમાન પાળતી.
એકાદશીનાં જાગરણ ઉપવાસ ધુન નિરખી
સુરી અને અગમ્યવાહીએ સાંભરતા.
રહમારા વતન ફરતાં વનમાંના
મહાધોષ શાર્દુલની ગજ્ઝના સમોવડો
રહમારો ઉપહેશ ગાજતો.
લક્ષ્મીજીએ કુંકુમચન્દ્રકે

ને નારાયણ ભગવાને કેસરતિલકે
ગુરુરાજ ! તહમને વધાવ્યા હતા :
ને દેવલાગનું નૈવેદ્ય ધરાવીને જ
દેવદા વૈભવ તહમે બોગવતા. ॥
લીલમલીલી અમ ગુજરાતની અમરાધ્રાં
નવશિક્ષણુંની તહમે સાખ હતા.
પ્રાચીનઅર્વાંચીન ઉલયમાં વિશ્વાસુ,
પૂર્વપશ્મિમ ઉલયમાં શ્રદ્ધાવાળા,
રાજાના ઉલયમાં આસ્તિક રહેતા.
સદ્ગુર સહનનન્દજી ને મહાત્મા અફ્લાતુન
ઉલયના પરમ ઉપાસક હતા.
કાલના આદિથી કલિએ
પુષ્પના ગુણાનુવાદ ગાંધ રહેવા
મથે છે, પણ નથી ખૂટ્યા એ :
મહાનુભાવી ગુરુદેવની તો પછી
ગુણુગીતા કેમ ગવાધ રહે ?
નેતિ, નેતિ, નેતિ, ભગવાન !

આયુષ્યની ઉજમાળી રમૃતિએ।
કોને નથી સતાવતી ?
સુખનાં રમરણોમાં બાંકુ દુઃખ છે,
દુઃખનાં રમરણોમાં બાંકુ સુખ છે.
પુરાણું સુખ સંભારતાં ચે
દિલ દાંઝે છે, ગુરુજ !

સૂર્યનું કિરણ સપ્તરંગે ઉધડે,
ને સાતે રંગ પાળા સંકેલાધ
એકન્યોત શ્વેત કિરણ સોહાયઃ
તહમારા જીવનનું કિરણ પણું તેમ
સંસારમાં અનેક રંગે ઉધડ્યું,
ને ઉધડી, પ્રફુલ્લી, અળાહળ ઝાડી,
અન્તે એકન્યોત સંકેલાધ,
ખવલ રંગે ધર્મમાં આથર્યું,
ને સૂક્ષ્મ અંશ અક્ષરરચરણે વિરામ્યો.
જ્ય એ તહમારો, ગુરુહેવ !
જગત જુલા, ને પછી એ જુલા.

પૃથ્વીને આરા છે,
ને પૃથ્વીમાંની ઉત્કાનિતને યે આરા છે.
એ પછીના ઉત્કાનિતમાર્ગ
અવકાશને રહામે તીરે છે;
ને ભૂત્યની નદીનાં અન્ધારકાળાં નીર
વચમાં ધેરાં ધેરાં વહે છે.
એ વારિ તરી ઉત્તરતાં
મનુષ્યનાં માટીનાં માળખાં
ઓંગળી જ્ય છે, હેવ !
તહમે પૃથ્વીના પોશાક ઉતાર્યા,
તહમે ચેતનના વાધા સંજ્યા,
તહમે તેજની પાંખો પ્રસારી ઉડ્યા.

એ ઉત્કાન્તિના અગોયર પન્થે.
જિધ્વ'ગામીનું જવું યે ધન્ય છે,
અધોગામીનું જવું યે ધૂળ છે.
જગતયાત્રામાં જવન ને મૃત્યુ
ઉલ્ય તહે ધન્ય કર્યાં.

દૂંકી આયુષ્યની અવધો તહમારી,
પણ લાંબાં ઉરનાં સંભારણું અમારાં.
સૂર્ય કરતાં સૂર્યપ્રકાશ વિસ્તીર્ણું છે,
પુષ્પ કરતાં પુષ્પના પરિમળ ઝોળા છે :
પ્રકાશવન્ત ને પરાગમય આયુષ્ય કરતાં યે
એ આયુષ્યના સ્મરણું સુગન્ધ દીર્ઘજીવી છે.

યસ્માનો દ્વિજતે લોકો
લોકાનો દ્વિજતે ચ યઃ
કોઠને દૂલ્બભ્યા નથી,
કોઠથી દૂલ્બાયા નથી :
વડવાનળની મહાનવાલાએ, હેવ !
ને કે ધણી યે સણગાવેલી ઝેં તો,
પણ દિલનો દરિયો ઝોળાએ નથી.
સહુને બધું ક્ષમા કરતાં જ
સંચર્યા છો સંસારના તીર્થમાં.

આપણો પ્રસંગ શું આલેખું ?
નથી વીસર્યો ને નહોં વીસરાય,

રમરણુમાંથી નહીં જરી જાય
એ આપેલું જવતદાન.
ખરાએ લાધતી ઝારી નોકાને
વાળી ઠેણુમાં મૂકી,
એ નાખુદો ભૂલશે કદી ?
ગગનના તારકલેખ ભૂંસારે ?
કે ભૂંસાય એ હધ્યાના લેખ ?

ગુરુદેવ ! નમોનમ :
એ વાર શરણે આવ્યો, ને તથ્યા.
ત્રીજી વાર પુણ્યનામાવશેષ
અહીં લખું છું અધુરે અક્ષરે.
લોકપ્રિયિતા કુવે છે કે
રામનામે પત્થર તર્યા :
તો કાશીરામને નામે
આ પત્થરે તરશે રતો.
તેહાંથી યે ઉદ્ઘેષાધજો મુજ યુદ્ધિને,
ને મેરણુનાં પીયુષ પાડવજે, દેવ !
શિષ્યસ્તેડહં શાધિ માં ત્વાં પ્રપન્નમ.

(૧૪)

સૌરાષ્ટ્રનો સાધુ

~~~~~

સૌ રાષ્ટ્રીએ ! સહ સુખુને,  
સોરક સાધુસનો થતો જય છે.

ન એ સાધુ ચે ગયો  
સાન્ત તજ અનન્તમાં,  
લીલા તજ અક્ષરમાં.  
એ ગયો અવનીમાંથી ઉપર,  
ને ચાલ્યે જ જય છે એમની એમ  
જગતની આ ધર્માળ.

શૃંગાળાં ગિરનારનાં શિખરે।  
હવે સૂનાં સરિખડાં છે.  
એ મુગાટોમાં ભણ્યાએ નથી.

તહેની પ્રિય ટેકરીએને જોણ  
તે ચોઠ્યો મૃત્યુસમાખિમાં;  
તહેના પ્રિય સાગરજલમાં  
કરી તહેની દેહલસમ.

મહારે તો હતી  
 પંદર વર્ષની પિછાન એ સાધુજીનની,  
 પણ તે પંદર તિથિઓના જેવી.  
 હિને હિને એાર ઉધડતી  
 એ અમૃતની ચન્દ્રકલા.  
 પુણ્યમા અકારી એ સુધાકરની,  
 ને કૃષ્ણ પક્ષ બેઠો પછી.

એમે એને બાવળ કહેતા.  
 એની ઝૂંકથી હુઃખ શીટતા,  
 એના અડકવાથી રોગ મટતા.  
 સચ્ચિદાનન્દના એના જ્યોતિનિ હતા.  
 એમનો શાંખનાદ ગજવતો તે આવતો,  
 ઉમંગ ને ઉત્સાહના ઘાલા પાતો,  
 આણેલા અવનવા આહેશ સુણ્ણાવતો,  
 ને સર્વર્ષ મૂકી ભાગતો.  
 રોકયો કદ્દી યે રોકયો નથી  
 છેલ્લી ધરી સુધી તે.  
 એ તો લવનો ભાગેકુ હતો.  
 વડિલે લગ્નનાં સુહૃત્ત લીધાં  
 તો જધ બેઠો ગાંગાને કાંઠે,  
 કાશીવિશ્વેશ્વરના લિખવિખ્યાત ચોકમાં.  
 ધાટના સંન્યાસીએ કનેથી  
 સંન્યાસની ભાંગ પીધી,

ને ભરી લીધાં અંગોમાં ગંગોદક.  
 ધેર પિતાનાં દાશરથી મૃત્યુ થયાં.  
 એમ લીધી જીવનભરની  
 એ ખલચારીએ ખલચર્યદીક્ષા.  
 તહેના જોખનપુરને મોદ્દા હતા  
 મહાજનમહોડવી લક્ષ્મીના યે દાસ.  
 ભામિનીએથી લડકેલો તે  
 અખળાને બ્લાખાતું ભાખતો,  
 પણ સૈનાન્ધર્યનો હતો પરમ પૂજારી.  
 સંસારમાં સ્વર્ગની સુન્દરીએ  
 અવતારવાના એના હતા કેડ.  
 રસિકવર ભાધવરાયજુનો પ્રતિહાર  
 હતો તે રસનો ધાયલ રસિયો.  
 નિરન્તરનો નિઃસ્વાદુ તે  
 ભોજનની કવિતાએ કદ્યતો,  
 અજબ વાનીએનાં કાંધો રચતો.  
 તે વનચર હતો;  
 વનવનની વનરૂપતિએમાં  
 તે ક્રરતો ને ચરતો,  
 ને ઉગતી ઔપધીએ આરોગતો.  
 એ તો પરિવ્રાજક હતો  
 અનન્તચાયુધી આર્યાવિતનો.  
 તીર્થજલના કો ધાટ,  
 શિખરશિખરનાં કો મન્દિર,

શુદ્ધાચ્છે કે ગિરિમાલાઓઃ  
 એને એકે અજાણ્યાં ન હતાં.  
 કાશ્મીરની કમનીય સરોવરકુંઝે,  
 અદ્રોહિદાર ને અમરનાથના  
 પરહના રષ્યુપગથાર,  
 સિન્ધુ અલપુત્રા ને દરાવતી,  
 ગાંગા ગોદાવરી કે કાવેરી,  
 ધૂતુષ્યકોટી ને સાગરસેતુ,  
 કંચનગંગા ને ધ્વલગિરિ:  
 તે સર્વેના સનાતનત્વમાં  
 કરતો હતો પરમ દર્શિન  
 ગુજરાતનો એ પરિપ્રાજક.  
 એને એક જ મોહ હતો,  
 એની જન્મભૂમિનો ને ‘જી’ નો.  
 ચોરવાડની ચારુ વાટિકા કીધી એણે.  
 અણુષ્ણનાને છતું કીધું  
 ગુજરાતની ગૃહકુંઝેમાં.  
 વતનને નામે રહતો તે લોકસલાઓમાં.  
 એ દેહનો તે આત્મા હતો,  
 એ પ્રાણુની તે પ્રેરણ્ણ હતો.  
 સહભાવ ને સલ્કમ્રીના આંખાં  
 વાવી ઉછેરેલા હતા તેઢાં.  
 તીર્થેના તીર્થપરિમલ લાવી લાવી  
 પમરાની હતી પરાગવન્તી

સૌરાષ્ટ્રના સાગરતીરની ચારુ વાટિકા,  
 ધરધરમાં ને ઉરઉરમા ભર્યા હતા  
 એ પુણ્યધામેના પુણ્યલાવ.  
 ને પીધાં હતાં પ્રકૃતિમાતનાં ધાવણુ  
 એ કુદરતના બાલકે યે બહુમૂલાં.  
 વડાવનનું ગુણુગાંભીર્ય,  
 નાગરવેલની સુકુમારતા,  
 કદળીવનના સૈન્દ્ર્યસોહાગ,  
 સહકારમાલાની પરોપકારિતા,  
 ઝુંડમાંનાં સાહસિક પૃથ્વીપર્યંતન,  
 ચોરવાડને ઘેરી પડેલી  
 અધ્યાન્દ્રાકાર લીલોતરીની ટેકરીઓનાં  
 નિરન્તરનાં હરિયાળાં હાસ્ય;  
 મીઠી વાવેનાં અખૂટ જરણુઃ  
 એવી હતી તહેની યે આત્મવિભૂતિઓ.  
 મનનો તે હતો મહારાજાનિરાજ,  
 પણ ભક્તાધીન ભૂધર જેવો  
 ભિત્રાની મૈત્રીનો તે હતો મોગો.  
 કવિના અખાડાનો  
 તે પાટનોંગી હતો.  
 માણુકને કંડેતો રતનોમાં રતનરાણી.  
 ભક્તિ કર્મ ને ગાન્ધૂતિ સમોવહું  
 તહેતું યે હતું ત્રિપુટિમંડલ.  
 ભજનની ડેકાવલિ લલકારતો,

અનગન પ્રભુનું યે નાચતો,  
 ઉરમાં દેવહિંડોલ ડોલાવતો,  
 આત્મામાં ખાલખરતી ઉલરાવતો  
 એ ખાખી ભક્તરાજ મોહનદાસજી:  
 ગરીબોને સાહિલજલ પાતો,  
 કર્માંગામાં હુઅકાં આતો-તરતો,  
 તેજસ્થંભ શો ઊજજવલ ને લારખમો,  
 મોલી અડગનિશ્ચયી ઝૂટસ્થ શો,  
 પરમ કર્મધોરી અખંડાન-દજી:  
 ને ગ્રાનગમ્મતમાં કલ્લોલતો તે.  
 હું તો ડેાકિયાં કરી જતો,  
 ઝાંખી લેતો, અડધુંક આવતો.  
 એ તો તારાએ મહાજલના.  
 તૂઠ્યો તહેમનો એ ત્રિવેણીનો ત્રાગડો.  
 નરનારાયણી લજ્જનમંડલિનો  
 એ હતો લોગી ભક્તરાજ.  
 અજઘના એ અર્થ ઉડેલતો,  
 કૃષ્ણાખંસીના બોલ પારખતો,  
 સાગર સાથે વાતો કરતો.  
 ચ્ચાપાણીને મોહમ્મદી આરે,  
 કે પાણુખાણોણાની પેલી પાર વતનમાં  
 હડ્ડા દહેરીના દીપકલ્પને તીર  
 શિવમન્દિરનો છાયામાં  
 બેસતો અડોલ ને અવ્યય,

ઝીલતો સાગરના સનાતન સન્દેશ,  
ને સાધતો એમ સાગરસમાધિ.  
ગહનતામાં તે નિહાળતો,  
અનક્ષરી લેખ વાંચતો,  
અનાહત શબ્દ સુણતો,  
ને રહેતો એ મરતીમાં અલમરસ્ત.  
એકદા જગતનો પડ્યો સળક્યો,  
ડાલ્યો, ને ઉપદવા લાગ્યો,  
આકાશની ઝાલર સંકલાશી લાગ્યું  
ગહનતાનાં દર્શાન કરાવવાને ડાજ.  
પાગલતાની ખાની બેખડખારે  
લાગ્યું કે એક પાય હતો,  
ને ખીંચે હતો અધ્યર અન્તરિક્ષે  
એ ડાતરના સુખદારમાં પડતો.  
પડદાને ડાલતો થાંભાવ્યો,  
દુનિયાના ડાઢા રણા ચોગીજન,  
જતાં કીધાં સદાનાં  
વિશ્વગહનતાનાં તે બેદદર્શાન.  
એ જગતના લોક ! ખોલો,  
આપણે એથી કમાયા કે ખોયું ?  
કાલગંગાને ઉલ્લય આરે  
એના ઉંડા પાયા હતા,  
જૂનાનવાનો તે સેતુ હતો.  
કંઈ કંઈ વિદ્ધાનભંડલિને

સાંકળતી તે મણુસાંકળ હતો.  
 એક દીપ છે નહાનકડો  
 નર્મદાના વિશાલ જલપટમાં.  
 એની એક પાંખે વેદાભ્યાસી ધરકાલ,  
 ને ભીજુ પાંખે શુકૃહેવજુ વિરાને છે  
 પૃથ્વીની ભર્મર જ્ઞેવા ઉસુંગ કિનારે.  
 ગાંગનાથના અનુભવિયા યોગીન્દ્ર,  
 અતલ અલંજલના તારા  
 અલાન-દળ. પાસ દીક્ષા લઈ  
 વ્યાસના વનમાં સંચર્યો તે અલચારી.  
 નર્મદાના એ વ્યાસોદ્વાનમાં,  
 શુકૃહેવજુની છાયાપામરી એઢી,  
 સંકદ્રિપ કીધો અદાર સ્વર્ગ રચવાનો.  
 એ ક્ષેત્ર વ્યાસક્ષેત્રની છાયા છે,  
 પ્રતિશા એ વ્યાસપ્રતિશાની 'છાયા રણી.  
 એ અલિલાષ અધુરા રવ્યા;  
 શુજરાતના લાગ્યની એટલી ઉણુપ.  
 એની દશ્ચિ જ હતી અદભુત,  
 સ્વર્ગાય નયને તે જગતને જોતો.  
 આય્ય વિધવાની આરત તહેણે સાંભળી,  
 ને તહેમની દુઃખસોધન-ત વિમલતા યે  
 નિરખી હતી તહેની આંખડલીએ.  
 જગતાથપુરિયાએનો તે જોધ્યો હતો.  
 પ્રેમ પ્રેમ ને પ્રેમ

હતો તહેનો જીવનમન્ત્ર。  
 પાંડિતોના પાંડિલધનનો  
 તે નિર્ધારન હતો,  
 પણ અખંડ ઉછળતી  
 આત્માનુભવની તહેની પાતાલગંગા.  
 સંયાસીની સામગ્રી સમા,  
 ઘુષ્ણના સૂત્રચતુષ્ઠય જેવા,  
 તહેને યે હતા ચાર મહાસ્કૃતો.  
 ‘બંદા ચક્રકુમ, કે દુનિયા દિવાની ?’  
 એમાં તરતી તહેની નિરભિમાનતા.  
 ‘ચોક્કસ દરજનો’  
 એમાં વસતી તહેની સત્યપ્રિયતા.  
 ‘પોલંપોલા’: એમાં હતાં  
 તહેના અનુભવના દર્શાનવિવેક.  
 ‘આકુસ્તોત્ર’: એમાં પ્રગટતી  
 તહેની કમ્ભોગની કર્ત્વભાવના.  
 તહેની દ્વિલસુદ્ધિના સિંહાસનનાં  
 એ ચાર પાવડાં.  
 નહાનકડા ગુજરાતના એ નહાનકડા ઘુષ્ણ !  
 તહારે લોકભાષામાં જ બોધવું હતું:  
 પાંડિતોની સભાભાષામાં નહિ,  
 પણ રીબાલકની કુલભાષામાં  
 તહારે લખવા હતા નવસત્યોના નવઅન્યો.  
 તહારી અક્ષરાવલિ જ અનોખી,

જણે અજેથની ડો નિગૂઠ લીપી.  
 તે અલૈાકિકમાં જ રમતો,  
 ને અલૈાકિકનાં દર્શાન લૈાકિક કરાવતો.  
 જગતને સ્વર્ગ દાખવતો,  
 સંસારમાં ને દુસંસારથી પર.  
 તે અદ્ભુતમાં જ આનંદતો,  
 ને અદ્ભુતને અવતીમાં ઉતારતો.  
 બેદાવલિની ગહન ધટાડુંઝેમાં  
 તે ઉડતો, ને ઉડાવતો.  
 પરમ યોગનું મ્રથમ પદ,  
 માણુવિનિમયના લેદ્ધાર,  
 ઉધડયા હતા તહેને કાજ.  
 જંગલની જડીખુટીએ,  
 વૈદકવિદાનના અગોચર અભતરા,  
 તે શાખકને સુગમ હતા.  
 આત્મસત્યોાની સીમમાં તે રખડતો,  
 કે જથું રથૂલની પાળે  
 અધ્યાત્મજલમાં લળે છે.  
 બંસીમાં પ્રલુએ શું ગાયું ?  
 એ શાખવા મથતો.  
 ભરતકવિદાના આણાઅધુરા સૂચનથી  
 ભૂત ને ભવિષ્ય ભાખતો.  
 કવિતાની પાંખે ઉપર  
 ગહનતાના આરાએમાં

સનાતન બેદાવલિનાં ગીરમાં  
બામતો હતો અદ્ધર ને એકાંકી.  
પુરાણુમસિદ્ધ ધતિહાસોજજવળ  
સૈચારાષ્ટ્ર બબ્યતાઓાની ભૂમિકા છે:  
ગભીરાં ગીર ને ગરવો જિરનાર,  
સિંહ સાગર ને સૌભમાય,  
યદ્વારાં શાની ને શ્રી કૃષ્ણાની ભર્તમ,  
લીલી નાથેરની જલભર કુંઝે:  
એ કાલજૂની બબ્યતાઓામાં તું  
અટકતો, બોગવતો, ને બોગવાવતો,  
એમાં સ્નામાં ગરૂડ ઉડે  
એમ તું ઉડતો વિશાળપંખાળા,  
ને ગિરિશિખરે રહારા માળા હતા.

ને એમ જ  
રહેલું હતું ને રહારે ?  
વાયુની લહરીની પેઠે ધૂકા,  
ને વ્યોમવીજળાની પેઠે નિર્ધન્ધ ?  
ગગનપાટે મેધખંડ ડેા વિચરે,  
પૃથ્વીપરનાં ગગનપડછાયા સમા  
મહાસાગરે ડેા મહામોજ  
ધેરં ધેરં ધૂધવતો ધૂમે,  
એમ રહારે યે ધૂમવું હતું જગતમાં.  
બનનાં યે રસખન્ધન

તહેં ન સ્વીકાર્યાં જીવન ભરમાં,  
પરમાર્થના કે લોકસેવાના ચે  
પ્રતયુધ ન લીધાં કદી પણ,  
છેવટે દેહયુધે લાગ્યો  
ત્હારા નિર્બંધ આત્માએ.  
ઉડી ગયો આકાશના પડદા પાછળ,  
અનન્તની વનધટાએમાં અદૃષ્ય。  
નિર્બંધને પ્રેમના બન્ધે નવ હોય ?  
કહે છે ને સહુ કે  
પ્રેમ તો પ્રભુતા છે ?

ને કાલનાં ત્હારાં તેજવધામણાં !  
સૂર્યલોકમાંથી ત્હારા તેજતમરકાર !  
તહારા દ્વાદશાની રહાંઝ હતી,  
અમે મહાસાગરને આરે હતા,  
હુજ સમરણોને સંભારતા હતા.  
ધણ્યાએ તેહારે અણુદીઠેલું દીકું.  
વ્યોમ ભરી ખાંધ્યો હતો મેઘચન્દરવેા,  
તેજના ગલ સરિઅડો  
સન્તાયેલો હતો માત્સુ મેઘપટલમાં.  
બજતી હતી ધેરી ધેરી  
સાગરની સનાતન કરતાલ.  
અર્થાંધિની ઇપેરી ઇનિલક્ષિનારી શિવાય  
જલપગથાર ગગનપાટ ને અન્તરિક્ષ

કૃષુરંગી હતાં મેધસ્યામ.  
 દૂર દૂર, માત્ર સાગરને સીમાડે,  
 લહરતી હતી તેજભૂમિકા  
 ઇપાની વાડીએઃ સરિખડી.  
 તેજકુંનેની કુંપળરેખા સમી  
 ઇરકતી હતી જલોમિની પાંદીએઃ તહાં.  
 સાનનદાશ્વર્યથી અમે સૈંચ એને  
 અનિમિષ નેને નિરખી રહ્યા.  
 જાણે આંખડલીના આમન્ત્રણુનો ઉત્તર હોય,  
 જાણે અમારી આશાનાં આગમન હોય,  
 જાણે છિમાદ્રિના છિમપગથારમાંથી  
 ગાંગોદકની સહલ્લાખારા વરસતી હોય:  
 વાહણાંયડીના વહતા પૂરની પેઠે  
 જગતસીમાન્તેથી વહી આવ્યો  
 તે તેજભૂમિકાનો પૂરપ્રવાહ,  
 ને શામળા સાગરજલ ઉપર  
 સરિતાના રજતપટ સમોવડો  
 વિશાલ તેજપાટ પાડ્યો.  
 મેધાડંઘરે યે ડેર સંકોરી ધડીક,  
 ને એ લગ્નનાં દર્શાન કરાવ્યાં લગીર  
 કે જેને જગજગનો પૂને છે  
 જગતના જન્મકાળથી.  
 અમને વધાવી વહી ગઈ  
 તે તેજગંગાની ઉછળતી છોળ.

જાણે ખૃત્યુએ પળોક પડ્હો ઉપાડ્યો,  
જાણે કે જરીક તહારં પોપચું ઉધડ્યું,  
ને તહારી તેજભીટના એક મટકાએ  
વધાવ્યા, તેજસ્નાન કરાવ્યાં.  
એમ લાગ્યું અવનીમાંના અમને કે  
તહારા આત્મતરવે દર્શાન દીખાં જાણે  
એ સ્ફૂર્તિલેાદ્યના તેજકિનારેથી.  
પણ પૃથ્વીવાસીના પુષ્ટોદ્ય  
અનિસ જ છે હમેશાનાઃ  
પંખીની ઉડતી પાંખના પલકાર થા.

તે સિધાંયો સાધુવર  
મતુષ્યમાંથી દેવમંડલિમાં,  
અનિસમાંથી નિલધામમાં,  
જગતમાંથી જગનાથમાં.  
માયામાંથી પરબ્રહ્મમાં.  
યોગીઓની યોગગુદ્ધાએ  
ખાલી-ખાલી શી છે ઉજજ્યન્ત ઉપર,  
ગગનગઢ્ઢર થા ગરુડના માળા  
સૂના-સૂના છે, દહેરીઓ સમા,  
ફૂલેલા કાનની બજોલો જેવા.  
સ્થિંહની બોડમાં બહારવદ્ધિયા  
ભરાય છે ને ભરાય છે,  
મહાત્માઓ નથી એ વનમહેલોમાં.

સૌરા ષટ્કીએ। સૈં સુખુનો  
 મનુકુલનો આ મહાપોકાર,  
 ઉંકું ઉંકું અન્તરમાં આલોચને:  
 ગંધ શીંમમાં ગિરનાર દૂરતો નેતો।  
 ફૂલબા લોચનો સરિખડા  
 જલકુંડા જલખાલી હતા,  
 પૃથ્વીના સુકાયેલા રતન સમા।  
 શિખરોની હૃદયસેરો નેતી વહતી.  
 વહુકી ગંધ હતી ગિરનારની કામધેતુ.  
 ગિરિવાસીએ ગિરિ ઉપર  
 પાણી તળેટીમાંથી રહડાવતા.  
 સૌરાષ્ટ્રીએ! શિખરો સૂકાય છે,  
 જોમુખી ગાંગાનાં બ્લેણુ તૃદ્યાં છે.  
 હવશિખરો સૂનાં સમાં છે,  
 મનિદરોમાં મહાત્માએ નથી.  
 સોરઠ સાધુસૂનો થતો જથ છે.  
 ન એ અમૃતમોરલો યે  
 ઉડી એઠો અનન્તને આંખલિયે  
 એની ધેરીમધુરી ડેકા ટહુકી,  
 એ જીવનપુરાણે સમાસ થશું.  
 ચાર વાટિકાનો ચારતમ  
 સિધાવ્યો તે સૌરાષ્ટ્રનો સાધુરાજ  
 અહાલેક ઉચ્ચારતો અલખની અઢીએમાં।

(૧૫)

## પિતૃતર્પણ



૧

બાર બાર ગયાં વર્ષો રાનિએ; પડતાં સુની,  
બાર બાર વલ્લાં વર્ષો વાદળી વરસી ભીની :

બાર વર્ષો અથાં, તાત! મૃત્યુના પડદા નમ્યે;  
હજ યે અક્ષુમાં તહે યે પ્રવેશા પૂર્વના રમે.

કાલની વીંઅતી પાંખ અનેરા વેગથી ભરી,  
નેત્ર મીંચી ઉધાડું તુહાં આવે અહાંડને ઝરી.

નથી તે મેધનાં નીરે, નથી અન્ધારના જલે  
ઘાયાં ડો રમૃતિનાં ચિત્રો રંગેલાં પ્રાણુપાટલે.

આખ્યા એકાન્ત રાત્રીએ, ને મેધે રસ સીચિયા;  
એમ જીવનના સર્વે આથભ્યા દિન ઉગિયા.

વસન્તે ને વસન્તે જ ઓલે છે એલ ડોકિલા,  
આત્મામાં એમ ઓલે છે વસન્તે આપની લીલા.

૨

પિતાજ ! પત્ર ને પુષ્પે એ જ આવી વસ્તન્ત આઃ  
દૂહોડે છે ડેલિલા, એવાં દૂહોડે છે સમરણો, અહા!

આંખાની ડાળ મહોરી, ને આત્મા યે સુજ મહોરિયો;  
ગાય છે સાધુ ને સન્તો હરિની રસહોરીઓ.

હું એ તે લઈ આ વીણુા સમરં છું ગુણું આપના;  
પુષ્પયશ્લેષાક પિતા ! મન્ત્રો જપું છું પિતૃજાપના.

૩

વીતતી દીધાં રાત્રી, ને થતો એહરોડ દેશમાં,  
એ એહરોડે ઉગ્યા આપ આશાવાદી અરુણુ શા.

છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ;  
દૈવાના ધામના જેવું હૈકું જણે હિમાલય.

બુદ્ધિવૈભવ, ને આરથા, આશા, રસ, ઉદારતા :  
એ હૈવી દીપમાલાનાં અન્તરે તેજ રાજતાં.

આપ અમૃતના જયા, ધાવણું અમૃતે દીધાં;  
ને તેથી અમૃતમીહું આપનાં કવિતો હતાં.

ડાલા પુત્ર જ ડાલાના, અંગોઅંગે ઉરે પણ,  
મન વાણી કર્મભાં યે, ઝરે નિત્યે ઝાપણ.

વીરા જયકુમારીના, જમાંયો જય લોકમાં;  
ને હિંકરના ભાઈ, મેતાપી ભારકરે સમા.

દેવાનન્દ રમન્તા તે દેવાનન્દ ગુરુથી આ.  
પાભીને કાંયની દીક્ષા દીખ્યા દેવકુમાર શા;

અર્થો ઉત્સાહી એ કંદ મેઘના સમ ગાજતો,  
યશ્શર્વી વાણીનો એહ પ્રોત્સાહી બોલ આયાયો.

શ્વેત વસ્ત્રો સદા ધાર્યાં, પ્રાણુની શ્વેત પાંખ શાં:  
તેજવાધા સજી જણે શિરિસ્તો ડો મનુષ્યમાં.

નન્દ ને નમતા, તહો યે શૈલ શી દફતા હતી;  
ચાલ ધીમી ધીમી, તહો યે અંતથી વેગીલી ગતિ.

હાયે પીતળપણી સ્યામ સીસમલાડાડી :  
બાંધી રાખી શું સંકેલી સેના સેતાનની લહડી !

પૂર્યાં છે કુઃખ ને પાપ મનુષ્યે જગમાં હય,  
પાડયા અન્ધારના પાટા તેજર્વી વિશ્વમાં વડા.

હીકું એ સૈંદી દીધું કાલ, સુધારું સુધરું ય તે;  
પછી સંસારવાડીથી સંકેલી લીધ દર્ધિને.

અહુ વર્ષો સુધી આપે મૂલવ્યાં મોતી અહારનાં,  
પછી પારખવા પેઢા આત્માના દરિયાનમાં.

ધૂમતાં સૈં દિશે તહેને ધાર્યાં એક સમાધિમાં,  
વાળા અજાંડથી ચલ્યું પરોબ્યાં પરમેશ્વરમાં.

વિધિએ ભાગ્યરેખા શું હોરી કુંકું મહેસરે !  
ઉજ્જવળા ભાલમાં એવી રેખા તિલકની તરે.

સિમતની સુ-દરતાના કપોલે અંકુરો ઉભા :  
મધુરાં હાસ્યની દીપે મુખ્યે મધુરી પ્રભા.

આત્માનું તેજ, વીધાને રોમ રોમ, વિકાસનું,  
અજાંડિં ! આપને હેઠે અજાંવર્યસુ વિલાસનું.

વેદ જેવા ભજાલાવ, દેવ શા દિવ્ય કાન્તિના,  
પ્રકાશે પરમાનંદે એવી અખંડ શાન્તિના.

આદ્ય દ્રષ્ટા આ યુગના, કર્વિ છો, સૂત્રકાર છો :  
ને નવજીવન કેરા ઋષિ છો, સમૃતિકાર છો.

ભવિષ્યવેતા, આચાર્ય, પેગભ્યર પ્રભુ તણ્ણા;  
નવીન ગુરુજરાણ્ટ્રો એ ગજની જેણી ધોષણ્ણા.

ભલૂકી અગ્નિ શા આપેવનો ભરમ નથી કીધાં :  
તહે વર્ષા સમા વર્ષા, ચન્દ્ર જેમ સીંચી સુધા.

રહુવારે રહાંજરે જેવો તમે ભાનુ દિને દિને,  
શીળા શીળે તખ્યા તેમ, હાઓયા નહિ કોઈને.

મહામૂલાં દીધાં રત્નો પૂર્વને પૂર્વ કાલમાં,  
પારખી પારખી તેહ સંરક્ષ્યા, માણુની સમા.

ને નવયુગની ભીલે પુણે પુણે વસન્ત આ,  
સંધરી પીમળો સૈની તેહનાં મધ સારવ્યાં.

ધીરગમ્ભીર નેતા, ને દીર્ઘદશી તહમે ધથ્યા,  
સોધી તેથી દક્ષતાથી ધીરે ધીરે સુધારથ્યા :

વિજા ને સંપનાં સૂત્રો, કલાકૌશલ્ય ઓપતાં,  
ને સંસ્થાનસુધારો, ને દેશનાં હિત દીપતાં;

પુણ્યભાવ, સદાચાર, ભક્તિ, ને પરમાર્થ, ને  
સાત્ત્વિક સ્નેહના મન્ત્રો, ધર્માદ્યાર્થ: સર્વ તે.

વધે સંસારની શોલા, મ્રભા ને પ્રભુતા વધે,  
ગાયાં છે દેહાત્માનાં સ્કૃતો ઉત્તિનાં બધે.

રાજ અને પ્રજ કેરેં એક છે હિત, તે લહી  
ઉછેયું એ સદા આપે, શીખ બન્નેયને દ્ધ.

સ્વીકાર્યાં સ્નેહી રાજએ, પ્રજએ પ્રેમી પારખ્યા;  
એ બાંડ અંગના એક, તહમારે તેમ તે સખા.

મતિલા, રાજ્યની આસ્થા, ઉજાજવળી દેશભક્તિની  
મૂર્તિં આપ હતા મેંધી, શ્રદ્ધાની અર્યનાલીની.

પોતાં માનતા શ્રેષ્ઠ, શુભકૃત પરના હતા;  
સારાખી સદા તથી સૌમાંથી સાર શોધતા.

પુરાણા સંપ્રદાયોમાં શુદ્ધ પવિત્ર ને વિલુ,  
પરમ ધર્મ તહમારો તે સ્વામી નારાયણ મલુ.

દેશીઓમાં વશ્યો દેશી થઈ, તેમાં લીધો રસ,  
પરમ ભિત્ર તહમારો જ તે મહાભાવ ક્રાર્થસ.

જે નહાના બાધ હિનુના, છરલામી શ્રીસ્તી પારસી,  
સ્નાન શું સ્નેહ દીધો-લીધો, હૈંડ હૈંડ હસી હસી.

સહખે ધારથી નેમ વર્ષે છે મેધની ઝડી,  
લોકમાં વર્ષાતાં તેમ આપના આત્મનાં અમી.

સિનંદુ મત્યે વહે જેવી ઉર્મિએ નદીએ તણી,  
લોકના હેતનાં પૂર વહેતાં તહેવાં તમો ભણી.

સારપ આશિષો વહેારી જનોમાં શુલ નામના,  
સંચર્યા લઈ સદ્ગ્રાવો આપ અક્ષરધામમાં.

હતાં જીવન ને વાસ સદા મન્દિરછાયમાં,  
આરતી મેરણું દેતી કાવ્યરતોત્રોની આપનાં.

આપે આયુષ્યમધ્યાહૂન ગાળિયો મલુકાર્યમાં;  
અને આયુષ્યની સન્ધ્યા ગાળી ગાતાં મલુલીલા.

હેઠના સુરથે સ્થાપી હેઠી કેરો મહારથી,  
ધન્દિયોના અખંડોડી, લગ્નામે વત્તિની ગુંથી;

વિવેક સારથી માંડી, અખંડ પ્રલુની દિરો,  
તુમે કીધી મહાયાત્રા વિશ્વના વિષયો વિરો.

નિત્યે જીવનમાં યોગી, તત્ત્વચિન્તક ચિન્તને,  
શાખા સંસારી સંસારે, તપસ્વી જ તપોવને;

લક્ષ્મિદેરો મહાબહૃત, ઝૂંપળો ભાવની કુંળા :  
આપને આંબલે એમ ડાળાએ સૈંચા ઝળી ઝૂલી.

શું શું સંભારં ? ને શી શી પૂજા પુષ્યવિભૂતિ યે ?  
પુષ્યાત્માનાં જાંદાણો તો આલ જેવાં અગાધ છે.

## ૪

ને એવું યે હતું જરૂરો પડયો'તો પિતૃભાવથી,  
વીસારી પિતૃપૂજા હું ખડયો'તો પુષ્યદહાવથી.

બહૂ અવગણ્યા, તાત ! અસતકાર્યા, અનાદર્યા;  
ને અપમાનને ગારે આ હાથે હેવ અર્થ્યા.

ખીજવ્યા, પજવ્યા પૂરા, ઝૂમળું હિલ કાપિયુ ;  
ને તહમારા હિનો છેક્ષા ઓર કીધા : સહુ ગયું.

અયો તે યુગ મર્સ્તીનો, ઝાંઝાવાતો ગયા બધા;  
આપના ભૂત્યુંએ, તાત ! આણાં નીર જાંડાં કીધાં.

પામની મોહિની યેઘે, ન તહે ચે મોઢ પામતા,  
પુરાણી ને પુષ્યવન્તી આયોની એ જ આર્યતા.

જન્મની વેળને આપે સંચીતી મુજ અન્તરે,  
નિભાવ્યો આર્યતાએ એ, ને બચાવ્યો પ્રલુબરે.

અમે છે આ અહેં આદે, કોઈ તહે ચે નહીં પડે :  
ન છૂટે દાંડિથી, જો કે વીંજણું રમણે રહેઠે.

રમીને ને ભરીને હું આવ્યો છું આપ છાયમાં :  
હેણે એ છાંયડી શીળી, દીધી છે જેમ કાય આ.

સૌ અળવીતરાંની એ ક્ષમાએ તાત ! આપણે :  
ન જેશા માટીને, હેવા ! માનજે પંક પંકણે.

#### ૫

અ-ધારી રાત્રિએ ઊંડા શખ્દ હેં અન્ધકારના,  
ઓદે છે ઉરમાં એવા શખ્દ ડો ભૂત કાલના.

ડોદાવેં આત્મની જ્યોત અંજાનિલો સમૃતિ તથા,  
પ્રયંડ મોને ઉછળે એ અવિરામ ધોષથા.

અદીકા સિન્ધુની આને ગર્જના ક્ષિતિને તરી,  
ગર્જે છે પડ્છના ડો એવા અન્તરુંહા જરી.

ધોરે જેવો મહાધોરે ધેરો તોદાનનો ધ્વનિ,  
સમસ્ત જીવન કરો ધોરે એવો મહાધ્વનિ.

અને એ સમૃતિના ઉમ્રી, પડ્ધા ભૂત કાલના,  
ને બધા મુંજવે એવા ખોલ ને સુજ બાલ્યના :

તે સૈંમાં તરતો, જણે અન્દમા વ્યોમને જલે,  
સુષ્પયો, આકાશવાણી શા, શાન્તિનો શખદ એક રહેં.

શમાવે પ્રભુના શખદો આ ડોહાહલ વિશ્વનો,  
એ શખદે એમ રહારો યે શખ્યો પોકાર ઉરનો.

વર્ષી માધુયું દેવેનું, અન્ધકાર ઉજળતો,  
પુરાણું યે યુગોને એ ઓળંગી શખદ આવતો.

જ્યોતસ્નાની ધારમાં જેવો લર્યો મન્ત્ર સુધાર્ય,  
એવો ગેણી સુષ્પયો : મન્ત્ર, પિતૃદેવો ભવ, પ્રિય !

## ૬

અધૂરી હા ! અધૂરી છે એટલી એકલી ગડચા :  
અડે લે ધરતી માતા, જલે માર્દ હો ઉંચા.

નથી આશા વિના આયુ, નથી ડાળી વિના ફૂલ;  
નથી પૃથ્વી વિના પાયો, નથી માતા વિના કુલ.

હજી તો આલમાં રહારા બાળુડો સૂર્ય ઉગતો,  
બાળુડા ખોલનો ખોળો કાલો કલ્લોલ જમતો;

દીડો કે ન દીડો રહેં તે, સુષ્પયો કે ન સુષ્પયો કંધ,  
સંકેલી દેહની માયા વન્દીને વિશ્વને ગઢ.

વીતિયાં રહાંજ ને વહાણ્યાં તે પક્ષી બહુ વર્ષનાં;  
ભૂલ્યો નથી હજ, માતા ! હાસ્ય તે તુજ હર્ષનાં.

આલના વણુંથી આંજ વિશાળી તુજ આંખડી,  
આલના બેદમાં જેતી દષ્ટિ તે તાહરી વડી.

ભરેલા ભાવથી અંગે ડેાલતી કુલહાચિણી;  
ગૃહિણી ગુણવન્તી તું, મહોટે ચાંદલે સુહાગિણી.

સાદી શોભાથી શોભાતી, ધર્માંલી કુલધામની;  
શામળે રંગ રંગેલી સેવિકા ધનશ્યામની.

પ્રારંભેદી, પુણ્યશાળી, ને પાપપાવનકારિણી :  
ધૈર્યંગામભીયંથી ધીંગી, દેવિ ! તું દુઃખહારિણી.

હેતવાતસલ્યનાં ઠેણે હૈયાતું પૂર ગાજતું :  
ધર્મભૂતિંપિતા મહારા, ભક્તિની ભૂતિંમાત ! તું

સદ્ગ્રાહીનીની, ને સ્વામી [સેવા પરાયણુ;  
પ્રતાળી, શાન્તિથી શીળી : એ જ તહારાં રસાયન.

નથી એ વીસર્યો તહારી દૂંકી જીવનની કલા :  
વીસારી વીસરે કેમ માતૃવાતસલ્યની લીલા ?

દૂધથી તાહરા તહેં ને સીંચા'તી માણુમાં સુધા,  
નથી તે ઓસરી, માતા ! વાધી ઉમ્રી અનેકધા.

ગુજરી વાડીમાં એક નદી રેવા અનુતમ :  
 ગુજરી વાડીમાં તેમ માત રેવા અનુતમ.  
 ઓ અભિજાત આર્યા ! ઓ આર્યો સહુ બોમના !  
 સુણો આ વેદની ગાથા, મન્ત્ર આ પુર જોમના :  
 પિતુરેવો ભવ, "પ્રાજ્ઞ ! માતુરેવો ભવ, પ્રિય !  
 સવે કુલાશમે। નિત્યે હંજે એ ભાવનામય.

## ૭

વિશાળી દુનિયા વીંઠી ધૂમે છે સિંહુ ગજ્ઝતો,  
 તે સિંહુનાં ઊડાં નીરે ભુક્ષતાપુંજ વિરાજતો :  
 ઘરીને પૃથિવની પાળા પડી છે આલની ધટા,  
 અહોરાત્ર તપે તહેમાં તેજના જોલની છટા :  
 બાંધી અલાંડની ઝાડી તે રીતે અલ રોલિયો,  
 ને અલજ્યોતિમા નિત્યે મફાશે ; પુણ્યશાળીઓ。  
 પામને તે અલજ્યોતિ, અલનાં તેજ ઝીલતાં,  
 ખીલે છે પુણ્યને પુણે માહરાં માત ને પિતા.

## ૮

ગુણ્યાળી ગવરી માતા ! પૂજ્ય અલખિં ઓ પિતા !  
 ખરં છું ચરણે તે આ સ્વીકારો ગુજરી ગીતા.  
 સૌ ઉપનિષદો કેરા ભાવ શી આપ જંદગી,  
 ને ઉપનિષદોના સૌ સાર શી આ ગીતા ઝગી.

એ જ સંવત્સરી આજે, થયા હેવ મનુ મરી :  
પાળું છું પર્વ, પૂજાં છું ગુણું તાત ! રડી રડી.

અરી અંજલિ અશરી કરું છું આ હું અપર્ખું;  
સતકારો સ્નેહની સેવા, પુત્રનું પિતૃતપ્રખું.

અમોલાં બહુ યે રતનો શાસ્વરતનાકરે તરે;  
વીણુંને એક મેંઘેં પુત્ર આ પાવલે ધરે.

સદા યે રીજવી આપે સેવી હેવી સરસ્વતી;  
આપના પુણ્યથી એહ આ ને આવી થતી કૃતિ.

તો ભૂલી ભૂતની ભૂલો, ભાગીને લક્ષ્ય ભાવિનો,  
અમીની આશિષે આપો, ઇલે સહભાવ સુતનો.

પૂર્વે ને ભાવથી આપે વધાયો જન્મ માહરો,  
આ પરે યે, પિતામાતા ! દાછિ તે ભાવની કરો।

( ૧૬ )

## મહર્ષિ દ્વાનન્દ સરસ્વતી



કાંધ એક સુજનભૂતું દેવાલય હોય, ને તેણા માચીન ખડેરમાંનો જગતજગાડતો ધંટારવ સુષુપ્ત થયો હોય, એવા લાકવિસારાયેલા દેવમંદિરે ડો મહાસંન્યાસી પધારે, પોતાના સર્વસામથ્યથી ધંટાનાદ ગળવે, અને એમ સૈકાઓથી આથમેલા દેવપૂજનનો પુનરુક્ષાર થાયઃ એવું દેવાલય તે ભારતવર્ષ, એવા જગતજગાડતો ધંટાનાદ તે વેદટંકાર, ને એવા મહાસંન્યાસી તે મહર્ષિ દ્વાનન્દ સરસ્વતી.

હાંગાની કુંગરમાળમાં આડીઅવળી વહી કાહીઓના બામણુઓરના પુરાણુા કુંગરી કિલ્લાના ચરણું ચુગણી મચ્છુ નદી હાલારના સપાટ પ્રહેરામાં જ્યાં બહાર નીકળે છે તેહાંથી નણચારેક ગાઉ પચ્છિમે કુંગરમાળની નાસિકા જેવું શિખરશાગનું નહાનકું અણીઅય છે. એ નાસિકાઅની ઉંચાઈ તો માત્ર ૪૦૦-૫૦૦ પુટની જ છે, પણ એ નહાના શિખરનો મહિમા, તેણી ઉપર વિરાજતા જરૂરી મહાદેવના શિવમંદિરને લીધે, સારા યે હાલાર માંતમાં તો ગિરનાર જેટલો મહાન

છે. જરૂરે કૃતિશીલાનું ચારેક ગાઉ ઉપર લાલા મહારાજની જરૂરી ભીષ્મમાં પંચદારિકાનું તીર્થ છે; ને આશરે અઢીક ગાઉ પશ્મિમે મહર્ષિશ્રીનું જરૂરસ્થાન જીવાપર, અને તેણાંથી દોઢેક ગાઉ વાયવ્યમાં તેમી નદીને કાંઠે ટંકારાનું કરસ્યાતી ગામ છે. જરૂરે કૃતિશીલાનું શિવાલયનો જરૂરોધાર કાહિયાવાડના ધતિહાસમાં મશ્હૂર એક અદભુત કાદમ્બરીના નાયક સરિખડ જીવનવૃત્તાન્તવન્તા સુંદર સોદાગરે ઝીઘેણે હતો, ને મહર્ષિશ્રીના વહિલો પણ તેમના જ આશ્રિતો તરીકે જેડિયા પાસે કર્યાના અખાતને કિનારેથી ટંકારા ને જીવાપરમાં આવી વસેલા હતા. મહર્ષિના જરૂરસમયમાં એ ટંકારા મહાલ વડોદરાના મહેરાળ કુદુંખમાં ગીરો મૂકાયેલો હતો. ટંકારા પાસે તેમી નદીને કાંઠે આજે ચે કંઈક રળિયામણો ને મહોદી વૃક્ષોથી શોભીતો છે. તે વખતે ટંકારા ને જીવાપર વર્ચ્યે વાડીઓની ઘટાઓ હતી. ધ. સ. ૧૮૬૬ માં આ લેખક ટંકારા પહેલવહેલું નેથું હતું તેણારે એ મહાલનું મથક આજનાથી વધારે હરિયાળું, તેમીના કાંઠા વધારે ફળજુપ, ને વસ્તી વધારે વિદ્ધાવન્તી ને રિદ્ધિવન્તી હતી. કહે છે કે મહર્ષિના સમયમાં મોરણીના ફોકેર સાહેબ પણ વરસમાં ડેટલાક માસ તેણાં વિરાજતા. કાહિયાવાડમાંના ધણ્ણાખરા ગામડાંઓની પેઠે ટંકારાની મુદ્રા આજે તો તજુ દેવાયેલા જેવી. અજાનઅન્ધકારમાં પડેલી, રિદ્ધિસિદ્ધ હરાયેલી, પ્રભાજાંખી છે. ટંકારાના વિદ્ધાન આલણો આજ સૂધી કાહિયાવાડમાં ફરતા, ને કલ્યાણુકારી વેદમંત્રોથી આ લેખકનું ધરે પાવન કરી જતા. હવે પછી તેમના વંશજો

વિદ્યાનો એ વારસો સાચવશે કે કેમ એ શંકારપદ છે. કુંગર-માળની જાલરના કાંઠાની હરિયાળી ઘટાએ. વાળી વિદ્યાવન્તી રિષ્ટ્રિવન્તી તીર્થેથી વિંટળાયેલી ભૂમિમાં મહિંજીનો પુણ્ય-જ્ઞન થયો હતો. આજે પણ ટંકારાના દરખારગઢમાં મહિંજીના પિતા કરસનજી મહારાજની ધોડાહાર જરાસુ મુસા-ઇરને દાખવાય છે. આજે પણ જડેશ્વરના શિવાલયમાં આવ-છુની શિવતિથિએ. ને મહાશિવરાત્રીનાં શિવપરવ મનોદ્વારા આલાણેાના કલ્યાણધ્વનિ સાથે ઉજવાય છે. એ કુંગરનું શિખરે છે, ને એ ડેમાના લરેલા કાંઠા યે છે; પણ એ હરિયાળી ઘટાએ વિભરાણી છે, અને આજના એ વિભેરાયેલા વૃક્ષોમાં એ મોરલો ટહુકારતો નથી.

ગૃહત્યાગ પછી કેટલાં યે વર્ષો સૂધી: મૂળજ અલયારી તીર્થેમાં ઇર્યા, ને વિદ્યાભ્યાસ કીધો; પણ એ પરમ દર્શન ન પામ્યા ને આત્મતૃપ્તિ ન થાય. અન્તે હિમાલયના જમણા ને ડાબા નેત્રોમાંથી અખંડ વહૃતી જ્યોતિધારાએ. સમી જમનાગંગાને કાંઠે વિરજનનંદ સ્વામીના મહમાં વિશ્રામ લીધો. તીર્થેમાં શોધતાં શોધતાં ત્રણાં પ્રગાચ્યક્ષુ ગુરુદેવ મળ્યા, ને પરમ પ્રગા પામ્યે જવાપરના મૂળજ અલયારીનો વિશ્વવિષ્યાત ભારતભૂષણુ સ્વામી દ્યાનનંદ સરસ્વતી રૂપે ત્રણાં અલજ્ઞન્મ થયો. એવા ગુરુ વિરલા હોય, એવા શિષ્ય એથી એ મહાવિરલા હોય. શ્રીમહાલાગવત કહે છે કે શ્રી કૃષ્ણાયન્દે નિજ ગુરુદેવ સાંહિપત્તી ઋષિને ગુરુદ્વિજિગુમાં ગુરુપુત્રને સજીવન કરી આપી ગુરુદંપતીનું વિદ્યાનંદ વાળ્યું

હતું. મહાર્ષિ દ્વારાનંદ સરસ્વતીને ગુરુદેવનો આદેશ મળ્યો. હતો કે ભરતખંડમાં ઘેરેઘેર વેદધ્વનિ જગાડવા ને પ્રસારવા. એ ગુરુદેવને એ ગુરુદક્ષિણા માગીઃ એ શિષ્યરાજે એ જીવન મન્ત્ર કીધ્યો, ને એમ વિદ્યાન્તરણ વાળ્યાંઃ ને આજે જગતમાંતી માચીનમાં માચીન એ શાનધંટાનો મહાધૈષ ભારતવર્ષમાં ઠામ ઠામ ગાળ રહ્યો છે. સુકાદ ગયેલી વેદ-ગંગા આયાર્વત્તની પુણ્યભૂમિમાં પાછી વહેવડાવનાર વર્તમાન લગીરથ તો સ્વામી દ્વારાનંદ સરસ્વતી.

જન્મભૂમિમાં જ જીવનનો એ શાનસત્ર આરંભવાની મહાલાવનાથી મહર્ષિજુએ કાડિયાવાડ ભણી પગલાં વાળ્યાં, ને રાજકોટમાં માસેક મુકામ રથાપ્યો. યા નિશા સર્વે ભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી એ ન્યાય પાળી એક રાત્રીએ રાજકોટમાંથી વિચરી વતનની યાત્રા યે કરી આવ્યાની લોકવાયડા છે. એટલો મોહ એ મહાસંન્યાસીને યે રહ્યો. હતો, પણ મુંબદ્ધ જદુ આવ્યા પછી તે નિર્મૂર્ણ થયો. ગુજરાત તો ગુજરાતનું છડા સૈકા પછીનું સંસ્થાન છે: ગુજરાતની આદ્યભૂમિ તો પંચનન્દની ભૂમિ: તક્ષણિલાની વિદ્યાપીઠની ભૂમિ તો પંચનન્દની ભૂમિ: ભારતવર્ષમાં વેદ મન્ત્રાથી પથમ પાવન થયેલી ભૂમિ તો પંચનન્દની ભૂમિ. એ પુણ્યભૂમિ, એ નરકેસરીઓની ભૂમિ, ગુજરાતના માચીન વતનની એ પંચનન્દની ભૂમિ, ભરતખંડના એ વાયવ્ય દરવાજના ચોક ભણી મહર્ષિજુએ પગલાં કોધાં, વિનદ્વાટ-ની ઉત્તરે સારા યે આયાર્વત્તમાં શાનજવાલાએ,

મગટાવતા મહિંજુ ધૂમતા પણ Militant Hinduism-  
ના સેનાખિપતિ એ મહાસંન્યાસીના તેરાતણું તો ઐડાયલા  
હતા પંચસિન્ધુના પુષ્યજલોથી પાવન થયેલા કિનારાએ  
ઉપર.

અન્તે એ ધર્મવીરની જીવનયાત્રા પૂરી થઈ: રાત્રીનાં  
વાદળ ઘેરાયાં, ને અનન્તના પડા પાછળ એ મહાસંન્યાસી  
વિરામ્યો. ચહુવાણું રાજ્યવંશના અસ્ત સાથે ભારતવર્ષમાંથી  
હિન્દુ રાજ્યનો ભાસ્કર આથ્યો. હતોઃ ચહુવાણું રાજ્યવંશના  
પાટનગર તારાગઢની છાયામાં આય્તવનો આ સંન્યસ્ત-  
ભાસ્કર આથ્યો. હિન્દ્વા સૂરજને ગાયત્રી મન્ત્રના વરેષ્ય  
અર્ગનું વર્ચસ્ ઉદ્ઘેષી, મહારાણા ઉદ્યસિંહના પાટનગરે  
ભીરુત્વમાં વીરત્વ પૂરી, મહિંજુ જોધપુરમાં પધાર્યા, ને  
એ મરુ ભૂમિમાં એ વેદસહકાર સૂકાધને દળી પડ્યો. એ  
રખુમદેશમાં તો ગંગાએ યે સૂકાધ જાય, ને એ વેદગંગા યે  
સૂકાધ ધરીત્રીમાં સમાધ. જોધાણુનાથને આય્ખમોંપહેસ  
ઉદ્ઘેષ્ઠતાં તેમના ભાઈ મહારાજ સર પ્રતાપસિંહજીના  
ઉદ્ઘાનમાં મહિંજુએ નિવાસ ઝોંધો હતો. એ રાજ્યવાડીમાં  
એક રહ્યવારે સહવારના દ્વાધમાશનમાં રસોાધાએ વિષદાન  
દીધું. લોકવાયડા એવી છે કે જોધાણુનાથને નાયકાએના  
બહિકારના સ્વામીજીના ધર્મસૂચનથી નભીજન નામની એક  
નાયકિષુંએ રસોાધાને એ અપૃત્ય કાને સાધ્યો. હતો.  
પણ એ લોકવાયડા સાખિત થઈ નથી, ને જોધપુર રાજ્ય  
તરફથી નની જનને એ આરોપ સર કાંધ શિક્ષા થયાનું

જગતની જાણમાં નથી. આજ-મ અહિયારી સ્વામીજી એ વિષ જીર્વવા ધાણું મર્યા, પણ મારવાડના સંતમ દેશમાં અ-તે તે ફૂટી નીકળ્યું. મર્મલેદી બાણુ વાગ્યા પછી યે ભીજમ પિતામહ બાણુશયા ઉપર ડેટલોક કાળ મૃત્યુને ખાળી રહ્યા હતા, તેમ નૈષિક અહિયારી સ્વામીજીએ પણ વિષદાન :પછી ડેટલોક દિવસો સુધી રોગશયાને સેવી. આણુના શીતળ શિખરે અહિબી' વિશિષ્ટજીને ખોળે કાંધક શાન્તિ વરતાણી, તેણાં તો એ દિવસમાં તારથી દાકતરની અજમેર બદલી થઈ. દાકતરે રાજુનાસું આપ્યું તે નામંજૂર થયું. જે દાકટરના ઉપયારથી આરામ વતાઈતો હતો. તહેની સાથે સ્વામીજી પણ અખૂર્દાચળથી ઉતરી અજમેર પથાયા. તેણાં, ચહુવાણેાના અચળ કૃતિસ્થંભ સરિખડા તારાગઢની છાયામાં અન-તનાં આમ-નણું સ્વીકારી જીવનલીલા સંકેતી લાધ લારતવર્ષનું ભાગ્ય ભાવિને સોંપી અનસ્ત સમાધિમાં સ્વામીજી પોઢ્યા.

હિન્દુસ્તાનમાં ધરધરમાં દેવપૂજા હોય છે, પણ તે ધર્મવીરાની ધર્મપૂજા હોય છે. ઝા-સમાં નેપોલિયન, ને ઇંગ્લાંડમાં નેલ્સન ને વેલિંગ્ટન, જર્મનીમાં બિર્માક' ને મેસ્ટરકેની મૂર્તિસ્થાપનાએ છે, પણ હિન્દમાં ગાંડીનધન્વા કે ભીજમ પિતામહ, મહારાણા કુલતિલક શિવાજી કે મહારાણા પ્રતાપની પૂજામનિદરે મૂર્તિપ્રતિજ્ઞા જાણી નથી. અન્ય દેશાની મૂર્તિપૂજથી નિરાળી હિન્દની મૂર્તિપૂજા ધર્મપૂજા છે. ગુરુ નાનકને શીખસંધ પૂજે છે, સૂરજકુલભૂપણું રધુવીરને

સાહેં હિન્દુ પૂજે છે: તે ત્હેમના વીરત્વને લીધે નહીં, પણ ત્હેમના ધર્મત્વને લીધે. સ્વામી ધ્યાનન્દ સરસ્વતીમાં એક મહાપીરને શોભે એવી વીરતા હતી, મહારાજયના ડેંડિલિંગ મહામંત્રીને શોભે એવી દીર્ઘદ્રષ્ટિ હતી, રણ્ણસંઅમ્રમાં સેનાધિપતિને શોભે એવી કાર્યદક્ષતા હતી, પંડિતોની મહાસભામાં ડેંડિલિંગ મહાપંડિતને શોભે એવું અગાધ પાંડિલિંગ હતું. મહર્ષિજીના એ વીરત્વ ડેંડિલિંગ રાજમન્ત્ર કે કાર્યદક્ષતા ડેંડિલિંગ વિસમરણ નથી, વિસમરી શકે પણ નહીં. પણ સ્વામીજીના સદ્ધર્મના સનાતન સાધુઓંશોને ભારતવર્ષ આજે પૂજે છે, ને ભાવિષ્યમાં પૂજશે. એમનું અખંડ અનુચર્ય, પરમ સાધુતા, બીજમ સંન્યાસ, અવિરત ધર્મપરાયણુતા, કઠોર જેવી લાગતી સલનિધા, આર્યવિર્તના પુનરૂક્તારની અવિરત શ્રક્ષા, ને સૂકાદ્ધ ગયેલાં વેદગંગાનાં મહાવહેણું પાછાં સળવન કરી પુનરપિએકદા એ પુષ્યોદકે ભારતવર્ષને ધર્મપાવન કરવો: આજે ભરતખંડ એમના એ ધર્માંશોને પૂજે છે. પતિત હિન્દુને પુરાતન આર્ય ઝીધો, ધર્મ-રખલિત હિન્દુસ્તાનને સનાતન આર્યવિર્ત કરી સ્થાપ્યો: એ સનાતન આર્યત્વના ઉત્થાપનની વેદાંકારકારી મહાધંટા ઇપે જ આજે ભારતવાસીઓ મહર્ષિજીને સંભારે છે, અને ધર્તિહાસ દ્વે પણી સંભારશે. સદા યે સ્વામીજી તો સાર્વયા સનાતની જ હતી.

કોઢ કોઢ વેળા ડેટલાકને નિરાશાની ધડીઓમાં થાંકા આવ છે કે હિન્દમાં પદ્ધિમની સંસ્કૃતિના સંચરણ-વિસ્તરરણુથી

આ દેશમાંથી સંન્યસ્તાઅમ નાથ પામ્યો છે: જનક વિહેણીનું ગૃહસ્થસંન્યાસીનું એ આદર્શ રાનપોથીએમાં જ પ્રકાશી રહ્યું છે, સંસારના શિખરો ઉપર નથી ઝગળું. હિન્દનો વર્તમાન ધતિહાસ કે છેલ્લાં શીતેર વર્ષેની હિન્દની સંન્યસ્તાકથા જાણ્યા—વિચારા વિનાતી એ શાંકા છે. : ‘અનુભવીએ એકલું આનન્દમાં રહેણું રે’ એમ સહાસર્વદા પરમાનન્દમાં જ વિહરતા શ્રી રામકૃષ્ણ પરમહંસ, આયોના પ્રાચીન આર્થિકાની તુમુલનાદવન્તી વેદગર્જના ગજવતા મહર્ષિ દ્વારાનન્દ સરસ્વતી, એ આર્થિકાનો સનાતન સનદેશ સમગ્ર વિશ્વની ધર્મમહાસલામાં જગતને જીવાવતા સ્વામી વિવેકાનન્દ, પરમ અદ્વૈતનો મન્ત્રોચ્ચાર અનુભવતા ને ઉચ્ચારતા સ્વામી રામતીર્થ, આયોની ગુરુકુલભાવનાને સંજીવિની છાંટી સઞ્ચિતનકર્તા કુલપતિ સ્વામી શ્રદ્ધાનન્દજી: છેલ્લાં શીતેર વર્ષેમાં આવા સમર્થ ગહાસંન્યાસીએની પરંપરા જે મહાલાગ દેશમાં જ મી એ એ પુણ્યભૂમિમાંથી સંન્યસ્તાઅમ અસ્ત પામ્યો છે કહેનારને વર્તમાન ધતિહાસની આંખ જ નથી. સાધુવર ડેશવ ચન્દ સેન ને મહાત્મા મોહનદાસ ગાંધી જેવા ગૃહસ્થસંન્યાસીએની ભૂમિમાં આજે એ જનક વિહેણીનું જીવન્સુક્રતોનું આદર્શ ને જીવન્સુક્રિતની પરમ ભાવના ધર્માંથોમાં જ ડેવળ નથી પ્રકાશતી, પણ સંસારનાં સિંહાસનોમાં એ ઝગળે છે. ભરતખંડના લાગ્ય હજુ સદનતરનાં ભૂસાયાં નથી, શકુનતલાના મહાપરાક્રમી પુત્રનાં પુણ્યો હજુ સકલ પરવાર્યાં નથી. પૃથ્વીના ડોધ પણ હેશને કે ધતિહાસના ડોધ પણ યુગને શોભાવે એવો સંન્યાસ,

એવી ધર્મપરાયણુતા, એવા ચારિત્રણ્યોતિ આજે ચે  
હિન્દુસ્તાનમાં મકારો છે. આર્યત્વની, આયોંના જોરવની  
સારા યે ભારતવર્ષમાં ને જીવનભાવના સંજીવન થઈ છે  
એને સંજીવનનાં પહેલાં જલ છાંટનાર ભરતખંડના અં  
યુગના મહાદ્વારા તો મહાબિં દ્વારાનંદ સરસ્વતી. સકળ  
ગુણુઆહક ભારતવાસીઓ તો આર્યત્વની સંજીવિની યુદ્ધીના  
મહાયોગીને મહાસંન્યાસી તરીકે જીયુગના યુગ સૂધી  
ગુજરાતના એ મહાત્માને સંભારશે ને વન્દશો.

---

( ૧૭ )

## ગુજરાતનો તપસ્વી



મુનિદોમાં પચ્ચાસ દીપમાળા પ્રગટાવો,  
 પચ્ચાસ પચ્ચાસ આરતીએ ઉત્તરાવો,  
 પચ્ચાસ પચ્ચાસ દેવધંટા વગડાવો,  
 આને પચ્ચાસ વર્ષેનો ઉત્સવ છે.

અને એ કાણુ છે એવો ?  
 જાણુ ડોધક જગતભૂખ્યો,  
 જાણુ ડોધક વિશ્વતરશ્યો,  
 જાણુ સદાનો અપવાસી :  
 એ કાણુ છે એવોંક ?  
 લોકવન્ધ ને સર્વપૂજય ?  
 સુદામાનો જાણુ ડો સહોદર ?

એવાને કાને આયુષ્ય નથી.  
 આનન્દો, આનન્દધંટા વગાડો.  
 આને પચ્ચાસ વર્ષેનો ઉત્સવ છે.

એ માનવસળેકહું છે શું ?  
 સળેકડારી યે રેખાપાતળું  
 એ કિરણ છે મહાસ્થ્રયું—  
 અડગ અને અભ્યય,  
 અખંડ અને અપ્રમેય.

એ તપસ્ની છે  
 સાખ્રમતીના બંચા કિનારાનો :  
 રિદ્ધિવન્તા રાજનગરની હવેલીઓનો  
 એ યોગીન્દ્ર છે અવધૃત.  
 એ તો સંસારી સાધુ છે;  
 ગૃહસ્થ થછ સંન્યાસ પાળે છે.  
 નિરન્તર દુઃખને નહોતરતો  
 એરિયાના એક મહાયોગીન્દ્ર દ્રશ્યતો  
 એ.અનુજ છે નહાનકડો.  
 પરપીડા પ્રીણી પ્રજળનાર  
 મહાવૈષ્ણવેનો એ વંશજ છે:  
 શ્રીનગરનો જાણે નરસિંહ મહેતો.  
 હૈયામાં એના હોળી સળગે છે,  
 જવલન્ત અંગારા જેવી છે એની આંખડીઓ,  
 વદને વિરાન્જેલી છે વિધાદ્ધાયા.  
 દેશની દાઝથી દાઝે છે  
 છણુછણુની એની દેહલતા.  
 વિરાધીઓ પ્રતિ યે પ્રેમાદો,

શઠ પ્રત્યપિ સત્યમુ એધનાર,  
 ‘અન્યાય સહામે યે ઉગામ ભા’ નો અનુયાયી,  
 ‘દેહથી દેહી જ્યવન્તો છે’ નો આયરનાર,  
 દુઃખતપતી આ દુનિયાનો દરવેશ છે તે.

—એકદા એનો આજાડકો વાગ્યો,  
 ન નિઃશબ્દ નરનાર ને બાલકોની,  
 ચાર હજર દુઃખસજ્જેતી મેના  
 દ્રાન્સવાલને હૃમલે ચાલી.

આશ્ર્યચક્ષિત જગત નિરખી રહ્યું  
 જગતના છતિહાસમાં અદ્વિતીય  
 દૂભાયેલાં : ચાર હજરની તે હૃદય.  
 મોખરે હતો તે સેનાધિપતિ:  
 સિંહને શબ્દ ન હોય,  
 ને ન હતાં તે નરકેસરીને.

પણી તો વર્ષો વીતી ગયાં:  
 રાત્રિદ્વિસના ઓછાયા ઉંઘા ને આથમ્યા.

છતિહાસમાં અપૂર્વ છેલ્લા જગસંઆમમાં  
 મહમલપતી જર્મન મહાપ્રણની  
 છેલ્લી ભારતીનો જુવાળ ચહુડ્યો,  
 જાણુ પ્રલયની મેઘાવલિ.  
 દિશામંડલ ડોલવા લાગ્યુ,  
 ધરતી ધણુધણુવા માંડી,  
 ગીધ સરીખડાં વિમાના॥

વાતાવરણું લેદી ઉડી રહ્યાં:  
 ભયંકર તોપોની ભીષણું ગજનાથી  
 નબોમંડલ ગડગડી ઉઠ્યું.  
 ચિન્તાચિકિત નયને સૈા નિરખતું  
 કે શું થાય છે, ને શું થશે.  
 જગતે ન જેધેલું,  
 પૃથ્વીએ ન પ્રીછેલું,  
 માનવકથાએ ન નોંધેલું,  
 મનુકુલનાં કાવ્યોમાં ન કદેલું,  
 ગ્રચંડ મહાભારત મંડાણું  
 ભૂગોળની સર્વ મહાપ્રણાયોનું.  
 જવાલામુખીની મહાન્યાલાનો છેલ્દો લભૂડો  
 લભૂક્તો હતો યૂરોપના જગરણુમાં,  
 તેણારે રાજરાજેન્દ્રનો સન્દેશ આવ્યો,  
 ને રાજમતિનિધિ મહાસૂખાએ  
 રાવરાણું ને મહાજનોની  
 આમન્ત્રી પ્રણમહાસલા યુદ્ધમન્ત્રણુને કાજ.  
 મહારાજ્યોની પ્રાચીનમાં પ્રાચીન પાટનગરીમાં  
 જનમી વળી એકદા  
 એ યુદ્ધમન્ત્રણુની મહાસલા.  
 તેણારે તેણે તોડ્યાં તેણાં મહાપ્રત.  
 સાઓન્યની કટોકટીને વિષમ પ્રસંગે  
 નિઃશબ્દવાદી તે તપસ્વીએ

ઉચ્ચારી છે શબ્દ સજવાની રણઠાકલ,  
વગાડ્યો છે મહાધોપ સંઅમશંખ.  
જગદ્ગુર કૃષ્ણયન્દે યે, મહાતમન!  
શબ્દ સજ્યાં હતાં એકદા કુર્ક્ષેત્રમાં,  
એકદા તોડ્યાં હતાં નિઃશબ્દતાનાં પ્રત.  
હસ્તિનાપુરની યુદ્ધમન્ત્રણાની એ મહાસલામાં  
કેવો શોભતો હતો તે તપસ્વી ?  
જાળે વિષણુસલાની વર્ચ્યે હુલકુમાર,  
જાળે યદુપુરીના સિંહાસનોમાં સુદામો.

જીવનાદેશ શાધવામાં ઘલબિં,  
રણખેલનામાં સુલટ ક્ષત્રિય વીર,  
નીતિમન્ત્રણામાં સુર વૈશ્વવર,  
લોકસેવાલાવમાં પરમ શક્તઃ  
તહેનામાં સૌ વણ્ણ સમાયેલા છે.  
વેળુકણીના તે ભણ્ણ રચ્યે છે,  
પત્થરના તે દેવ પ્રગટે છે,  
શાલ્યાની તે અહલ્યાઓ કરે છે,  
અસાધુના તે સાધુ ધરે છે,  
અહંકારીના તે સમર્પણી બનાવે છે.  
હુઃખ્યાંનો ઐલી ને વિસામો,  
દાયાંના અન્તરનો આરામ,  
ધાયલના આત્માનો અમૃતૈપથિ:  
અનારોગ્યનો ધનવન્તરી છે તે.

વાદળાંની અધ્રુવ છાયાકૂદીમાં  
 એક એ ધ્રુવ તરવઃ  
 ધતિહાસમાં ઉચ્ચચારાતો  
 સનાતન સલનો એ શબ્દ,  
 માચીનતાનો પરમ મન્ત્ર :  
 નવામાં નવો તે,  
 ને જૂનામાં જૂનો છે.  
 સલ તહેનો મુદ્રામન્ત્ર છે,  
 તપ તહેનું કવચ છે,  
 અલગ્યેર્ણો તહેનો ધ્વજ છે,  
 અખૂટ ક્ષમાજલ તહેને કમંડલે છે,  
 સહનશીલતાની તહેની ત્વચા છે.  
 સનાતન યોગીકુલનો યોગવારસ,  
 રાગ્રેષના ઝંઝાનિલથી પર,  
 ભારતનો વર્ત્માન મહાગુરુ,  
 એ તો શુજરાતનો તપસી  
 અહૃતમા મોહનદાસ ગાંધી. ✓

એવાને કાને આયુષ્ય નથી.  
 વિદ્યાના એપરવા કાને વિદ્યા નથી,  
 લક્ષ્મીના એપરવા કાને લક્ષ્મી નથી,  
 આયુષ્યના એપરવા કાને આયુષ્ય નથી.  
 આનન્દો, રે આનન્દો, નરનાર !  
 આને પચ્ચાસ વર્ષોનો ઉત્સવ છે

ન યોગીન્દ્ર ! સમૂર.

તહારા સમૃદ્ધ આત્મભંડાર

ભર્યાભર્યા ઉધાડ, ને પારખ.

અનન્ત આકાશના અન્તપ્રેટ

વીધિને વિચર, ને લીતર નિહાળ.

કુઃખમાં, પાપમાં, અન્ધકારમાં યે

અલકિરણુ જ વિરાજમાન છે.

તહારે હૈયે છે યરાકુંડના હુતાશ:

એ અજિત નહીં, એ ગુરો !

પણ તહેના પ્રકાશ મગટાવ

આત્મનાઅત્મનના અમૃતદીપમા.

સાધો ! સલના યે આગ્રહ ન હૈય.

એ તો છે હુઠ્યોગના પ્રકારાન્તર,

નહીં કે રાજ્યોગના રાજમાર્ગ.

મનુષ્યની નહીં, પણ મલુનીજ ધર્યા

પ્રવતે છે સલના યે પ્રચારમા.

મનુષ્યે પુરુષાર્થ આદરવાના છે,

મલુએ મનુષ્યના પુરુષાર્થ પૂરવાના છે.

પુરુષાર્થમાં યે પુરુષે પ્રલુધર્યાને નમવાનું છે.

—ને ધતિહાસભૂલેલા વિસારે કે વિચારે,

છતાં આદર્યાંતા તે યોગ અલનિષ્ઠ મનસ્સરે,

મહાયોગીન્દ્ર ઈશ્વર શ્રિસ્તે,

મેદ્લાવર જહાજના સફરી યાત્રાળુઓએ,

હિન્દસતકાર્યા હુતાશરવિપૂજક જરથોસ્તીએઓએ,

ને અસંખ્ય સહધમેપાસકોએ.—  
 સન્તળન ! નથને લડકા  
 ને વદ્ધને વિપાદસ-ધ્યાને બદ્ધલે  
 કોકીકુલમાં ચન્દ્રકા  
 ને મુખમંડલે સુધાકર માં.  
 અલાંડમાં અલાતેજ વરસાવ.  
 તપ તપતાં યે, ઓ તપસ્વી !  
 કૃપાંગ છે શા માટે ?  
 સર્વસમપ્રથી ઓ પરમ વૈષ્ણવ !  
 સમપ્રથુના આનંદમાં ઉલ્લાસ.  
 તપના :તહારા વડા દાવાનળ,  
 જોજે, આત્મવેલને ન કરમાવે.  
 સમરંગી જગવિવિધતામાં યે  
 એક જ શ્વેત કિરણ નિષાળ.  
 સળગતી શાધી જેવા  
 હુજ માણ્યમાં દેવપ્રસાદ મગદાવ.  
 ઉરમાં આનંદ ઉછળાવ,  
 વદનચંદ્રે સ્ત્રીતરેખા રમવા હે.  
 જગતનો કુસ ઉપાડી વિચરતાં યે  
 જગતધ્યાત્રા હસતે મુખડે આચર.  
 ભીષણુ કમ્યોગમાં ઘેલતાં યે  
 મેરણા પા ચિત્તપ્રસન્નતાની ;  
 ઉમંગોમિંઓ ઉછળાવ ઉત્સવના.  
 નિરન્તર અલ છે અલાંડમાં,

ને એ અલાંગુલિ જ આદેખે છે  
જગતના સવ્વ સારાનરસા ધતિહાસ。  
માણુને મણુાવ સદા  
આ શુલાશુલ અલાડમાં યે અલાનન્દ.

સાંધુજન ! ધીરો થા.  
કર્યાં બોગવવાનાં છે સૌચે,  
પુરુષોચે તેમજ પ્રજાઓચે.  
પ્રાયશ્રિતકાળ પૂરો થયો છે  
ભારતનો કે ભારતવાસીઓનો ?  
પ્રાયશ્રિતયુગ સમાચ્યા પહેલાં  
શે ઉગશે સ્વર્ગનાં રહ્યાર  
કોઈનાં, કે તારા, કે અમારાં યે ?  
લાંબા ધતિહાસના મૈદા કર્મકાય  
બળી ભર્યું થઈ ગયા છે ?  
—પ્રજાઓ ! પ્રીણ્ણે આ પ્રાયશ્રિતયુગ  
ભરતખંડની મહાપ્રજાનો,  
ને સારવને સહયોધ એ યુગના.—  
કેટકેટલાંએ આદર્યાં છે એ તપ  
તુજ સરીખડાં અધોર ?  
શેડાંકની એવી તપશ્ચર્યાથી  
કેટલાં ને ક્યારે પ્રજણી રહેશે  
પ્રજાના ઐતિહાસિક કર્મભંડાર ?  
પ્રજાને પ્રાયશ્રિત આપે છે,

અપવાસ કરાવે છે તું;  
 એ જ છે સાચો વિધિ:  
 પ્રજાપ્રાણુના આત્મસંયમન.  
 સંયમન આત્મશક્તિને ઔર બહલાવે છે.  
 સિનાધના શિખરે દોરી જ,  
 કર્યાંના પશ્ચાત્તાપ કરાવ,  
 પ્રજનના તપોના સમારંભ આરંભ.  
 પયગ્રથરી સન્દેશ મળશે,  
 ઝુદાધ નૂર ઉત્તરશે,  
 પરમેશ્વરી પરમાનન્દ વરસશે.  
 અત્માંડલરમાં ભરતી ડોલશે  
 એ પરમ અત્માનનની.

ને એને પડ્યે છે કોણું ?  
 કસ્તૂરી શી મહેકતી તે તપસ્વિની !  
 સાધુવરની સાધ્વી નાર,  
 પત્નીઓમાં પરમ પત્ની,  
 જગતની એ તો આદર્શ ગુજરાતણુઃ  
 માણુનાથની પ્રતિકૃતિ,  
 મિયતમની પરમ શોભા,  
 જીવનના જીવિતેશ્વરનો  
 એળો આભા તેજમંડળ.  
 તપોવનની એ તો તાપસી,  
 નિર્બંધ, નિડર, નિઃસંશય.

સુખદુઃખની તડકીછાંયડીમાં,  
 જીવનવિવિધતાના વનજિપવનમાં,  
 દેશપરહેશના રણુપગથારમાં,  
 પ્રાણુની કાયા સરીખડી,  
 દેહની છાયા સમોવડી,  
 સદ્ગા સંગાથે પરવરે છે એ કુલકલ્યાણિની.  
 સ્પાર્ટા કે ચિતોડની ડે  
 ક્ષત્રિયાણુનો જણે અવતાર.  
 એ તો પરણેલી ભક્તિચારિણી,  
 એ તો સંસારિણી મહાયોગિની.  
 ગુજરાતની એ તો ગુણ્યલ:  
 ગુજરાતણુની એ તો ગુણુમૂર્તિ.  
 આથમની એ માતુશ્રી,  
 નગરની એ જેગણુ,  
 મ્રજસંધની એ પ્રેરણા,  
 જગતની સત્પત્તનીએનું ભૂપણુ,  
 અમારી એ તો અનુપમ ગુજરાતણ  
 અગવતી કસ્તુરણાઈ ગાંધી. ૭

એ નિષ્કામ કર્મચારી !  
 એ ગીતાવેલા સાધુ !  
 એ મનુકુલના મહાતમન !  
 નિઃશબ્દ તહારે તો  
 મહાભારત ઐડવાં છે સંસારના,

આત્મવાદીએ રહારે તો  
 દેહવાદીએને જીતવા છે ને ?  
 શ્રીકૃષ્ણના એ સખા !  
 એ સુદામાપુરીના વાસી !  
 એ કાલજૂનાં સત્યો  
 સાચાં પાડવાં છે ને રહારે ?  
 સૌ જાળે છે એ સર્વસિદ્ધ વાત  
 કે દેહથી આત્મનું  
 અગણો ને ઉપર છે.  
 સહુ આત્મવાદીએ ઉચ્ચારે છે આશીર્વાદ,  
 ‘જ્ય હો ! જ્ય હો !  
 ચૈતન્યપૂજાકનો રહારે।  
 સથૂલપૂજાકના સંખમાં :  
 જ્ય હો ! જ્ય હો !  
 આત્મબ્યલવન્તાનો તુજ  
 દેહબ્યલિંગ લોકપરિવારમાં.’  
 નાસ્તિકા વિના સૌ જાળે છે  
 કે દેહ નશર છે,  
 ને આત્મા અભર છે.  
 ને તુજખોધ્યાં આત્મબ્લે, મહાત્મનું !  
 એટલાંજ છે અભર આત્મહેશમાં.

પુચ્ચાસ વષેનો ઉત્સવ !  
 અધી સદી વીતી ગધ

લોકોક્ષારક પ્રજાકલ્યાણુક  
એ તહારા જરૂર્યોગ પછી.  
આવાને આજે ન હોય  
આટાટલાં આયુષ્ય.  
ઇશ્યએ એ નથી બોગવ્યાં,  
શાંકર એ નથી માયાં.  
નખસિખ ઉલયે પ્રજળતી  
મહાસત્યોની એવી જવાલામૂર્તિએની  
નથી નિર્માંદ લાંખી જીવનઅવધે.  
આનન્દો, માટે આનન્દો, પ્રજળન !  
પરચાસ વસેનો આજે ઉત્સવ છે.

મનિદરોમાર્ભ પરચાસ સ્વસ્તિકો પૂરાવો,  
પરચાસ દીપમાળા પ્રગટાવો,  
પરચાસ ઝૂલમંડલિ જરાવો,  
પરચાસ આરતીએ ઉતરાવો,  
પરચાસ દેવધંટા વગડાવો.  
તપમનિદરે આજે, એ પૃથ્વીના લોક !  
તપસ્વીનો ઉત્સવ છે, ઉત્સવ છે.

---

( ૧૮ )

## ગુજરી કુંલો



૧

અહુ ! અદ્ભુત ને રસસુનદર શી અમ દેશની કુંજધરાયો !  
 મહમાતી હૂંને જ્યાંહિ ડાયલડી, જ્યાંહિ આઅવનોની છટાયો;  
 જરથોસ્તની અનિસિખા જરૂંહાં જલે, જ્યાંહિ સૂરજવંશી નિકુંલો,  
 ગિરિગંડુર શી શુષુગંલીર એ ધનધેરી ગુજરી કુંલો.

૨

જ્યાંહિ વિનદ્યગિરિ ગરવો, શુક્ષેષાહ્તી સાતપૂડાની ચુફાયો,  
 જ્યાંહિ પ્રેમ ને શૈયાર્ની તાપીતટે હજ ગાજ રહી વીરતાયો;  
 વઠતાપસને ભુજમાં ભીડી જરૂંહાં નહીંયે ઉરદાવથી પૂજયો,  
 જલકલિ કરે જ્યાંહિ સુનદરી, એ જલભીની ગુજરી કુંલો.

૩

જ્યાંહિ ભૂલભૂલામણી ડેાતરની ગૂંથી મર્દબરથી મહી ગાને,  
 જ્યાંહિ લોલ ને વળની આડી પરે અવિદેની જ કાળી વિરાને;  
 જ્યાંહિ કુંડ લર્યાં કંધ ઉણ્ણુ નીરે, જ્યાંહિ પ્રેમહ્યારવ ગુંજયો,  
 જ્યાંહિ દુગ્રાની માળ ગન્નેન્દ્ર શી, એ ગઠગર્વી ગુજરી કુંલો.

૪

જલપુર્ખું સરોવર હેઠે રહેયાં, ઘેરી ગોમતીને તરુ ઝૂક્યાં,  
કૂદી શારદ્વેલ પ્રફુલ્લ કૂદે, જ્યાંહિ લક્ષ્મયૂર ટ્રદ્ધક્યા;  
રસિકાઉર શાં જરણ્યાં જીવતો નદ સમજલે જ્યાંહિ ઝૂંયો,  
રસવાડી ખોલી રસિયાંતી શું! એ રસવન્તી ગુજર્રી કુંને.

૫

યશમનિર જર્ખાં સુલતાની તણ્યાં, જ્યાંહિ સ્ફાટિકપાળ તળાવે,  
જ્યાંહિ શામળ ને દનપત અખો, જળમહેલ સમી વિલુ વાવે;  
જ્યાંહિ અભ્રની વેલ શી સાબ્રમતી, જિનવૈલવ જર્ખાં વહુ દ્વાર્યો,  
જ્યાંહિ દુનર લક્ષ્મીથી સોહન, એ રિધરમ્ય ગુજર્રી કુંને.

૬

જાડી કુંગરની ગદીએ મંહી દેવ વસે વનપ્રહાડાઢિંગે,  
જ્યાંહિ નીરજરાતીર વાધણુવાં રમે ભીલઆતક સંગે;  
દીંગ જેધપુરે ને ઉદ્દેપુરને ચાપધારી યશરસી અનુભે,  
કંદ વાદળ શી પથરાયલ એ વનશાલી ગુજર્રી કુંને.

૭

ઉચ્ચું, ગુજર્રીના શીષ્ફૂલ શું, અખુંદ શુંગ રસુરન્ત અચંભા,  
વળી આશિષવેણુ શિરે વરસે જગવત્સદ શ્રી જગદંભા;  
સુકુમાર સરસ્વતીનીરતીરે ધેતુ મનિર તીર્થ છુરને,  
જ્યાંહિ ક્ષત્રિયતાનું સિંહાસન, એ યશવર્તી ગુજર્રી કુંને.

૬

અદી ચોગયુદ્ધએ ગડકેશ્વરી ગિરનાર ઉભો નભ થંલી,  
જ્યાંહિ સ્ત્રીંહ લરેલ સનાતન ગીર વનો પથરાય ગોરંલી;  
નરસિંહ અરોક ને રાણુક, ધોડલી ને હરણુંધવનિ ઝેંખે,  
ધનિહાસ પુરાણી ને સેજળ એ જગન્નાતી ગુજર્રી કુંને.

૭

નદીએનાં ખુખો મંડિ જંહાં ઉરછાલક પશ્ચિમસિન્હુ ઉછાળે,  
જ્યાંહિ યાઈનીભીની દિરણ્ય હજ ય શ્રી કૃષ્ણની ભરમ પ્રજાળે;  
જ્યાંહિ રક્તિમણિનાં ઉરરવને ફણાં, મહિમા શ્રી સુદામાનો ખૂઝયો,  
ઠળી નાધેર સારસરોભી, એ કૃષ્ણસુહાગી ગુજર્રી કુંને.

૧૦

જ્યાંહિ સાહસરૈયાર્થ વરે સુન્દરી, નરનારાયણી જ્યાંહિ કુંડોા,  
જ્યાંહિ જેસલતોરલ સાથ સૂતાં તેહ કુંજલડીભર જુંડોઃ  
વસુધાના વસૂથી લચ્યાં ને નભ્યાં શું વસન્તવિભૂતિનાં પુંને,  
ઉરલાવ સમી અમ એહવી સૌ ગુણગર્વી ગુજર્રી કુંને:  
ગુણગર્વી ગુજર્રી કુંને.

